

# ચિંતનયાત્રા શી થૈતનયાત્રા

: સર્વીણ :

પ. પુ. જિનશાસનમંજુસ સક્લબંધ હિન્દુચંતક  
આચાર્યદેવ શ્રીમહ વિજયભુવનભાનુસૂરીશ્વરજી  
મહારાજાના પહોંચકાર ગીતાચિંતનોમણિ  
સિદ્ધાંતદિવાકર ગચ્છાવિપત્તિ આચાર્યદેવ  
શ્રીમહ વિજયજ્યઘોષસૂરીશ્વરજી મહારાજા

: સંપાદન :

પ. પુ. મુનિવરશ્રી સત્યકાંતવિજયજી મ.સા.

: પ્રકાશક :

શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ  
શ્રી કુમારપાણિમાઈ વી. રામ  
અં, કૃતિકુંડ સોસાયટી,  
મહારાજા પાટે, પાલક્રા-૩૮૮૮૧૦

મનુષ આવતી  
વીર સં. ૨૫૩૪  
નિ. નં. ૨૦૫૫

કિલો  
રૂ. ૩૦.૦૦

કીંચી શુંગલેવા, જે આપે મુઠિલમેવા

સ્વ. જેસેંગલાલ રામયંદ પાટણવાળા પરિવાર  
સ્વ. સેંગલાલ ભોગોલાલ પાટણવાળા પરિવાર  
૬. આનંદીબેન

આપના સ્નેહ અને ઓછાયેમધા સહયોગની  
અનુભૂતિ અનુભૂતના.

: પ્રાપ્તિકણાન :

(૧) દિવ્યદર્શિન ટ્રસ્ટ

૩૮, કલિંકુદ સોસાયટી  
મહાલીપુર ચાર રસ્તા, પોણકા  
૩૮૮૮૧૦

(૨) અરવિંદમાઈ જે. ચાહ

૮૮, શેન મેમાન ગ્રાન્ટ,  
બીજું મારી,  
મુખ્ય - ૨

(૩) લાલમાઈ નિકમલાલ

૪૫૬/અ, શાંતિનાથની પોણ,  
હાતા પટેલની પોણમાં, રિલિફ રોડ,  
અમદાવાદ - ૧

(૪) રસિકલાલ રત્નલાલ શાહ

નેલ, કે. ૨૨૭ બિલ્ડિંગ,  
પાંચુવા,  
અમદાવાદ - ૧

શ્રી સંભેદકર પાર્વતીલાલાલ નમ:  
શ્રી પ્રેમ - બુધલભાનુ - જગધોપસ્તુરી - સૂર્યકાંત વિજય ગુરુન્દ્રો નમ:

### ચિંતાથી ચિંતન તરફ

ચિંતા અને ચિંતાના અનુસરોમાં આમ જોવા જઈએ તો જગ્યોફરક ન હેખાય,  
કેવળ એક અનુસ્વાર જ વધુ લાગે, પરંતુ જ્યારે તેનો અર્થ કરવાનો હોય ત્યારે  
જ ખ્યાલ આવે કે બને વરબે કેટલું અનેર છે, જો કે ચિંતા એ ચિંતા સુધી  
પહોંચવાનો રસ્તો જરૂર છે, અથડાં ચિંતા એ માર્ગ છે તો ચિંતા એ મંજિલ છે.

ચિંતા અને દ્વિધા, ઉદ્દેશનતા અને સંતપ્તનતા, હતારા અને બેચેની જીંસો  
મનુષ્યના જીવનના પરાંયો બની ગયા છે. હર કોઈ વ્યક્તિ એક યા બીજા  
પ્રોબ્લેમથી ઘેરાયેલી છે, અવનયા પ્રશ્નો તેની સામે મોં કારીને ઊભા છે, તેનું  
જીવન આખુય ચિંતા - વિચારદમ્યબની ગયું છે.

ચિંતાની અગનજીવાળા બોથીધેરાયેલ આ જગતમાં ભળાભળ વહેતા જરસા  
શા ચિંતનના સહારે આગની વરબે પણ અપૂર્વ શાંતિને અનુભવતા મહાપુરુષો  
હોય છે, તેમના જીવનને નાની સરાખી જીવાળા પણ સ્પર્શની નથી લોતી.

આમ તો ચિંતા અને ચિંતન અનેનું ઉદ્દ્દ્દ્વાસ્યાન એક જ છે - ચિંત... પણ  
એટલા માત્રથી શું થાય? ગુલાબ અને કાંટાની જન્મભૂમિય ક્ષાં જુદી છે? છતાં  
એક સુનેખ પ્રસરાયે છે તો બીજો હંદ, પોડા ઊભા કરે છે, એજ રીતે ચિંતા  
મનુષ્યને વૃધ્ય બનાયે છે તો ચિંતન જીવનને સમૃધ્ય બનાયે છે, ચિંતા જીવનને  
વેરાન કરે છે તો ચિંતન મનુષ્યને નંદનવન ઊભુ કરી આપે છે, કારણ ચિંતાની  
પાછળ મોહ અને અશાન (આવંગ) કામ કરતા હોય છે, જ્યારે ચિંતન શાન  
અને વિવેકના સહારે ચાલતું હોય છે.

જ્યાં શાન અને વિવેકનો પ્રકાશ જગારા મારતો હોય ત્યાં ચિંતન કેવું ચાલતું  
હોય તેનો પ્રત્યક્ષ નમૂનો એટલે જ પ્રસ્તુત પુસ્તક...

અને ચિંતનથીલ વ્યક્તિનું જીવન કેવું થાય, ઉદાત થીય તેનું જીવલંત  
ઉદાહરણ એટલે જ આ પુસ્તકના લોખક પૂજ્યપાદ દાદાગુરુંદ્વ ગણ્યાપિપતિ  
આ, શ્રી વિજય જ્યથોષ સુરીધરજી મહારાજા.

પરિચયમાં આવનાર વ્યક્તિના મુખમાંથી સહસ્ર જ આ પેંકિલાંઓ સરી

પડતીલોય છે..

‘પન્થવદનએ મહાપુરુષનું કલેશતણું જ્યાં નામ નથી,

કાચ્ય રમે જેના હોઠો પર રાગ-દેખને સ્થાન નથી...’

સ્વર્ગસ્થ પુ. ગુરુદેવો પૂ. અન્ન. શ્રી પ્રેમ સુ. મ. અને પૂ. આ. શ્રી ભૂવનભાનુસુ. મ. ની અતુલકૃપાના બ્રહ્મ ગજબની ચિંતનશક્તિને પારવું કરતા પૂજયશ્રીના લાયમાં કોઈ પણ શ્લોક મુક્ત કે શાલ્ઘાંધીના આપો, કથા પરો કે જીવનની કોઈ વાત કરો તેના ઉંડાશમાં જઈ અદ્ભુત રસસ્થોને ભોલી આપે છે.

પ્રેરણું પુસ્તકમાં આવા અનેક શ્લોક, પંક્તિઓ, ઉચ્ચારોના એહુંપર્યને ગુરુદેવશ્રીએ પ્રગટ કર્યા છે તેમાંના કટલાક અંશોને જોઈએ.

( ૧ ) શ્લોક : સંસારાવત્ત નિપાળો, ઘૃણામાનો વિવચતન : ।

અધ્યાત્મ જનો યાતિ, નિકટે ઽપિતટે હહા ॥ ( લેખ નં. ૧ )

પરગુણગૃહણં છેદાણવતર્ણહિ અમકક્કસંવદણં ।

ણિચ્ચં સદોમગૃહણં અમંતમૂલં વસીકરણં ॥ ( લેખ નં. ૧૩ )

( ૨ ) પંક્તિ : ધર્મો સુદૃષ્માચિદ્બુદ્ધ । ધ્યાનો ઽનતસંસારયોદૃષ્ટેન કર્મણા ।  
સાધ્યાદર્શનશુદ્ધયો જ્ઞાનનિ વિરતિમેવ ચાન્નોતિ ॥

( ૩ ) યોગ સંગ્રહના પ્રથમગુણમાં આપતી અદ્ભુતમલ્લની કથાને ખોલવામાં તો પૂજયશ્રી એ કમાલ કરી છે. રોજ-અરોજની વાતો પણ આની અંદર સાંકળી લેવામાં આવી છે.

આવી કેટલીય આખ અને અંતરને તૃપ્ત કરી હે તેવી વાતો જાણવા-માણવા મળશે. પૂજયશ્રીના ચિંતનનો અભ્યાસ અને અધ્યાસથી લખતા હોય છે તેના કારણે આપણો ચેતનાનો આવિષ્કાર કરવા માટે આ પુસ્તક અતિ ઉપયોગી બનશે એમ નિઃશંક માનું છું. આ લેખોને વ્યવસ્થિત કરવા મુક્ત વિ. જોવામાં સહાયક બનનાર મુનિવર શ્રી સંયમભોગિ વિ. મ. નો આભાર માની એટલી આશા રાખું છું કે પુસ્તકના વાંચન દ્વારા ચિંતામાંથી મુક્ત બની ચિંતનના સહાયે ચેતના પ્રાગટ્યના ભાર્ગ આગળ વષતા આપણે સૌ એક 'હિ' ચિદાનંદમથ બનીએ.

સત્યકાંતપિલાય

## સંસારાવર્તનિમગ્નો ઘૂર્ણમાનો વિચેતન : ।

### અથ એવ જનો યાતિ નિકટે ઽપિ તટે હહા ॥

અહીં સંસારને આવર્તની ઉપમા આપી છે. સંસાર દ્વય અને ભાવ એ મફારે છે - દ્વયસંસાર અસાવપ આત્મા માટે ભાવ સંસારની તીવ્રતા કરે છે, ભાવ સંસારના આવર્તન્યકાવામાં વેરાય છે. ભાવ સંસારના ચક્કાવામાં વેરાયેલાને દ્વયસંસાર હોય કે ન હોય, આપત્તિ કદાચ સંપત્તિરૂપ હોય તો પણ એ ચક્કાવામાં વેરાયેલ છે.

દ્વય સંસાર એટલે ભાવ અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ, અનાથી છુય મમતા - દેખ - ગારવરૂપ, કષાય વિષયોની ભાવના - વાસનારૂપ ભાવ આવર્તમાં કસાય છે, ભાવ આવર્તમાં છુય જેમ જેમ કસાય છે, જેમ જેમ મોહ, મમતા, રાગ, દેખ, કષાયના બંધનો ગાડ ચાય છે તેમ વિષેક, ચેતના, સદ્ગ્વિચાર, યોગ્ય-અયોગ્યતાની વિભાજન શક્તિ, કર્તવ્યાકરણતાના સ્વીકારરૂપ આંતરિક ચેતના, આત્મ વિષયક ચેતના દબાય છે, અમરીથી આંખો ફર છે, સ્વિર - સ્વિત યોગ્ય બોધ થતો નથી, આ અમરીના અમરીની અસર છે.

અમરી બધું કરતું હેખાડે જ્યારે મોહની અમરી, ભાવસંસાર આવર્તની અમરી જગત્સ્વરૂપને સ્વિર, ઉપાદેય, સારં, ગુપ્તકર લગાડે અને આત્મસ્વરૂપને અસ્વિર, હેય, હુંઅકર, નુકશાનકર, નકામું લગાડે.

દ્વય આવર્તના કારણે છુય નીચે પાતાળમાં ઉત્તરે છે તેમ મોહાવર્તના કારણે છુય દુઃખ, અજ્ઞાન, અવિષેક, પરવશતા વગેરે સર્વદોષોધી વ્યાપ થતો, આત્મ સ્વરૂપને ઢાંકતો, ગુણોની ભૂમિકાથી નીચો ઉત્તરતો જાય છે.

આ આવર્તમાં કસાયેલા અમજ્ઞાથી, જ્ઞાનચેતનાના દ્રારા અને નાશથી ગુણો-સ્વસ્થતા, સમતા, આત્મ સ્વરૂપની સાપના વગેરે અને મોહ માર્ગ તથા મોહ કિનારો નજીક હોવા છતાં તે જોઈ રાકતા નથી, મેળવવા ઈચ્છતા નથી, મેળવી શકતા નથી.

સારાંશ :- સંસારમાં સંસારી છુયો અને સાધક છુયો બન્ને છે. એમાં

સાધક જીવો મોહ આવર્તમાં કસાયા નથી તેથી સર્વત્ર ઉચિત વ્યવહાર કરે છે. અનુકૂળતામાં કસાતા નથી, પ્રતિકૂળતામાં બેંચાતા નથી, સારી વસ્તુ લેવા સંઘરસવા ભોગવવા લલચાતા નથી. હલકી - ઉત્તરતી વસ્તુ કેંકી દેતા નથી, એના ઉપર તિરસ્કાર અર્થાં કરતા નથી, ભાવતી ચીજ ખાવામાં રાગ કરતા નથી, અણગમતું ખાવામાં અકળાતા નથી, પ્રશંસાધી આકર્ષાતા નથી, નિંદા તિરસ્કારથી ઉદ્દ્દિગ્ન બનતા નથી, મેલા કપડા-મેલા શરીર વગેરેથી અકળાતા નથી, એનાધી પોતાની ડિમત ઘટેતી નથી લાગતી. સંસારની દરેક ચીજ અને દરેક પરિસ્થિતિને પોતે પારકી - અપ્રધાન - અનિત્ય રૂપે જોતો, એના દ્વારા આત્મગુણો કેળવતો અને મમતા-મોહ-રાગ-દેખ-કથાયને રોકતો, વિષય પરાન્યુભ, ઈન્દ્રિયનિગ્રહતત્પર, સ્થિતબુધ્ય, દરેક વાત આત્મગુણથી ડેખ-ઉપાદેય તરીકે જોતો, વિચારતો અને શક્ય પદ્ધતિ - પારિસ્થિતિથી આચારતો આરાધના કરે છે, ગુણ પામે છે, મોકશના કિનારે પહોંચે છે.

#### આવર્તમાંથી નીકળવાના ઉપાયો :

- (૧) અનુકૂળતાને બને તેટલી છોડતા રહેવું.
  - (૨) જીવનમાં ડિમતી, ભબકાવાળી સારી ચીજોનો ત્યાગ કરવો.
  - (૩) સાદાઈમાં વિતને નભાવવા ભાવિત બનાવવું.
  - (૪) સહનશીલ બનવું, ત્યાગ, તપ, ઉગ્રચર્યા દ્વારા પ્રતિકૂળતા સહન કરતા રહેવું.
  - (૫) શાન, ધ્યાન, નિર્દોષ ચર્ચા દ્વારા સહન કરવા ભાવિત બનવું.
  - (૬) શાન્દ સહન શક્તિ ઉત્પન્ન કરવા આકોશ પરિષ્હેની ભાવના ભાવવી અને તે રીતે અન્ય પ્રતિકૂળ પરિષ્હેની કલ્પના અને ભાવનાધી આત્માને સ્વસ્થ રાખવાની વિચારકા કરવી.
  - (૭) અનુકૂળતામાં ત્યાગ અને ઉદાસીન ભાવના ઉત્પન્ન કરવા અનિત્ય, અશરણ, અશુદ્ધિપણું, સંસાર સ્વરૂપ, એકત્વ, અન્યત્વ વગેરે વારંવાર અનુકૂળ વસ્તુ-વ્યક્તિ પર વિચારવું.
- ભાવનાઓ, શાનાધ્યાસ, શુદ્ધ આચારની નિરંતર પ્રવૃત્તિ, ચિંતનના સંસ્કરણી

જીવ આવર્તની બહાર આવે છે. આનાથી જીવ ચેતના પામે છે, યક્રી-બ્રમરી દૂર થાય છે, કિનારો અને કિનારાનો રસ્તો જગ્યાય છે તે બાજુ જીવ ચાલે છે, અને કિનારો પામે છે.

### ગુરુચો-સાધુઓ-સાધર્મિકની

(૧) સેવા કરીએ, અનુકૂળ વર્તિએ, અનુમોદના કરીએ, પ્રશંસા ઉપભૂષણા કરીએ, સહાય કરીએ તેમ આવર્તમાંથી બહાર નીકળાય.

(૨) જીવનમાં આચારની કાળજી, સાયુ તેમજ આવકપણાના ગુણો રોજ યાદ કરી તેની કાળજી, અભ્યાસ, આંતરિક પરિણાતિ વગેરે જેટલી ચીવટ સેવાએ એટલો જીવ આવર્તમાં ફસાય નહિ, આવર્તમાંથી બહાર નીકળતો જાય, આનાથી વિપરિત વૃત્તિ અને પ્રવૃત્તિ તે આવર્તમાં ફસાવાના ઉપાયો છે, અને આ આચારનું લક્ષ એ મોંસે જવાનો, બ્રમણા ઘટાડવાનો, આવર્તમાંથી બહાર નીકળવાનો ઉપાય છે.

(૩) નિંદા, અવશા, સેવાની ઉપેક્ષા, પ્રતિકૂળ વર્તન, ઉદાસીનતા, સહાય ન કરવી, આ બધાથી આવર્તમાં જીવ ફસાય છે.

માટે જીવનમાં પ્રત્યેક વાકી- વિચાર- વર્તનમાંથી અસદ વિચાર- વાકી- વર્તનને સુધ્યારવા કાળજી રાખવી, બીજાના અસદ-વિચાર - વાકી-વર્તનમાં ઉદાસીનતા- ઉપેક્ષા ભાવ રાખવો અને અભ્યાસ, પરાવર્તન વગેરે દ્વારા સતત તરફની રૂચી કેળવવી અને સદ્ભાવના વિચાર - વાકી - વર્તનને જીવનમાં વણવા સતત કાળજી રાખવી.

બીજાની સદ્ભાવનાઓ અને વિચાર- વાકી- વર્તનની પ્રશંસા, ઉપભૂષણ, અનુમોદના વારેવાર કરવી.

આમ કરવાથી મોહના-કષાયના-વિષયના આવર્તો અને ચકાવામાંથી જીવો બહાર નીકળે છે એટલે કે અસદ શાન, મિથ્યા માન્યતા-અસદ આચાર જન્ય અસદ ભાવના અને સંસ્કારોના ઔદ્ઘટિક ભાવરૂપ આવર્તમાંથી બહાર નીકળી સદ્વિચાર-વાકી-વર્તન, આત્મગુણોનો અભ્યાસ અને સદ્ભ ભાવનાઓ દ્વારા સંસ્કારોના કષ્યોપશમભાવ પામી જીવ સીધા માર્ગ ગતિ કરી ક્ષાપિકભાવ રૂપ મોક પામે છે, કિનારે પહોંચે છે.

## ○ ॥ ભ્રામ્યન્તે જનતસંસારમહો દુષ્ટેન કર્મણા ॥ ○

સંસારી જીવ સંસારમાં અનેક નિયંત્રકોથી વ્યાપ છે. દરેક જીવોને કર્મનું, સંયોગોનું, વ્યક્તિનું, જ્ઞાનનું- એમ અનેક પ્રકારે નિયંત્રક હોય છે. કર્મનું નિયંત્રક સંસારી બધા જ આત્માઓને હોય છે. તે કર્મ બે પ્રકારના હોય છે, શુભ અને અશુભ. જે જે કર્મો જીવોએ નિર્માણ કર્યા હોય અને જેનો બીજી રીતે ફેરફાર ન થાય તો તે કર્મ ઉદ્યમાં આવતા જીવને તેવા પ્રકારે વર્તવા નિયંત્રક કરે છે. ગાંડિપદાના કર્મો જીવને ગાંડિપદ આપી પરવશ બનાવે છે. તેવી રીતે તોતડા, બોબડા, બહેરા, આંધળા, મૂર્ખ, રોગી, દરિદ્ર, દુઃખ્યર, અનાદેય, અપયશ, અવિવેક વગેરે અવસ્થાઓમાં અમુક કાળ જીવને જકડી રાખે છે. કર્મજન્ય સંયોગો પણ જીવને જકડી રાખે છે.

આ જકડામકા બે પ્રકારની છે- (૧) બદલાઈ શકે- છૂટી શકે, (૨) ન છૂટી શકે. અશુભ કર્મોના ઉદ્યથી જેમ અશુભ કણરૂપ જીવને નિયંત્રક થાય છે, તેમ શુભ કર્મોના ઉદ્યથી શુભ કણરૂપ હોવાના છતાં જીવને એમાંથી છુટવા મળતું નથી, માટે નિયંત્રકરૂપ છે. પરમાત્માના આત્માને પણ નરકના દુઃખમાંથી છુટવા મળતું નથી, અને મહાવૈરાગી હોવા છતાં સ્વર્ગના બીજિક સુખમાંથી પણ છુટકારો મળતો નથી. જેમાંથી છુટકારો ન મળે તે નિકાચિત નિયંત્રકા કહેવાય, જેમાંથી શક્ય પ્રયત્નથી છુટકારો થાય તે અનિકાચિત, ઔપકમિક, કર્મ પ્રયુક્ત નિયંત્રકા કહેવાય.

જે નિકાચિત કર્મની નિયંત્રકા હોય છે તે બે પ્રકારે હોય છે- સાનુંધ અને નિરસનંધ.

જે જીવ દુઃખમાં પીર્ય- સમતા રાખે તે કર્મનો બોગવટો પાપ અનુંધ તોડે છે. નવું પાપ બંધાતું નથી કે પાપકર્મના અનુંધો પડતા નથી. સાથે પુષ્પ બંધાય, પુષ્પના અનુંધ બંધાય એ રીતે સુખમાં પણ નિકાચિત કર્મના ઉદ્યમાં આસક્ત ન થવા હે. વૈરાગ્યભાવના, ઉદાસીનતા વગેરે કેળવે તો સુખના ઉદ્યક્તિમાં પણ પાપ ન બંધાય, પાપના અનુંધ ન પડે. પુષ્પ બંધાય અને

પુષ્પના અનુભંગ પડે.

આથી વિપરીત કરે, અર્થાતું બની અવસ્થામાં ધમપછાડા- દીનતા- અનેક વ્યાકુળતાઓ- વારણના અનેક વિવેકદીન ઉપાયો કરે તો નવું પાપ બંધાય, નવા પાપના અનુભંગ પડા બંધાય. અર્થાતું ભવિષ્યના નવા નિયંત્રણો- પરાધીનતાઓ તૈયાર થાય.

એ રીતે સુખમાં પણ મસ્તિ- પ્રશંસા- ગર્વ- બીજાનો તિરસ્કાર વગેરે કરે તો તેથી પાપ અને પાપના અનુભંગ પડે. પુરુષ કે પુરુષના અનુભંગ ન બંધાય.

આ જે નિયંત્રણ ફરી ન શકે, તેવા કર્મના નિયંત્રણની વાત થઈ. કર્મના ઉદ્ઘો કરી શકે તે માટેના ઉપાયો છે દ્રવ્ય- સેત્ર- કાળ- ભવ- ભાવ.

અપલક્ષણવાળી ચીજના સાનિધ્યથી દુઃકારક કર્મ ઉદ્ઘમાં આવે અને સારા લક્ષણવાળી પસ્તુથી શુભકર્મ ઉદ્ઘમાં આવે છે. તે રીતે અમૃક કોત્રમાં અમૃક કર્મનો સહેલાઈથી ઉદ્ઘ થાય રૂક્ષોત્ર- સ્નિગ્ધોત્ર- કુરુકોત્ર- સિદ્ધોત્ર....

એ રીતે કાળના હિસાબે યુગાલિક કાળ- છઢો આરો- ઉનાળો- શિયાળો વગેરે.

ભાવના હિસાબે આવેશથી- અભિમાનથી- માયાપ્રાપ્યથી- લોભથી- કામથી- હાસ્યાદ્ધથી અશુભ કર્મો ઉદ્ઘમાં આવે. એ રીતે એના નિગ્રહથી સારા કર્મો આવે.

ભયોના હિસાબે પણ કર્મ ઉદ્ઘમાં આવે.

આવા અનેક પ્રકારના કર્મ નિયંત્રણો મોકસ સુધી રહે છે, પરંતુ અશુભ કર્મનું નિયંત્રણપણું- વિશેષ મોહનું- અજ્ઞાનનું- અવિવેકનું નિયંત્રણ ઘટાડવા અને સંપૂર્ણ દૂર કરવા માટે ધર્મગુરુઓનું- સાધીર્ભકોનું- સંઘનું- જ્ઞાનીનું- જ્ઞાનનું- આત્મજાગૃતિનું- પંચાચારનું- પરસાક્ષીનું- મર્યાદાઓનું નિયંત્રણ છે.

નારક કર્મ પરવશ છે, એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને તિર્યંયો પણ કર્મ પરવશ છે.

સંખ્યાત વર્ષવાળા મનુષ્યો અને ભારમા દેવલોક સુધીના દેવો પોતાના નાયક, સમૃહ વ્યવસ્થાને પરવશ છે. આ નાયક કે સમૃહ વ્યવસ્થાની પરવશતા

જીવને અનેક પાપોથી તેમજ સ્વચ્છંદતાથી નિરંકુશપણે પ્રવર્તનાથી અટકાવે છે.

લૌકિક પરવશતા હોય તો લોકો બેગા રહી રહે. નાતના- સમાજના- રાજ્યના- નગરના- મુનિસિપાલિટીના કાયદાકાનુન પાળે તો સ્વ-પરને અનેક બૌતિક લાભ થાય અને શાંતિ મળે.

આ પરવશતા વગર નિર્ધિયોને લૌકિક લાભ અને શાંતિ નથી હોતા.

આ પરવશતા સમજુ સજજનો, વિદ્વાનો જાતે પણ રાખે છે, બીજા પાસે રખાવે છે. જેમ જેમ લૌકિક આત્મનિયંત્રણ વધે, વ્યવસ્થિત થાય તેમ સુખશાંતિ વધારે થતી આવે. પરનિયંત્રણ અમૃક કોટીની જધન્ય મર્યાદા સુધીના હોય છે. તે પ્રાય: ફરજ્યાત અને સામુહિક હોય છે. જ્યારે આત્મજ્ઞાનપ્રયુક્ત નિયંત્રણ અનેક બેદવાળું, તરતમલેદ્વિ વધતું જતું વ્યક્તિગત આત્મજ્ઞિથી ઈજા પ્રયુક્ત ફરજ્યાત હોય છે.

કાયાની પ્રવૃત્તિનું નિયંત્રણ કર્મ, કાયાની શક્તિ, બાલસંયોગ, બીજાના રોકાણથી પણ થાય છે અને આત્માના વિવેક અને જ્ઞાનથી પણ થાય છે. મુખ્ય નિયંત્રણ અધ્યાત્મજ્ઞાનપ્રયુક્ત મનનું નિયંત્રણ છે. તેનાથી સંસારનો નાશ થાય છે. વચન અને કાયા પરના અંકુશ કર્મના ઉદ્દ્યથી અને બીજાના દબાણ- ઉપરોક્ષથી બધા જીવાને ઓછાવતા અંશે હોય છે છતાં તે નિયંત્રણ મનના નિયંત્રણ વગર વિરોધ ફળદાયક થતા નથી. અનાદિકાલીન કુસંસ્કાર, કુપ્રવૃત્તિ અને કુવિચારજ્ઞાના કારણે મન પાપ વાસનાથી નિયંત્રિત છે અને તેના અનુસારે પ્રવર્તે છે.

હવે એના નિયંત્રણમાંથી છોડાવવા માટે પ્રથમ કુપ્રવૃત્તિ છોડાવવી જોઈએ. તે માટે ગુડુ- ગુરુકુલ- સંઘ સાધ્મિકની રોકટોક, પંચાચારમાં નિયમિતતા, પંચાચારથી વિપરીત આચારેથી નિવૃત્તિ- વગેરે વ્યવહાર નિયંત્રણ કરતું જોઈએ. તે પછી વૈરાગ્ય, અનિત્ય, અશરણ વગેરે ભાવના તથા મૈત્રી આદિ ભાવનાઓ અને શાશ્વતાન દ્વારા માનસિક દ્રષ્ટિ બદલાય અને સદ્બાવના પક્ષપાતાં આવે. તેથી શાન દ્વારા આત્મા પોતાના મન ઉપર જાતે જ નિયંત્રણ કરે. એ રીતે વચન ઉપર પણ નિયંત્રણ કરે. આ રીતે મોકામાર્ગ એટલે જ્ઞાનપ્રયુક્ત મન, વચન

અને કાયાનું આત્મ નિયંત્રણ અને ગુરુ, સાધ્યિક, સંઘર્ષયુક્ત નિયંત્રણ, પંચાચારરૂપ, પ્રતોરૂપ, વાડોરૂપ, મૂળગુણો, ઉત્તરગુણો તથા સામાચારી વગેરે થાય.

જીવ સંસારમાં ક્યાંય સ્વતંત્ર નથી. શાન અને ગુરુ દ્વારા ધર્મપરતંત્ર તેમજ કર્મ અને મોહ દ્વારા કર્મપરતંત્ર છે. કર્મપરતંત્રતા અનંતાનંત કાળ માટે છે અને અતંત દુઃખરૂપ છે. ધર્મપરતંત્રતા પરિમિત કાળ માટે છે અને સર્વ કાળની પરતંત્રતાથી છોડાવી સંપૂર્ણ સ્વતંત્ર બનાવે છે.

સ્વરૂપ અવસ્થાન તે સ્વતંત્રપણું છે - પરદ્યે અવસ્થાન તે પરતંત્રપણું છે.

સ્વરૂપ અવસ્થાનમાં અંતરાય કરનાર મોહ, અશાન, વિષય, કથાયના આવેશો, મિથ્યાત્વ, અશુભ યોગો વગેરે કર્મપરતંત્રપણું છે.

જેને ગુરુને પરતંત્ર ન રહેવું હોય તેને બલોલવ અનેક લેલાગુઓને પરતંત્ર રહેવું પડે છે. જેને સાધ્યિક અને સંધને પરતંત્ર નથી રહેવું તેને નોકર, ગુલામ વગેરે રૂપે અનેકાનેક ને પરતંત્ર રહેવું પડે છે. જેને તપ પરતંત્ર નથી રહેવું તેને રોગ, પથ્ય અને ડોક્ટરને પરતંત્ર રહેવું પડે છે. જેને ત્યાગપરતંત્ર નથી રહેવું તેને બોગાન્તરાય, ઉપબોગાન્તરાય, લાભાન્તરાયથી પરાખીન બીજારી બનવું પડે, કશું મળે જ નહીં.

જેને આરાધનામાં શક્તિનો ઉપયોગ નથી કરવો તેને વીર્યાન્તરાયથી શક્તિહીન પરવસ બનવું પડે. જેને પરસેવાનું પરતંત્રપણું નથી જોઈતું તેને કોઈ સેવા કરનાર ન મળે, અને અતંત વિષમસ્થિતિ અનુભવતો બધાનો દ્યાપાત્ર બને, સેવા લેવાની પરતંત્રતા આવે. અને ઐસા કે જીવનવ્યવહાર માટે અનેકોની સેવા કરવી પડે, મજૂરપણું પણ મળે.

જેને શુભાશુલ વચનનો વિવેક રાખીને શુભ વચનનું પરતંત્રપણું નથી જોઈતું તેને બધાની ગાળો ખાવાનું, સાંભળવાનું પરતંત્રપણું મળે છે.

જે સારી બાબતોમાં પરતંત્ર બની સહાયક બને છે, અનુકૂળપણો વર્તે છે, તેને બીજા પણ પરતંત્ર બની અનુકૂળ વર્તે છે.

કર્મરાજના ઉ કાયદા છે:- (૧) જે કર્મને અનુકૂળ કરવા મહેનત કરે, બધે

અનુકૂળતા ગોતે, સુખસાધની, માનવાન, ધન, કુરુક્ષ ગોતે અને પ્રતિકૂળતામાં અકળાય, ભાગે તે આત્માને કર્મ પ્રતિકૂળ બને છે, અનુકૂળતા તેનાથી દૂર ભાગે છે, પ્રતિકૂળતા સદા તદ્વસ્થ નોકરની જેમ હાજર રહે છે. (૨) જે કર્મજન્ય અનુકૂળતા- પ્રતિકૂળતાની ઉપેક્ષા કરે છે, એની પરતંત્રતાને ગણકારતો નથી, એને પ્રધાનતા આપતો નથી તેને કર્મચાર બધી રીતે અનુકૂળ થાય છે. તેનાથી પ્રતિકૂળતા ચારેબાજુથી ભાગી જાય છે, અને અનુકૂળતા સદા વળગેલી રહે છે. અને (૩) જે કર્મની સારી પરિસ્થિતિઓને છોડી દે છે, અને નરસી પરિસ્થિતિઓમાં પણ ધર્મ પ્રધાન કરે છે તેને કર્મ પણ છોડી દે છે, અર્થાત્ તે આત્મા વહેલાસર મોંકે જાય છે, કર્મના સંકાળમાંથી છુટે છે.

કર્મની પરતંત્રતામાંથી છુટવા માટે- (૧) ધર્મની પરતંત્રતા જીવનના દરેક ક્ષેત્રમાં દરેક વિષયમાં દરેક રીતે સ્વીકારવી જોઈએ, (૨) કર્મની પરતંત્રતાને પ્રધાનતા ન આપત્તા ઉપેક્ષા અને ઉદાસીનતા રાખી વેઢી લેવી, પસાર કરવી, મનમાં સમાધિ રાખી શુભ લાવનાઓમાં લીન બનતું.

આમ કરવાથી જીવ કર્મપરતંત્રતામાંથી સદા માટે મુક્ત બની સ્વરૂપાવસ્થાને પામે છે.



## ○ પ્રમાદ- છૂપો પણ મહાભતરનાક શાશુ ○

(પ્રમાદ:- જે વસ્તુ- વાકી- વિચાર- વર્તન- સંયોગ વગેરેથી કે જે કારણોથી જીવ આત્મલક્ષ ભૂલે, પુદ્ગલાનંદી બને, આચાધનાને અપ્યધાન કરે, આચારને દુષ્પિત કરે, કથાય- વિષય- એશ આરામ અને એના સાધનોને કથાય વિષયના વલશાધી છુંછે, સ્વીકારે તે બધી વસ્તુ વગેરેને પ્રમાદ કહેવાય.)

શેલકજી- કંડરિકની જેમ ભાવતી વસ્તુ જીવને રસગારવરૂપ પ્રમાદ કરાવે. ન ભાવતી વસ્તુ જીવને રસ ગારવના કારણો દેખરૂપ પ્રમાદ કરાવે.

આપકી કંદેર અપ્રેયવાકી એ સમતા- સૌભ્યતાના નાશનું કારણ છે, આપણા અહંકારો પ્રમાદ છે. મધ્ય એ અસ્વાધીનતાનું કારણ છોવાથી પ્રમાદનું કારણરૂપ પ્રમાદ છે, એની અસરાધીન જીવ એ કાર્યરૂપ પ્રમાદ છે.

સારી વસ્તુઓ શબ્દાદિ વિષયરૂપ છે એ કારણરૂપ વિષય પ્રમાદ છે. એ રીતે ધન વગેરે પણ કારણરૂપ વિષય પ્રમાદ લેવા. એનાથી આનંદ પામતો જીવ, પ્રતિકૂળતામાં દેખ અરૂંધિ કરતો જીવ, એની આંશંસા કરતો જીવ આ કાર્યરૂપ વિષય પ્રમાદ છે.

કથાય- નોકથાય ઉત્પાદક ચીજો વગેરે કારણરૂપ પ્રમાદ કહેવાય, એથી જીવને જે કથાય કોઈ-માન-માયા લોલ વગેરે થાય અને નોકથાયો થાય તે કાર્યરૂપ ભાવ કથાયરૂપ પ્રમાદ કહેવાય.

નિત્રા, અનુપયોગ, નિરર્થક પ્રવૃત્તિ, આસક્ત પ્રવૃત્તિ, અન્ય આસક્ત પ્રવૃત્તિ (વિચાર અન્ય, પ્રવૃત્તિ અન્ય) આ પ્રમાદ છે. ઝી- દેશ- ભોજન- રાજ્ય (વિકથાના કારણભૂત ચાર પદાર્થ) આ ચાર ઉપલક્ષણ છે. એની રૂચિ વગેરે પ્રમાદ છે, આત્મસ્વરૂપ- મોક્ષમાર્ગ અને એના સાધનો સિવાયની જગતની તમામ વાતો એ ગૌણ- મુખ્ય રીતે પ્રમાદનું કારણ છે અને જીવના રસને જગાડે- વધારે છે તેથી એ પ્રમાદ છે.

માટે આ ચારના ઉપલક્ષણથી

સાંસારિક તમામ વાતો- વ્યવહારો વગેરેની કથા પ્રમાદ છે. એ રીતે તેવા

વાંચન વગેરે પણ પ્રમાદ છે. જેનાથી જીવ પાપસ્થાનના રસવાળો થાય, પાપ પ્રવૃત્તિવાળો થાય, ખર્મ સ્વાનનો રસ થટે, ખર્મ કિયા થટે, અંતર્મુજતા થટે તે બધાને પ્રમાદ કહેવાય.

અત્યંત મદ- જેનાથી ઉત્પન્ન થાય તે પ્રમાદ કહેવાય, જેનાથી કર્તવ્ય- અકર્તવ્ય, દેય- ઉપાદેયપણું, ઉચિત- અનુચિતપણું જીવ ભૂલી જાય અથવા તદ્દનુસારે જીવન બ્યવહારમાં ન પ્રવર્તે, રાગ દેખાધીન થઈ અનુચિતપણે વર્તે તેવી જીવની પરિસ્થિતિ સર્જનાર વસ્તુ- વાકી- વર્તન વગેરેને પણ પ્રમાદ કહેવાય અને આંતર પરિશામને પણ પ્રમાદ કહેવાય.

આ પ્રમાદ યોગદુષ્પણિધાનરૂપ છે, યોગદુષ્પણિધાનથી ઉત્પન્ન થાય છે, તીવ્ર બને છે. આધારાભૂતિને લાડવા અંગે “મને મળવા જ જોઈએ” આંતું માનસ દુષ્પણિધાન થયું, તેની પાછળ રૂપપરાવર્તન વગેરે અનેક પ્રમાદ સર્જયા.

માટે મૂળભૂત પ્રમાદ યોગ દુષ્પણિધાન છે. યોગ છોડી શકાય તેમ નથી અને અમાં દુષ્પયુક્તપણું દુષ્પણિધાન, આંતરિક ક્ષાય પરિશિત, વિષયપરિશિત, અનુપયોગ વગેરેથી આવે છે, તેનાથી કર્મ બંધાય છે અને ઉદ્યમાં આવે છે. વૈરાગ્ય ભાવના અને સાવધાની દ્વારા યોગના દુષ્પણિધાનને રોકવાથી પ્રમાદ રોકાય છે. આહી દુષ્પયોગથી દુષ્પણિધાન થાય છે, દુષ્પણિધાનથી દુષ્પયોગની પરંપરા થાય છે. માટે પ્રથમ નંબરમાં અનુપયોગ થવા ન હેવો. જે “સમય ગોપય મા પમાયને” દ્વારા સૂચવાયું છે અને જો અનુપયોગ થાય તો અનુપયોગથી અશુભપ્રવૃત્તિ થાય તો ભ્યાલ આવતા તરત પાછા વળયું. આ બે પ્રણિધાનરૂપ નથી પરંતુ ભ્યાલ આવ્યા પછી પણ પાછા ન ફરો તો તે પ્રણિધાનરૂપ થાય છે માટે અનુપયોગ એ પ્રમાદ છે અને અનુપયોગથી થયેલ અશુભ પ્રવૃત્તિ એ પણ પ્રમાદ છે અને તે બન્નેથી જો કાળજીપૂર્વક પાછા ન વળીએ તો તે પ્રણિધાનરૂપ પ્રમાદ થાય છે. આ યોગ દુષ્પણિધાન ક્ષાયયુક્ત જ લોય છે અને તે પ્રમાદથી ક્ષાયની તીવ્રતા થઈ અવિરતિ આવે છે. જાણવા છતાં, કહેવા છતાં, સમજાવવા છતાં પાપ રૂચિની તીવ્રતા- પ્રમાદ રૂચિની તીવ્રતાવાળો જીવ જો એ પ્રવૃત્તિથી અટકે નહીં તો પ્રમાદની આભોગ પૂર્વકની તીવ્રતા અને પાપથી અવિરામ તે

અવિરતિરૂપ બને છે અને પછી તે ગુજરાત, આચાર, પાપવિરામ, કથાય વિજય, યોગ સુપ્રાણિધાન વગેરેના પક્ષપાતને, વિરોધ આદરશીય રૂપના વલભાને, રૂચિને છોડીને પાપાચાર, કથાય વિષયાદિના વલભાને ગુજરાપ, સુખરૂપ માને છે. આ રીતે અનુપયોગ, સાહજિક અશુભ પ્રવૃત્તિ, યોગ દુષ્ટાધાનરૂપ પ્રમાદ દ્વારા સાધન પ્રવૃત્તિ વગેરેના પ્રમાદોને પ્રગટ કરી અવિરતિ અને મિથ્યાત્વમાં છીવને ખેંચી જાય છે. માટે સદા ઉપયુક્ત કથાય વિષયના સાધનોથી દૂર સાવધાન રહી, નોકથાયના નિગ્રહમાં તત્પર બનવું, પૂર્ણગંભીર ઉત્તમ ચીજો છોડવી, પુરુષલભમાં ઉત્તમપક્ષાની દ્રાષ્ટિનો ત્યાગ કરવો તો જ જીવ પ્રમાદ રહેત રહી શકે.

સંસારી જીવને - છભસ્થ જીવને પુરુષલ વચ્ચે રહેતું પડે છે. શાનાવરણ વગેરે કારણે અનુપયોગ થાય છે, મોહનીયના ઉદયના કારણે જીવન વ્યવહારની સાધક પ્રવૃત્તિમાં રાગાદિ પરિશ્રતિ આંશિક થયા જ કરે છે ત્યારે અનુપયોગ અને આંશિક રાગાદિના સતત નિગ્રહ કરનાર પ્રમાદને જતી શકે છે. તે માટે આચાર અને ભાવનાથી સતત પ્રવૃત્તા-ભાવિત રહેતું જેથી યોગની શુભ પ્રવૃત્તિ-ઉપયોગ દ્વારા દુષ્ટાધાનનો નિગ્રહ સતત રહે. પ્રમાદની વૃદ્ધિ ન થાય તો જ અવિરતિ- મિથ્યાત્વ ન આવે અને કુમશ: વીતરાગભાવ પ્રાપ્ત થાય.



## ૦૦૦ સહન કરો શુદ્ધ બણો ૦૦૦

આ જીવે ઈચ્છાપૂર્વક શું શું સહન નથી કર્યું તે વિચારવા જેવું છે. જીવનની એક ઈચ્છાપૂર્તિ માટે ત્યાગ કરે, તપ કરે, અપમાન સહન કરે, મજુરી- વેઠ-સેવા પણ કરે છે, ધન પણ ખર્ચ છે. હૃદાખ પણ ઓપરેશન સુધીના, પરવશતાના અને બીજા પણ અનેક હૃદાખ ભોગવે છે. આ બધાના કારણમાં કથાય પરવશતા, વિષય પરવશતા, મોહ- અણાન પરવશતા છે અને ફળમાં સામાન્ય અનુકૂળતાની કે ધારેલ ચીજની ગ્રાન્ટ ક્યારેક થાય, ક્યારેક ન થાય પણ પદ્ધી પાછા વિયોગના હૃદાખ વગેરે ઉભા જ રહે.

જીવે સંસારમાં કથાય- વિષય પરવશપણે કરું સહન કરવામાં બાકી નથી રાખ્યું, છતાં ફળમાં પાપ, હૃદાખ અને ભટકવાનું ઉણ્ણું છે.

આનો અર્થ એ છે, સંસારમાં જીવ સામે ચીને આ હૃદાખ સ્વીકારે છે, આયોદ્ધાને આનંદથી વેઠે છે, એમાં તેણું મન એ મુખ્ય કારણ છે. મનની સમજાળમાં કથાયવાળા જીવોની ગણતરીઓ જુદા પ્રકારે છે, વાસનાગ્રસ્તની ગણતરીઓ જુદા પ્રકારે છે. મનના કારણે સંસારના હૃદાખ સહન કરવા સહેલા લાગે છે, આગળ વધીને તો હૃદાખ લાગતા જ નથી. હીવે જો જીવ જિનવચનના ચિંતન દ્વારા, અર્થિહત પ્રભુની હૃપા- કરુણા દ્વારા, ગુરુવર્યોના આગ્રિવર્દદ દ્વારા, ગુરુ ઉપરના બહુમાન દ્વારા આપણા મનના ધોરણ બદલાય તો જીવને ધર્મમાર્ગ સાથુપણા સુધીમાં કરું જ કઠીન ન લાગે, ગુરુના વચન અમૃત લાગે, સાધુના વચનો ઉપકારી લાગે માટે સંસારી જીવની જે વિચાર સરકીઓ- મનના ધોરણો- માન્યતાઓ છે તે ફેરવવાથી, વારંવાર ભાવનાથી વિચારણાઓ ભાવિત કરવાથી ધર્મનું નુર પ્રગટે.

આરાધનાના કષ્ટો સહન કરવામાં આનંદ આવે, આરાધનાના કષ્ટો કષ્ટરૂપ લાગે જ નહિ.

૧) સંસારના સ્વાર્થ માટે કે કથાય પરવશ સહન કરનારને કંઈક લાલ થવા છતાં એકદર પાપ- હૃદાખ અને સંસારની વૃદ્ધિ થાપ છે.

- 
- 2) મોક્ષ માટે, પોતાના કર્મકાય માટે, ધર્મ માટે, બીજાના તરફથી વચન કે વ્યવહારની આવતી પ્રતિકૂળતા બીજાને ઉપકારી તરીકે માની સહન કરનારને ઉત્તમ પુણ્ય, ઉત્તમ ધર્મ, સમાધિ, સમતા અને આરાધકભાવ મળે છે. તેનાથી વિશેષ કર્મકાય થાય અને અલ્ય કાળમાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
  - 3) ગુરુનું તેમજ સાધારિતનું સહન કરનાર ધર્મ યોગ્ય બને છે.
  - 4) તપ- ત્યાગ- નિર્દોષતા માટે, બીજાને અનુકૂળ થવા માટે સહન કરનાર આરાધનાને યોગ્ય બને છે.
  - 5) ધર્મ આત્મા પ્રત્યેના અપમાન, અનાદર તેમજ અલિયથી ધર્મમાં અંતરાયકારક ધર્મ બંધાય, અને આદર, માન, રચિથી ધર્મના અંતરાય તૂટે.
  - 6) પ્રતિકૂળતામાં પ્રસંનતા- સમતા રાખનાર ધર્મના અંતરાય તોડે; પ્રતિકૂળતામાં અપ્રસંનતા- સંકલેશ કરનાર ધર્મના અંતરાય બંધે.
  - 7) ઉતાવળીઓ સ્વભાવ, ઉશ્કેરાટવાણો સ્વભાવ, અવિચારિક સ્વભાવ, રાખસિક સ્વભાવ ધર્મને અયોગ્ય બનાવે. અંતરાયો અને પાપ કર્મ બંધાવે. આનાથી વિપરીત સ્વભાવ, શાંત- સ્વસ્થ- વિચારક- ચોકસાઈવાણો સ્વભાવ અંતરાયોને તોડે, પાપકર્મ બંધાવે, ધર્મ અને પુણ્ય પ્રાપ્ત કરાવે.
- સંસાર કહે છે, “કોઈથી દબાઈએ નહિ, બધાને દબાવીએ”
- ધર્મ કહે છે, “ કોઈને દબાવીએ નહિ. બધા પ્રત્યે નાનું બનીએ.
- કોઈને હળીએ નહિ, કોઈને ઉતારી પાડીએ નહિ, કોઈનું અપમાન ન કરીએ, માન આપીએ, પેટ ભરીને જમાડીએ, જાતે બૂધ્યા રહીએ, ઉશ્કેરાટી કરીએ, બીજાને અનુકૂળ બનીએ, બીજાને પ્રતિકૂળ ન બનીએ, બીજાનો ગુસ્સો સહી લઈએ, જાતે ગુસ્સો ન કરીએ, અપમાન સહન કરીએ, કોઈને ગુસ્સે ન કરીએ, આપણો ગુસ્સે ન થઈએ.
- ટુંકમાં સંસારમાં ઘણું ઘણું ઘણા કાળ માટે ઘણાથી સહન કરવાનું છે, અને કણમાં સાવ મામુલી લાભ થાય કે ન પણ થાય અને પાછળ મોહ- અજ્ઞાન- અવિવેક અને દુઃખની પરંપરા સર્જાપ છે.

આ વાતને સતત ધ્યાનમાં લઈને ધર્મ માટે, ધર્મરૂપે સાધર્મિકોથી, ધર્મબોથી, ગુરુભોથી, ગુરુભાઈઓથી સહન કરવામાં થોડું સહન કરવાનું, થોડા કણ માટે- એક બે ભવ પૂરતું સહન કરવાનું અને ફળમાં ધર્મની વૃદ્ધિ, સત્ત્વ વૃદ્ધિ, સદ્ગ્રાવનાની વૃદ્ધિ, અપ્રતિપાતી ધર્મની પ્રાપ્તિ અને ઉ-પ-ઉ ભવમાં મુક્તિ મળે છે.

માટે ધર્મી આત્માએ વ્યવહારમાં મૂર્ખ જેવા બનીને પણ સહન કરી આંતરિક ધર્મની રક્ષા કરવી- વધારવી.



## ૦૦ ધર્મની આંતરિક ઓળખ ૦૦

અનંત ઉપકારી અરિહંત પરમાત્માઓએ જગતના સર્વજીવોના કલ્યાણાર્થ ધર્મતીર્થની સ્થાપના કરી “દુર્ગતી પ્રપત્તજન્તૂન ધારયતિ સદગતિ ચ પ્રાપયતિ હતિ ધર્મः” દુર્ગતિમાં પડતા જીવોને આધાર આપી અટકવી સદગતિ તરફ લઈ જાય તેનું નામ ધર્મ, ધર્મતીર્થની સ્થાપના બાદ જીવોને મોક્ષમાર્ગ બતાવવા પરમાત્માએ અને અન્ય ગીતાર્થ સંવિજન બવભીરું મહાપુરુષોએ માર્ગદર્શક શાલોની રચના કરી છેમાં ધર્મતત્ત્વનું વિસ્તૃત અને સચ્ચાટ વિવેચન કરવામાં આવ્યું છે. બિન્ન બિન્ન કષ્ટોપશમવાળા જીવો તેમાંથી પોતાની યોગ્યતા, રૂપી અને સમજીબા અનુસાર ધર્મનું આચરણ કરતા હોય છે.

ધર્મના અલગ- અલગ પંથો અને મતો હોવા છતાં સામાન્ય એક નિયમ પ્રસ્થાપિત થયેલો છે કે સુધી થવું હોય તો ધર્મ તો કરવો જ જોઈએ. દાવાનણની કોઈ લડકે બણતા સંસારમાં મનની સમાપ્તિ, પ્રસન્નતા, શાંતિ ધર્મ વગર બીજું કોઈ આપી શકે તેમ નથી માટે ધર્મ અને પુરુષ બન્ને તરફ કુણી લાગજી રહેવી જોઈએ અને પાપ અને અધર્મ તરફ કરી નજર થવી જોઈએ....

હવે પ્રશ્ન એ થાય કે આટલા અલગ- અલગ મતો અને માર્ગોમાંથી સાચો ધર્મ કેવી રીતે જાણવો?... તો એનો ઉત્તર એ મળી શકે કે સર્વજ્ઞ, વીતરાગ લગવંતપ્રરૂપિત ધર્મ એ જ સાચો ધર્મ જાણવો... તો કરી એક પ્રશ્ન થાય છે કે- સાચા ધર્મની પ્રાપ્તિ બાદ પણ ધર્મની તે- તે ડિયાઓ, આરાધનાઓ વગેરે જે કરાય છે તે સાચો ધર્મ હશે? કેવી અવસ્થાને, પ્રવૃત્તિને ધર્મ તરીકે લેખી શકાય? નકલના જમાનામાં અસલી ધર્મ ઓળખવો મુશ્કેલ બની જતો હોય છે.

શાસ્ત્રકાર ભગવંતોએ વિશિષ્ટ અનુભવ જ્ઞાન મેળવ્યા બાદ અદ્ભૂત પ્રત્યુત્તર આપ્યો છે કે આત્મગુણોની પ્રાપ્તિ માટે, શુભ સંસ્કારોના વિકાસ અને દઢતા માટે, કર્મ ખપાવવા માટે જે વિચાર - વાણી - વર્તન કરાય તે ભાવધર્મ કહેવાય. માત્ર અમૃક સ્થળો, અમૃક સમયે કરાતી અમૃક જ ડિયાઓને ધર્મ કહેવાનું શાસ્ત્રકારોને અભિપ્રેત નથી. વિવેકદીપ જાગૃત થયા બાદ શુભ અને શુદ્ધ

આશયથી કરતી કોઈ પણ ડિયા ધર્મસ્વરૂપ બની જતી હોય છે. આચારાંગનું અતિ પ્રસિદ્ધ સૂત્ર 'જે આસવા તે પરિસવા' પણ આ જ વાત કરે છે, સમૃદ્ધાંશિ વિરતિધર આત્મા કોઈ પણ પ્રવૃત્તિ કરે તો પ્રાય: ડિલાટ કર્મબંધ કરતો નથી કારણો કે વીતરાગ સર્વશ પરમાત્માની આજ્ઞા નજર સામે રમતી રહેવાના કારણો કર્મકષય અને આત્મશુદ્ધિનું લક્ષ્ય સતત રમતું રહે છે. ગ્રન્થેક ડિયામાં વિષિશુદ્ધતા, આદર, ચોકસાઈ અને ઓચિત્ય હોવાના કારણો તેનો ધર્મ શુદ્ધપર્મ બન્યો રહે છે. તે જ રીતે પાપડિયા કરવી પડે તો ય તેમાં પાપનો ડંખ, અનાદર, તેમાંથી છૂટવાની તાલાવેલી હોવાના કારણો આરાધકભાવ જીવતો રહે છે. તેથી તેમનો ધર્મ ભાવધર્મ બને છે.

જેની પાસે આવો આરાધકભાવ નથી એવા આત્માઓ હારા માત્ર ગતાનુગતિકપણો- બધા કરે છે તેવું આપણે પણ કરવું એ આશયથી, લીધું છે માટે પુરું કરવું તે ભાવનાથી કે એથે ઉદ્દેશથી વિશિષ્ટ ભાવોલ્લાસ વગર, બહુમાન કે વિષિ વગર સામાન્યથી માત્ર પુરુષ માટે જે આચાર પળાય, વિચાર-વાકી કે વર્તન કરાય તે દ્રવ્ય ધર્મ છે, જેને પુરુષ પણ કહેવાય. સ્પષ્ટ સમજજી વિના માત્ર કુલાચારથી કે અન્યની પ્રેરણાથી કરતો ધર્મ આ કષામાં આવે છે. આવા જીવોને આત્મગુણોની પ્રાપ્તિ, કર્મકષય વગેરે લક્ષ્ય કાં તો હોતું નથી અથવા અતિ મંદ કષાનું પ્રભાવહીન હોય છે.

ભાવધર્મનું સામર્થ્ય જ્યાં સુધી પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી દ્રવ્યધર્મ કરતા રહેવો જોઈએ. તેનાથી ધર્મ અને ધર્મનો યોગ પ્રાપ્ત થાય છે, જીવન શાંતિથી પસાર થાય છે. શાખોમાં પુરુષ (દ્રવ્યધર્મ)ને સાધન કર્યું છે, ધર્મને સાધ્ય કહ્યો છે. સાધનની પણ આવશ્યકતા અને મહત્ત્વ હોય છે.

એ જ રીતે આત્મ ગુણો, સંસ્કારો કે શુદ્ધભાવો વિગેરેના નાશાનું કારણ જાણી, બીજા પણ અનેક અધ્યાત્મમાર્ગની પ્રગતિના ઉદ્દેશથી અઢારે પાપસ્થાનકોની આંતરિક- બાહ્ય પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે છોડવાનો કે ઘટાડવાનો પ્રયત્ન કરવો અથવા તેમાં પણાતાપવાળા, જયશ્વાવાળા થયું તે ભાવથી અધર્મ વર્જવારૂપ કર્તવ્ય થયું. વિદેશી જીવોનો સ્વભાવ જ તેવો બની ગયો હોય છે કે

પાપ ન કરી શકે, કરવું પડે તો મુજારી છૂટયા વિના ન રહે. પણ આટલી ભૂમિકા કે ઉલ્લાસ પણ ન હોય ત્યારે વ્યવહારથી પણ અઢાર પાપસ્થાનકો છોડવા, ઘટાડવા, અંતરથી બહુમાન ન રાખવું, પાપોના નુકશાનની વિચારકાં- ભાવના કરવી, પાપ છોડવાના લાભો વિચારવા તે પણ બીજા નંબરે (દ્વયથી) કર્તવ્ય બને છે. આ રીતે પાપો છોડવાથી છેવટે સ્વભાવથી જ પાપ છોડવાનું સામર્થ્ય મળે છે.

આમ પ્રત્યેક સ્થાને દ્વય તે ભાવનું કારણ બને છે. ઉપાદેય અને પ્રધાન હુમેશા ભાવધર્મ જ છે, પરંતુ સાથે સાથે દ્વયધર્મ પણ ડેય તો નથી જ. પ્રારંભિક અવસ્થામાં કરતો દ્વયધર્મ જ ઊંચી ભૂમિકા સુધી પહોંચાડી શકે છે માટે જીવનમાં દ્વયધર્મ અને ભાવધર્મ બને પર જોર આપવું, ધીમે ધીમે ભાવધર્મની ઊંચી ભૂમિકા સુધી આવવું, તેમ કરતાં કરતાં ધર્મ સ્વભાવગત બની છેવટે સિદ્ધિગતિ સુધી પહોંચાડનાર બનશે.



## ○ ॥ મૈત્રાદિભાવસંયુક્તં તત્ત્વર્મ શુદ્ધમિષ્ટતે ॥ ○

પરમાત્માના શાસનની આગામનાના પાયામાં મૈત્રાદિ ચાર ભાવનાઓ બતાવી છે. ધર્મબિંહુ નામના ગ્રંથમાં સૂર્યપુરંદર પૂ.આ.શ્રી હરિલલ સૂર્ય મહારાજ ધર્મની વ્યાખ્યા કરતા લખે છે કે જે મૈત્રાદિભાવથી યુક્ત હોય તેવી શુદ્ધ પ્રવૃત્તિ કે ચિત્તવૃત્તિ તે ધર્મ.

તેથી જેને ધર્મ જોઈતો હોય તેવી મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ આ ચારે ભાવનાથી હદ્યને ભાવિત બનાવવું જ પડે અર્થાતું આ ભાવનાઓ ફરજિયાત છે. આ સૌ ભાવનાનું મૂળ મૈત્રી ભાવનામાં છે. તેથી સૌ પ્રથમ મૈત્રી ભાવના ભતાવી તથા મૈત્રીભાવના સર્વજનવ્યાપી છે જ્યારે પ્રમોદ-ગુણીજન માત્રે, કરુણા દુઃખી-પીડીત જીવો માત્રે અને માધ્યસ્થભાવના ઉપેક્ષણીય જીવો માત્રે રાખવાની છે તે કારણથી પણ પ્રથમ મૈત્રીભાવના કહી.

**મૈત્રી:-** જગતના તમામ જીવો પ્રત્યે દિલમાં સ્નેહભાવ-લાગણીભાવ. કુટુંબ-સ્વજન ઉપરંતુ તો મમતા કાયમ રહે છે. તેઓ પ્રત્યે તો હદ્યમાં સ્નેહભાવ આપને રાખતા જ હોઈએ છીએ કારણ કે તેમને આપણા માનીએ છીએ. કુટુંબપ્રેમ-સ્વજન સ્નેહ તો અનાદિના સંસ્કાર છે. અહીં તે પ્રેમ-સ્નેહના વ્યાપને વધારવાની વાત છે. તેના ક્ષેત્રને પદ્ધોળું-વિસ્તૃત બનાવવાની વાત છે. “વસુપીવ કુટુંબક્રમ” ની ભાવના લાવવાની છે. સ્વજન જ નહીં પણ સર્વજનને પોતાના માનવાના છે.

**પ્રશ્ન:-** આપણે વીતરાગ બનવાનું છે તો બીજા ઉપર રાગ શું કામ રાખવો? વીતરાગપણાની પ્રાપ્તિમાં રાગ પ્રતિબંધક ન બને?

**ઉત્તર:-** મૈત્રી-પ્રમોદ-કરુણા રાગના કારણો છે પરંતુ જ્યાં સુધી આત્મા બળવાન નથી બન્યો ત્યાં સુધી આની જરૂરિયાત છે. મૈત્રાદિ રાગના આંશિકરૂપક છે, મુખ્યત્વા વેર-અર્દચિ-ઉપેક્ષા વગેરે અશુભભાવના નાશક છે, તેની ઉત્પત્તિને રોકનાર છે. તેનાથી દોષદાસ્તિ, અન્યની ભૂલ વખતે દેખભાવ, પ્રતિસ્પર્ધિપદ્ધાનો, અહિતકારીપણાનો ભાવ નાશ પામે છે.

**પ્રશ્ન:- મૈત્રી ભાવની જરૂર શુ?**

**ઉત્તર:-** આપણા હદ્દયમાં મૈત્રીભાવ રાજવાધી વેરી ઉપર વેર ઉત્પત્તિ થતું નથી. તેમને પોતાના માનવાથી તેઓ તરફથી પ્રતિકૂળ વર્તનમાં પણ દેખ-અરૂચિ આવતા નથી તેથી સામાન્યથી બધા ઉપર મૈત્રીભાવ રાજવાનો અને જ્યાં ઈર્ષા-અરૂચિ હોય ત્યાં તેના વારણ માટે ખાસ રાખવો.

આપણી આરાધનાની નિર્વિલનતા માટે બીજા પ્રત્યે સ્નેહભાવ જરૂરી છે. સામી વ્યક્તિ આપણી આરાધનામાં સહાયક કયારે બને? જો તેને આપણા પ્રત્યે લાગજી હોય તો, પરંતુ જેને લાગજી નથી અને દેખ છે તે કાયમ આપણા કાર્યમાં દખલ કરે. બીજો વેરભાવ રાખે અને આપણે તેના ઉપર અરૂચિ રાખીએ તો આપણે ધર્મ કરવા માટે યોગ્ય નથી.

આપણે ગુનેગાર ન હોઈએ તો ય તેના પ્રત્યે સહાનુભૂતિ-મિત્રતા રાખી શક્ય પ્રયત્ન દ્વારા તેનો વેર-દેખભાવ છોડાવવો. તેનું આપણા પ્રત્યેનું વેર છુટે તો બસેને લાભ. કદાચ ન છુટે તો ય આપણી મૈત્રીભાવનાથી સ્વને તો જરૂર લાભ થાય. આપણું હદ્દય નિર્ભળ-અકૃટિલ રહે. કમઠનું વેર હોવા છતાં પાર્શ્વનાથ ભગવાનના જીવને મૈત્રીના કારણે કાંઈ નુકશાન ન થયું. અભિનશર્માનું વેર ગુણસેન રાજને કાંઈ ન કરી શક્યું માટે પ્રથમ પોતે વેર ભાવના છોડવી, પછી સામાની યોગ્યતા જોઈ શક્ય પ્રયત્નો દ્વારા તેની પણ છોડાવવી. વેર છોડાવવાધી અવિષ્યમાં તે આપણી ધર્મ-આરાધનામાં વિઘનકર્તા ન બને. આપણા પ્રત્યેની સામાની અરૂચિ કદાવવી કારણ કે અન્ય પ્રત્યેની આપણી કે આપણા પ્રત્યેની અન્યની અરૂચિનું કણ મળ્યા વગર રહેતું નથી. કૃષ્ણ મહારાજના પૂર્વના ત્રીજા ભવની વાતમાં આવે છે કે બે ભાઈઓ ગાડામાં બેસીને જઈ રહ્યા છે. આગળ જતાં રસ્તા વચ્ચે કોઈ નાનું પ્રાણી બેનું છે ત્યારે મોટો બાઈ કહે છે ' ગાહું બાજુમાંથી લઈએ' ત્યારે નાનો બોલ્યો ' આપણે શા માટે ફેરવવું પડે? આવી શીતે રસ્તા વચ્ચે બેસાનું હરો? તેની ઉપરથી જ જવા દેવું.' અને નાનાએ મોટાના હાથમાંથી દોરું લઈ પોતે જ ચલાવ્યું. પેલું પ્રાણી મૃત્યુ પામીને સ્ત્રી થયું. અને કાળકમે બસે ભાઈઓ મરીને તે સ્ત્રીના પુત્રો તરીકે જન્મ્યા. જે

ભાઈને બાજુ પરથી ગાડુ ચલાવવાનું કશું હતું હતું તેની પર માને પ્રેમ અને બીજા ઉપર અરૂચિ છે.

માટે જા ભવમાં આપણે કોઈ પ્રત્યે અરૂચિ રાખવી નહીં અને બીજાને હોય તો કદાવવી, એના હદ્દ્યમાં રહેલ હેઠ- અરૂચિ પણ આપણાને હેરાન કરે છે.

સંસારમાં બેઠા છીએ તેથી અશરણ છીએ, કર્મ ગમે તેવી પરિસ્થિતિમાં જેચી જાય તેનાથી રક્ષણ કરવું જોઈએ. શ્રીમંતાઈ કે ગરીબી દરેક અવસ્થામાં જીવો પ્રત્યે સ્નેહ-લાગણી જ રાખવી. આપણે બધા સાથે અનુકૂળ રહેવાનું પ્રત્યક્ષિપાન રાખવું જોઈએ, બીજાને અનુકૂળ થવાની આપણાને બુદ્ધિ થાય તો સામાને પણ તેવી બુદ્ધિ થાય, કદાચ સામો પ્રતિકૂળ વર્તે તો પણ આપણે તો અનુકૂળ જ રહેવું, તેનાથી પુરુષ વખતાં સામાની બુધ્યિ ફરે- અનુકૂળ બને, અન્યથા આપણાને તો સમાપ્તિ રહે જ.


જગત સ્વાર્થીધ છે એમાં જ આપણે રહ્યા છીએ, મોષે નહીં જઈએ ત્યાં સુધી આ જગતની વચ્ચે જ રહેવું પડશે. આ જ જીવોસાથે આપણે વ્યવહાર કરવાનો છે તેવા સમયે બીજા ઉપર ઈતરાજી કરી વૈરમાનસ ઊભું કરીએ તો આપણામાં % અશાંતિ આવે. આમ લાખો રૂપિયા સારા ક્રમમાં વાપરે અને કોઈ થોડા રૂપિયાની ઠગાઈ કરે તો ગુરુસો કરી અમૈતી ભાવ રાખે-જઘડો કરી યાવતૂ કોઈ સુધી પહોંચે તે યોગ્ય ગણાપ્ય ? શાવકે કોઈમાં કોઈ હિવસ ન જવું જોઈએ.

પ્રશ્ન :- આપણા પર કોઈ આરોપ મૂકે તો કોઈમાં જવું પડે ને ?

ઉત્તર :- આવેલ કલકનું વાણી આપણાં કર્મો પૂરા થાય ત્યારે થાય, તે સિવાય નહીં. તથા આપણા આત્માની સમાપ્તિ- સમતા- સ્નેહભાવ અભજો રૂપિયા કરતાં વધુ કુમતી છે તે ભૂલવું ન જોઈએ.

મેત્રી ભાવ જીવનના બધા વ્યવહારોમાં આવે તો બધા તરફથી અનુકૂળતા રહે. આત્મા જેટલો-જેટલો બીજાને અનુકૂળ બને તેટલા બીજા જીવો પોતાની તરફ લાગણી વાળા થાય, આવી લોકપ્રિયતાને ધર્મ પામવાની યોગ્યતાનો ગુજરા કર્યો છે. જેણે લોકોની લાગણી મેળવી નથી તે જે ધર્મ આચરે તે ધર્મ પણ નિય બની જાય છે.

જેની નજરમાંથી- વાણીમાંથી- પ્રવૃત્તિમાંથી મીઠાશ જાપ તેને કયાંય શાંતિ ન મળે. બીજા સાથે મૈત્રી કરવાથી શાંતિ આપકને મળવાની છે. અને જે આત્મા શાંત હોય તે જ ધર્મને યોગ્ય છે. મામુલી અવસ્થામાં નાની બાબતોમાં બીજાનું મન રાખવું તે પણ સામાન્યથી વ્યાજબી છે. નાની વાતોમાં કડકાઈ કરી ઝોલ સંબંધ તોડવાથી હૃદયમાં ધર્મ ન આવે. તિરસ્કારથી રૂષીતા-કઠોરતા આવે છે અને જ્યાં રૂષીતા હોય ત્યાં કદી વૃદ્ધ ન ઉંગે. ફોન ન લાગે મારે દરેક સાથે મીઠાશથી મૈત્રીથી રહેણું.



## ● ● ● ધર્મો સુદ્ધસ્સ ચિહ્નિ ॥ ● ● ○

સંસારી જીવો મોહ, અજ્ઞાન, ગતાનુગતિક રીતે (દિખાએખીથી), કર્મપ્રેરિત રીતે સમજણે કે સમજણા વિના, જે મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ કરે છે તે સંસારવર્ધક છે. તેવી પ્રવૃત્તિઓને જાગ્રત્વી, વિચારવી અને છોડવી અને તત્ત્વદ્રષ્ટિથી યોગ્ય અને નિશ્ચયથી જ્ઞાન- શ્રદ્ધાપૂર્વકની જે વિચારસરણી, જે વાર્ષી, જે વર્તન કરવું તેને યોગ કહેવાય. આવા વિચાર-વાક્યી- વર્તનના કારક જ્ઞાન- શ્રદ્ધા- વિષેક- તત્ત્વદ્રષ્ટિરૂપ આત્મસ્વરૂપનું જે નિયંત્રજ્ઞ તે યોગ છે, આત્મદીયંનું સ્વભાવમાં જોડવું, તેની સૂચક-જ્ઞાપક મન- વચન- કાયાની તત્ત્વદ્રષ્ટિની, શ્રદ્ધાપૂર્વકની, જ્ઞાનપૂર્વકની અને જ્ઞાનીની નિશ્ચાપૂર્વકની પ્રવૃત્તિને વ્યવહાર નયથી યોગ કહેવાય છે. નિશ્ચય નયથી તત્ત્વદ્રષ્ટિ, શ્રદ્ધા, જ્ઞાન, અસત્તનીર્વતન અને સત્ત્પ્રવર્તનનો જે કયોપશમ ભાવરૂપે આત્મ સંસ્કાર અને એથી વિપરીતપણાનું અનુત્યાન, અનાભોગરૂપે પણ અશુભમાં અપ્રવર્તન તે નિશ્ચયના કારણરૂપ અર્થ નિશ્ચયરૂપ યોગ છે. ક્ષાયિકભાવ- સ્વભાવગ્રાહિ- સિદ્ધસ્વરૂપ એ કાર્યરૂપ યોગ છે. અહીં યોગનો અર્થ સ્વભાવપ્રવર્તન લેવો.

સ્વભાવ જોડવાના કારણરૂપ યોગ છે. સ્વભાવ પ્રવર્તન એ કાર્યરૂપ યોગ છે. કયોપશમભાવ કારણરૂપ યોગ છે. ક્ષાયિકભાવ એ કાર્યરૂપ યોગ છે અને બાહ્ય પ્રવૃત્તિનિવૃત્તિ કારણના કારણરૂપ વ્યવહાર યોગ છે.

વ્યવહાર યોગ ઉર છે. તેનાથી કયોપશમ યોગ પ્રાપ્ત થાય, અને તેનાથી ક્ષાયિકયોગ પ્રાપ્ત થાય છે.

### શાલોયન :

આલોયણ-એટલે યોગ્ય ગીતાર્થ ગુરુ પાસે સ્વદોષનું કથન કરવું, આનાથી જીવ માન-માયાનો નિગ્રહ કરે છે અને પશ્ચાત્તાપપૂર્વક સ્વદોષનું કથન કરવાથી પાપના પશ્ચપાતનો નાશ થાય છે.

બીજો અર્થ છે કથન, પોતાની જીવનચર્ચા-વ્યવહારનું યોગ્ય વ્યક્તિ પાસે શક્ય હોય તો કાર્ય કરતા પહેલા અને પછી બને વખત અને પૂર્વ શક્ય ન બને તો છેવટે કાર્ય કર્યા પછી પણ પથાસ્થિત કથન કરવું, આનાથી પ્રમાદ-મોહ-

અજ્ઞાનથી ધતી ભૂલો અટકે છે. પોતાને જે ભૂલોનો ઘ્યાલ ન આવે તે વરીલ જતાવે છે. તેથી આત્મા પ્રજ્ઞાપનીય, સરળ અને સમર્પિત ભાવમાં રહે છે.

ગ્રીજા અર્થ-દરેક પરિસ્થિતિમાં દરેક પ્રસંગમાં વાસ્તવિક રીતે યોગ્યતુંપે ગુજરાતીધોયની, કર્તવ્ય-અકર્તવ્યની વિચારશીલ, જેમાં બદ્ધાગ્રહતા ન હોય, લાભ નુકસાનને સમજવાની તૈયારી હોય. આવી વિચારકુણાની તૈયારીને ઉપદેશ શ્રવણલિખિત કહેવાય છે. તે ધર્મ અને ગુજરાતી પામવા માટેની ભૂમિકા છે. માટે અને પણ યોગોના કારણદ્વારા યોગસંગ્રહ તરીકે જતાવેલ છે.

ઉજ્જેની નગરી... જિતશાનુ રાજા... અહુન નામનો અતીવ બળવાન મહ્લું... સર્વ રાજ્યમાં અજ્ઞેય... સમુદ્ર કિનારે સોપારક નગરમાં રાજા સિંહનિરિને મહ્લો પ્રિય હોવાથી પોતાને ત્યાં મહ્લયુદ્ધ કરાવે છે. તેમાં જે મહ્લ છતે તેને તે ઘરું દ્રવ્ય આપે છે. અહુનમહ્લ દર વર્ષે ત્યાં જઈને જ્યપત્તાકા મેળવે છે. તેથી રાજા વિચારે છે કે આ બીજા રાજ્યમાંથી આવીને જ્ય મેળવે છે તે માઝે અપમાન છે. મારા નગરમાં પણ બળવાન મહ્લ હોવો જોઈએ. આમ વિચારી રાજાએ બીજા મહ્લની તપાસ કરી. એક માછીમારને ચરણી પીતો જોયો. તેના બળની પરીક્ષા કરી બળવાન જાહીને એને પોષ્યો, વ્યવસ્થિત તૈયાર કર્યો.

અહુનમહ્લ દર વર્ષની જેમ ઉત્સવ (મહ્લયુદ્ધ) થશે તેમ સમજને પહેલેથી જ પોતાના નગરમાંથી નીકળી પોતાના ખોરાક માટેની સામગ્રી લઈ શાંતિથી આવે છે. નિયત સમયે યુદ્ધ થયું. પરંતુ આ વખતે અહુનમહ્લ મચિછુકમહ્લથી હાર્દી ગયો. પોતાના સ્થાને જઈને વિચારે છે આ યુવાન છે તેથી તેના બલની વૃદ્ધિ ધતી જશે, જ્યારે મારા બળની હાનિ થશે. માટે આને હરાવવા બીજા યુવાન મહ્લને તેની સામે ખડો કર્યું.

યોગ્ય વક્તિની તપાસ માટે પોતાના નગરમાંથી નીકળ્યો. સાંભળવામાં આવ્યું કે સૌરાષ્ટ્રમાં બળવાન માણસો હોય છે. તેથી તે તરફ ચાલ્યો. અનેક ગામોને વટાવતાં વટાવતાં ભરુથની બાજુમાં હરિણી ગામની બહાર દુરિય કુપિકા નામક સ્થળે જેડૂત જોયો જે એક હાથે છણ ચલાવે છે અને બીજા હાથે હુંઠા, કચરા, પથ્થર, વગરેને ઉખેડે છે. આવું બળ જોઈને તે ઊભો રહ્યો. વિશેષ

જળ જોવા માટે વિચારે છે તેનો ખોરાક જોઈએ. આ બાજુ બોજનનો સમય ધતાં ખેડૂતે બે બળદોને કામથી છુટા કર્યા અને સ્ત્રી ઘરેથી બોજન લઈને આવી. ઘડો ભરીને ભાત હલા. ખેડૂત ખાઈ ગયો. પોતાને યોગ્ય વ્યક્તિ મળી ગયો. ગ્રામમાં ફરીને અહૃતામલ્લે સાંજે એના ઘરેજ મુકામ કર્યો.

“અતિથિ ! આપનું નામ-ગામ અને કામ શું છે?” ખેડૂત પ્રશ્ન કર્યો.

“મિત્ર ! લોકો મને અહૃતામલ્લે કહે છે. ઉજ્જેનીનો વાસી છું અને મલ્લયુદ્ધ કરું છું.” મલ્લે ટૂંકો જવાબ વાણ્યો.

“આ બાજુ આવવાનું પ્રયોજન શું?” ખેડૂત બીજો પ્રશ્ન કર્યો.

“ભાઈ ! હું એ યુવાન-બળવાન વ્યક્તિની શોધમાં છું, જેને હું મારા જેવો અશેય મલ્લ બનાવી શકું. તેથી ગામોગામ ફરતો અહીં આવ્યો. ખેતરમાં તમને કામ કરતા જોઈ મને લાગ્યું કે જોઈતો હતો તેવો પુરુષ મળી ગયો. મારો ફરો સફળ. જો તમારી ઈચ્છા હોય તો મારી સાથે ચાલો. હું તમને શ્રીમંત બનાવીશ.” અહૃતામલ્લે જવાબ વાણ્યો.

ખેડૂત તૈયાર થયો. અહૃતામલ્લે તેની સ્ત્રીને કપાસનું મુલ્ય આપ્યું (જેથી કપાસ કાંતી વસ્ત્ર વક્કી વેચે), બળદના ચારા માટેનું પણ મુલ્ય આપ્યું. તે સ્ત્રીને સોગન આપી અહૃતામલ્લે ખેડૂતને લઈને ઉજ્જેની ગયો. વમન-વિરેચન વગેરે કરી પુછ કર્યો અને અનેક પ્રકારના યુદ્ધ, કુસ્તિ, મલ્લપણું શીખવાડ્યા અને ફરી પુછના સમયે પૂર્વની જેમ બને વહેલાસર સોપારક નગરમાં આવ્યા.

પ્રથમ દિવસે નવો ખેડૂત મલ્લ અને તે જ ગામના મચ્છિકમલ્લનું યુદ્ધ થયું. એકે ન હાર્યા. સમય પૂર્વી થતા બીજા દિવસ પર મુલતવી રાખ્યું. બસે મલ્લો પોતાના સ્થાને ગયા.

“હે મિત્ર ! તને મારના કારણે જ્યાં હુઃખું હોય તે કહે.” અહૃતામલ્લે ખેડૂતને પૂછ્યું. મલ્લે બતાવ્યું તેથી અહૃતામલ્લે તેલ માલીશથી શીખ સ્વસ્થ કર્યો.

રાજાએ પોતાના મચ્છિકમલ્લને માલીશ કરવા માલીશવાળા મોકલ્યા, તો તેનો જવાબ આપ્યો કે “તે બીચારો મારી સામે શા હિસાબમાં? તેના બાપથી પણ હું ગમરાતો નથી, મારે માલીશની જરૂર નથી.” અભિમાનથી તેનો

હું ખાવાના સ્થળ ન કર્તા, માલીશ ન કરાવી તેથી સ્વસ્થ ન થયો, બીજા દિવસે પણ પુફમાં કોઈ ન જત્યું પછી માલીશ પ્રક્રિયા પહેલા જેવી થઈ. ત્રીજા દિવસે જોરથી લાગેલા પ્રહારના કારણે કેઢે હાથ દઈને મચ્છિકમલલ ઊભો, તેથી અહૃદો ખેડૂતને ઈશારાથી કર્યું. તેથી તે ખેડૂતમલ્લે મચ્છિકમલલને માથામાંથી પકડ્યો. કુડીકાના નાળચાની જેમ એક બાજુ મુક્કો. આ રીતે મચ્છિકમલલ છાર્યો, ખેડૂતમલ્લ જત્યો. તેનો સત્કાર થયો અને બને ઉજ્જની ગણા, ધન મળવાથી, આખ્રુ વધવાથી સુખી થયા. મચ્છિકમલલ પીડાયો, અપમાનિત થયો, ધન ન મળ્યું, હતાશ થયો અને મર્યાદ.

મલ્લની જે વિજ્યપતાકા, તેમ અહીં આરાધનાની પતાકા જાળવી, અહૃદાના સ્થાને આચાર્ય જાળવા, મલ્લના સ્થાને સાંધુ, પ્રહારના મારના સ્થાને અપરાધો જાળવા.

જે પોતાના અપરાધોની ગુરુ પાસે આલોચના કરે છે, તે નિઃશબ્દ થયેલો અંગે લોકરૂપ રંગભૂમિ-પુફભૂમિમાં નિર્વાજરૂપી વિજ્યપતાકાને મેળવે છે. આ રીતે આલોચન દ્વારા યોગનો સંગ્રહ થાય છે. આ શિષ્યનો ગુણ છે.

### એક વિચારણા :

(૧) સંસારી અક્ષામ અને મોહથી વ્યાપ્ત આત્માની ખાસિયત છે કે જેને જે શક્તિ મળે તે વિકસાવે, ટકાવે અને તેનાથી બીજાને હરાવે, તેના દ્વારા અર્થ ઉપાર્જન કરે. એથી જીવની દરેક શક્તિથી અશુભ ઉદ્દેશ-ગર્વ-તિરસ્કાર-પાપપોષણ થાય છે. આરોગ્યને ટકાવવા વ્યાપામ કરે તો તે અર્થદંડ કહેવાય કરશું સંસારી આત્માને આરોગ્ય એ પ્રધાનતથા અર્થદંડનું કરશું બને છે અને ધર્મવિહીન આત્માને અનેક પ્રકારના અનર્થદંડનું પણ કરશું બને છે.

ધર્મથી વ્યાપ્ત સાંધુ મહાત્માને આરોગ્ય એ ધર્મનો હેતુ છે, અને એ આરોગ્ય માટે કરાતી પતનાપૂર્વકની પ્રવૃત્તિ તે પણ અર્થદંડ ન કહેતા ધર્મનું કરશું કહેવાય.

મલ્લયુદ્ધ અનર્થદંડ છે. તેનાથી કમાવું તે પણ અનર્થદંડ છે. અહૃદામલ્લ જે ગામમાં હતો તે રાજાને મલ્લયુદ્ધનો રસ ન હતો તેથી તે મલ્લયુદ્ધના પ્રોત્સાહ ગોઠવતો ન હતો.

(૨) જેને જેનો રસ અને મમતા બધાય તેની તે શ્રીફ-પણ લઈને જગતમાં તેનો પણ કરતો બીજાના તે કાર્યની પ્રશંસા કરતો, બીજાને પ્રેરણા-પ્રોત્સાહન આપતો રહે છે, જીતે પ્રવર્તનો રહે છે.

જે રાજાને યુદ્ધનો રસ નથી, ત્યાં અહિંશમહલની શી ડિમત? જેને જેનો રસ ન હોય તેની પાસે તે ચીજ સારી હોય કે નરસી, તેને તેની ડિમત નથી હોતી. “ટકે શેર બાજુ, ટકે શેર બાજુ” જેવી પરિસ્થિતિ થાય છે, સંસારરસિક આત્મા પાસે ધર્મ, શાની સંતો પણ જરૂર વગરના, ડિમત વગરના, નિરદ્યક લાગે છે ડિમતે તેમને ધર્મની કશી ડિમત નથી.

ધર્માં આત્માઓને સંસારી આત્માઓ તરફ તત્વભોષના કારણે નિરસ્કાર નથી હોતો, પરંતુ અજ્ઞાન, મોહથી વ્યાપ હોવાથી અને દુઃખરૂપ સંસારમાં રણાયેલ હોવાથી જિચારા લાગે છે, કલ્યાણનો વિષય બને છે.

બીજા ગામના રાજાને મહલ્યુદ્ધમાં રસ છે, તેથી જુદા જુદા ગામના મહલોને પુછ કરવા માટે નિયત હિવસ, નિયત સ્વણ નક્કી કરે છે અને દુનામ જાહેર કરે છે.

કમાવા માટે કે પ્રચાર માટે જેમ જાહેરાત કરાય છે તેમ પોતાના રસને પોષયા, તે રસવાળા તથા તે કાર્યમાં હોણિયારોને બેગા કરવા પણ આવા પર્યોગો ગોઠવાય છે. તપસ્વી તપસ્વીઓને બેગા કરે, શાની શાનીઓને, સંયમી સંયમીઓને, કાભી કાભીઓને, વેપારી વેપારીઓને ત્યાં બેગા થાય, પછી ચર્ચા અને પર્યોગો દ્વારા તે તે કાર્યની વિશિષ્ટ વ્યક્તિઓ આગળ પડતી જણાઈ આવે છે.

ધર્મબૈત્રમાં હરીકાઈ ખરી કે નહિં? મારંબિક જીવો માટે હરીકાઈ હોય છે, એક બીજા પરસ્પર એક બીજાથી પાછળ ન પડે તે દ્રષ્ટિથી પણ આગળ વધતા હોય છે. પરંતુ ધર્મભાવિત થયા પછી, પરિશુદ્ધિ ચોક્કસ થયા પછી શક્તિ ફોરવીને ધર્મ કરવાનો હોવાથી કક્ત હરીકાઈથી ધર્મ કરવો અને સામે હરોળનો કોઈ ન હોય તો ન કરવો તેવું રહેતું નથી.

(૩) રાજ મહલ્યુદ્ધમેમી છે, દર વખતે મહલ્યુદ્ધ ગોઠવે છે. પરંતુ દર

વખતે એક જ માણસ જતતો હોવાથી અને તે બીજા ગામનો હોવાથી રાજને પોતાનું અપમાન લાગે છે. તેથી અહશની સામે મચ્છિકમલને તૈયાર કરે છે. આ પણ એક જોવાની ખૂબી છે કે પ્રથમ રસદી જે કાર્યમાં સામાન્યત્વા પ્રેરક બન્યો છે, તે કાર્યમાં પોતાના બદલે બીજાઓનો નંબર લુગવાથી ઈર્ઝા થાય છે, જીવને પોતાની કે પોતાનાની પ્રશંસા જેમ ગમે છે, ઉત્કર્ષ જેમ ગમે છે, તેમ બીજાનો કે બીજાનાનો ઉત્કર્ષ ગમતો નથી, પ્રશંસા ઈઝ નથી. આ એક પ્રકારની ઈર્ઝા છે. જે વસ્તુ કે ગુણો પોતાની પાસે હોય કે ન હોય, પરંતુ બીજા પાસે હોય તે ન ગમે, તેની તે વાતની પ્રશંસા ન ગમે, ચડતી ન ગમે, તે ઈર્ઝા કહેવાય. શાનીને બીજા શાની ગમે તો ગુણરૂપ બને, બીજા શાની ન ગમે તો તે શાન ઈર્ઝાથી દુષ્પિત કહેવાય. શાનીને શાનીપર્દા ગમે તો શાની પૂજયો ગમે, શાનીનું વાતાવરણ ગમે તો તે શાનગુણ વાસ્તવિક કહેવાય.

જ્ઞાનીને અજ્ઞાની ગમે, જી હજુરીપા-કાંઈ ન જાણનાર ગમે, વડીલો પોતાની ભૂલ કઢે તે ન ગમે તો તે શાન પણ પરિષ્ણત ન કહેવાય. પોતાના સમાન કે પોતાનાથી ચિહ્નાતી બીજાની કોઈપણ શક્તિ જોઈ પોતાને દુઃખ થાય તે ઈર્ઝા અને આનંદ થાય તે મૈત્રી અને પ્રમોદ, માટે બીજા આગળ જાય તો પ્રશંસા, ગૌરવપૂર્વક આગળ જવા દેવા, અદેખાઈ, ઈર્ઝા કે નિંદા ન કરવી.

(૪) રાજાએ નવો મહિને તૈયાર કર્યો અને અહશા હાર્યો. આ પણ જગતની પરિસ્થિતિઓનું સૂચક છે. ઘરપણ આવે અને શક્તિઓ હ્રાસ પામે, પુષ્ટ ખુટે અને શક્તિ નાશ પામે માટે શક્તિથી પોતાની મોટાઈ માપનારને નીચે ઉત્તરવું પડે છે, દુઃખી થવું પડે છે. જીવની-આત્માની વડાઈ, ગૌરવ કોઈપણ લોતિક શક્તિથી નથી. આ ભવ પૂરો થતા બધું મૂકીને જવાનું છે. આ ભવમાં પણ શક્તિઓ નાશ પામે છે. બાબુ દેખાતી હુન્યવી બધી જ વડાઈઓથી આત્માની શોભા નથી અને તેનાથી કોઈ મોટા નથી, કોઈ નાના નથી માટે બાબુ શક્તિમાં છકી ન જવું, બાબુ શક્તિથી કોઈનો તિરસ્કાર ન કરવો.

(૫) અહશે નવા મહિને યોગ્ય વ્યક્તિ તરીકે જાણી, મેળવી, તૈયાર કરીને પુદ્ધમાં ઊભો કર્યો. માણસ નામના રાખવા દાટક લે છે. દરેક વેત્રમાં માણસ

પોતાના કાર્ય બાદ નિવૃત્ત થતા પહેલા તે કાર્ય યોગ્ય બીજુ વક્તિને તૈયાર કરી સૌંપે છે. અહેં મહુલ્યુદ્ધ કરવાનું છોડવું હોત તો ચાલત, પરંતુ માનાં અને રસ હોવાના કારણો પોતે ન કરી શકે તે બીજા પાસે કરાવે છે.

બીજને પદ્ધ વિષયોમાં, કખાયોમાં મેરણા-ઉતેજન આપવું તે પદ્ધ પોતાના વિષય-કખાયોનું પોષણ છે. એ રીતે બીજાના વિષયોપભોગમાં કે કખાયપોષણમાં આનંદિત થવું તે પદ્ધ પોતાના વિષય-કખાયોનું પોષણ છે.

(૬) અહૃળમહલે પોતાના મહુલને પૂછ્યું, એંબે પીડા થતા ભાગ બતાવ્યા અને માલીશથી સાજા કર્યા.

રાજએ મચ્છિક પાસે માલીશવાળા મોકલ્યા પદ્ધ તે ગર્વમાં હતો તેથી ‘મને કશું નથી, મને તે શું કરવાનો છે?’ તેમ જવાબ આપી ઉપચાર ન કરાવ્યો તેથી અંદર પીડા રહી.

આનો અર્થ એ છે કે યુદ્ધમાં પીડાનો પ્રતિકાર કરનાર જ જીતે, યુદ્ધમાં પીડા ન થાય તેવું ન બને પદ્ધ તેનો પ્રતિકાર ન થાય તો વહેલા પરાજીત થવાય કે મરવું પડે.

ધર્મી આત્મા પદ્ધ પાપની પ્રવૃત્તિરૂપ યુદ્ધમાં થવાય છે, તે સવાર-સાંજ પ્રતિકમજી કરીને સ્વસ્થ થાય છે. જે પ્રતિકમજી રૂપી પ્રતિકાર નથી કરતો, તે પાપની પીડાથી મુચ્છિત થાય છે. વહેલા મૃત્યુને શરદી થાય છે.

ધર્મી આત્મા રોજેરોજ પોતાને લાગેલા નાના મોટા દોષની આલોચના સદ્ગુરુને કહેવા દ્વારા અને આપેલ પ્રાયશ્ચિત્તને વહન કરવારૂપ પ્રતિકાર કરે તો તેનો ધર્મ સ્વસ્થ રહે, જે આલોચન ન કરે તેનો ધર્મ ધીમે ધીમે નાશ પામે.

બીજા મહુલે જેમ પ્રતિકાર ન કર્યો, માનથી અક્કડ રહ્યો, મને કશું નથી તેમ બલે જીવાયું પરંતુ વાસ્તવિકતા બે હિવસ છુપાવી શકાય, પદ્ધ પીડા વધ્યા પછી ક્યાંય ક્યારેય પદ્ધ છુપાવી શકતી નથી. ત્રીજા હિવસે જેમ મહુલ પરાજીત થયો તેમ જે પોતાના નાના-મોટા, જાહેર-ખાનગી દોષોની આલોચના કરતા નથી, પ્રતિકમજી-પ્રાયશ્ચિત્ત કરતા નથી તેવા આત્મા દોષ વધવાથી જાહેર પાપવાળા, નિઃશંકપણે પાપ કરવાવાળા, પાપ છોડવાને અસમર્થ, ધર્મ આરાધવા અસમર્થ

બને છે, પાપના પક્ષપાત્રવાળા બને છે, ધર્મના પક્ષપાત્રને પક્ષ પક્ષી શક્તા નથી.

(૭) જેમ અહુજામલ્લે લાવેલ ખેડૂતમલ્લ આવડત, પ્રયત્ન અને દુઃખવાળા સ્થાનકથનથી સાજા ધવાધી જીત્યો, તેમ જ્ઞાન-સંયમ-આરાધના-ઉત્સાહ વગેરે હોવા સાથે દોષશોધન હોય તો જીતાય અને દોષસેવન, દોષકથન, દોષશોધન હોય તો પ્રયત્ન ઘટી જાય, ઉત્સાહ ઉત્તરી જાય, આવડત પક્ષ મોહ-આસક્તિ વગેરેથી નિરર્થક થાય.

દેડકીની હિસાના અસ્વીકારમાં ચેડકોશિકનો પ્રયત્ન, આવડત જતા રહ્યા, અખાડાભૂતિના લાડવાના દોષના અકથનમાં આવડત, પ્રયત્ન નાશ પામ્યા. બધે એક જ વાત છે-દોષથી સંરક્ષણ, દોષનું શુદ્ધિકરણ એ ગુણ પ્રાપ્તિ અને ગુણ વર્ષનનો ઉપાય છે અને તેથી વિપરીત દોષની ઉપેક્ષા, દોષનું પોષક એ ગુણફ્રાસ અને ગુણનાશનું કરાક્રા છે.

માટે ધર્મ આરાધનામાં ધર્મ પ્રવૃત્તિનું જેટલું માહાત્મ્ય છે તેના કરતાં વધારે દોષરહિત પ્રવૃત્તિનું, દોષને રોકવાની કાળજીનું માહાત્મ્ય છે માટે દરેક દોષોને જાગ્રવા, છોડવા અને આલોચનાથી શુદ્ધ થવું અનિવાર્ય છે. તેથી આલોચના એ યોગમાત્રના સંગ્રહનું કરાક્રા છે.



## ○ : ગુણી ચ ગુણરાગી ચ સરલો વિરલો જન : ○

યોગ સંગ્રહમાં બીજો બેદ છે નિરપલાપ. અપલાપ એટલે દોષકથન. ગુરુને આશ્રયીને આલોચને કરેલ પાપનું-દોષનું બીજાને કહેવું. કોઈએ પણ બીજાના દોષો ન બોલવા તે નિરપલાપ. આ યોગની બૂમિકા છે. જે વાત બીજા તરફથી કરાતી આપજાને ન ગમે તે બીજા માટે પણ ન કરવી. બીજાના દોષો બોલવા તે નિદા કહેવાય. કઠોર-કર્કશ-અસાધ્ય વચન-અવ્યાખ્યાન-પિશુનપણું વળેરે પણ અપલાપ છે. તે વર્જવાથી જીવ સાધનાને યોગ્ય બને છે. પોતાના દોષો પણ કેમ યોગ્યને કહેવાનું વિધાન છે તેમ અગીતાર્થને, જેને તેને ન કહેવાય તે પણ ઉપલબ્ધાર્થી જાણવું.

રમણીય દંતપુર નગર ..... ન્યાયી દંતયક રાજાનું શાસન.....  
ઉપમનોહર રાણી સત્યવતી..... પાંચ મ્રકારના વિષયસુખો બોગવતાં ગર્ભધારણા..... ગર્ભના પ્રભાવે રાણીને દોહલો થયો કે “ હું હાથીદાંતના મહેલમાં આનંદથી વિશ્વરું ” પરંતુ આ દોહલો પૂર્વી થવાનું અશક્ય લાગવાથી કોઈને પણ કહ્યો નહીં અને શરીર હૃદ થવા લાગ્યું. .. એક દિવસ રાજાની નજર રાણીના શરીર પર પડી-મન ઉદિગ અને તન જિન જોઈ રાજાને પૂછ્યું... “ શું તમારા શરીરમાં કોઈ રોગ વેરો ધાલ્યો છે? શું તમારું કોઈએ અપમાન કર્યું છે? કોઈ હંઘાપૂર્તિ બાકી છે? ”

‘સ્વામી! નથી આવ્યો કોઈ રોગ કે નથી થયું અપમાન. પરંતુ ગર્ભના પ્રભાવે કેટલાય દિવસોથી એક દોહલો ઉત્પન્ન થયો છે. પણ તે પૂર્વી થયો અશક્ય લાગે છે. આપને કહીને શા માટે ચિંતામાં નાંખું?... ‘દેવી! જો દોહલો પૂર્વી નહીં થાય તો આ કંચનવર્ગાક્યા નાન થઈ જશે. મને જણાવો તો ખરા, શક્ય પ્રયત્ને હું પૂર્વી કરીને જ રહીશ.’

‘નાથ! ગર્ભનો જીવ આપ જેવો જ પુણ્યશાળી લાગે છે. તેના આગમનથી મને ઈચ્છા થાય છે કે હાથીદાંતના સુંદર મહેલમાં સખીઓ સાથે કીડા કરું.’

‘આટલી નાની વાત શું મારા માટે તમને અશક્ય લાગો? હમણાં જ સેવકોને આદેશ આપું છું.’ દંતયકે સેવકોને બોલાવી નગરમાં ધોષણા કરાવી કે જેની

પાસે હાથીદાંત હોય તે રાજને આપે. રાજભંડારમાંથી તેનું યોગ્ય મૂલ્ય ચૂકવવામાં આવશે. જે રાખી મૂકશે અને પાછળથી પકડશે તો દેહાંત ઈંડ થશે....

આ જ નગરમાં ધનમિત્ર અને દફભિત્ર નામના બે વેપારીઓ રહે. ધનમિત્રને ધનશ્રી અને પદ્મશ્રી નામની બે પત્નીઓ... પદ્મશ્રી વધારે પ્રિય...

એકદા ધનશ્રી અને પદ્મશ્રી વચ્ચે કોઈ કારણસર જગડો થયો. ધનશ્રીએ પદ્મશ્રીને કહું કે ‘આટલો ગર્વ શેનો કરે છે? મારા કરતાં તારી પાસે શું વધારે છે? શું સત્યવતીની જેમ તારા માટે હાથી દાંતનો મહેલ બંધાય છે?’..... ‘તમારી દેખતાં જ જો હાથીદાંતનો મહેલ ન બંધાવું તો મારું નામ પદ્મશ્રી નહીં?’ પદ્મશ્રીએ ગુસ્સામાં સ્વીકારી લીધું. ઘરના ખૂલ્ખામાં એક ઓરડામાં જઈને સૂઈ ગઈ.

મધ્યાહ્ન ધનમિત્ર બોજન માટે આવ્યો. પદ્મશ્રી ન દેખાતા દાસીઓને પૂછ્યું. દાસીએ અથવી ઈતિનો આજનો પ્રસંગ કહ્યો. ધનમિત્ર દોડયો તે ઓરડા તરફ...

‘પ્રિયે! શું થયું? રીસાવાનું કોઈ કારણ? તારી પ્રસન્નતા માટે હું બધું જ કરવા તૈયાર હું.’

‘પતિદેવ! આપનાથી શું છુપાવવાનું હોય? મારે રહેવા માટે એક હાથીદાંતનો પ્રાસાદ કરવી આપો.’ ધનમિત્રે પદ્મશ્રીને હા તો કહી પરંતુ રાજની આશાનું જંઝ કરી આ કાર્ય કરવું કેટલું જોગમી છે તે વિચારે તે વિનિત બન્યો.

‘મિત્ર! આજે આટલો વ્યવિત કેમ છે? વેપારમાં નુકશાન ગયું છે કે શરીરમાં બ્યાધિ થયો છે?’... ઘરમાં પ્રવેશતા દફભિત્રે પૂછ્યું. ‘દફભિત્ર! એક કાર્ય મને મુંગલી દીધો છે. તેમાં જો ગજલત થઈ તો મોત નકી...’ ધનમિત્રે પદ્મશ્રીની પ્રતિશાની વાત કરી અને આ કામ શી રીતે પાર પાડવું તે માટે દફભિત્રની સહાય માંગી... દફભિત્રે આ કાર્ય માટે હાથીદાંત લાવી આપવાની જવાબદારી લીધી. ભીલોને આપવા માટે આભૂષણ-માળા-ધન લઈને જંગલમાં ગયો. ધન વગેરે આપી હાથીદાંતને ગ્રહણ કર્યો. વાસના પૂળામાં બાંધી નગરમાં લાવતો હતો તેજ વખતે દરવાજામાં બળદે પૂળાને ખેંચ્યો. તેમાંથી હાથીદાંત નીચે

પડ્યો. આજુબાજુ ફરતાં આરક્ષકોએ હાથીદાંત જોયો. રાજશાનો બંગ જાડી દઢભિત્રને પકડી રાજ સામે હાજર કરવામાં આવ્યો. બધી વાત કહેવામાં આવી. ગુર્સે ધ્યેલ રાજાને તરત જ ફાંસીની સજા ફટકારી.

આ બાજુ ધનભિત્રને ખબર પડી. અત્યંત વ્યચિત હૃદયે દોડતો રાજસભામાં આવ્યો. ‘રાજન! આ બધાના મૂળમાં હું છું તેથી દઢભિત્રની સજા મને કરો. તે નિર્દોષને છોડી દો.’

‘દઢભિત્ર! આ શું કહે છે? સાચું જગ્ઘાવ જેથી મારા હાથે નિર્દોષની હત્યા ન થઈ જાય.’ રાજાને આચાર્ય પામતાં દઢભિત્રને પૂછ્યું.

‘રાજન! આ વ્યક્તિ કોણ છે હું ઓળખતો નથી. મારે તેની જોડે કોઈ સંબંધ નથી. દોષી હું જ છું, આપે શિક્ષા કરી છે તે બરોબર છે.’

રાજાને બન્નેની વાતમાં સત્ય ન પકડાતા બન્ને પાસે અભયદાન આપવાનું કહી સોંગં લેવગયા ત્યારે સત્ય વાત પ્રગટ થઈ. બન્નેનું સન્માન કરી વિસર્જિત કર્યા.

આચાર્ય- બીજાંથી પક્ષ આ રીતે બીજાનો દોષ બીજા આગળ કહેવો નહીં અર્થાત્ નિરપલાપવાળા થવું જોઈએ.

તુચ્છ- અશુભ- દોષયુક્ત આલાપ તે અપલાપ. એટલે નિંદા- ન બોલવા જેવું બોલવું, તેના દોષો કહેવા, અપ્રીતિકારક બોલવું.

યોગી- ધર્મ આત્મા- વિશેષ ઉચ્ચી આરાધના ઈચ્છનાર ક્યારેય બીજાની નિંદા ન કરે, બીજાના દોષો જુવે નહીં, જ્યાં - ત્યાં બોલતા ન કરે.

અહીં છેલ્લી કોઈના અર્થમાં આ વાત છે કે ધર્મી શ્રાવક કે સાચું પોતાના ધર્મગુરુ આચાર્ય પાસે પોતાના સૂક્ષ્મ પણ દોષો કે જે પોતાના સિવાયના બીજા કોઈ ન જાણતા હોય તેવા પણ આત્મશુદ્ધ માટે નિખાલસ પક્ષો કહે. તે સાંભળનાર આચાર્યની આ ફરજિયાત મહાન સત્યયુક્ત ફરજ છે કે તેમની કોઈપણ વાત સ્પષ્ટ કે અસ્પષ્ટ અધ્યાત્મરથી પક્ષ જગ્ઘાય નહીં, વંગથી- અર્થાપત્તિથી કે કોઈ પણ રીતે મહાત્માર્કિક અને ન્યાયાર્થી પક્ષ ન પામી શકે તે રીતે દોષકથન-

સૂચન રહિત બનવું પડે. આનાથી આલોચના કરનારને દૃઢ વિશ્વાસ થાય છે. અનેની આરાધના પ્રવર્ત્ત છે.

જો આચાર્ય આલોચકના દોષો કહે તો પોતાની સાખના- યોગો નાશ પામે છે અને અનંતસંસાર પણ ઉપાર્જિત થાય. અને બીજાને ન કહે તો પોતાના સંયમ આરાધનાની વૃદ્ધિ થાય છે. અનેક યોગોની યોગ્યતા જન્મે છે. બીજાને પણ આલોચના કરાવવા દ્વારા પાપનિવૃત્તિ- શુદ્ધિકરણ અને આરાધનામાં ઉત્તેજનર પ્રવૃત્તિ કરાવે છે. આમ આચાર્યની અપેક્ષાએ આલોચકના દોષો ન કહેવારૂપ નિરપલાપપજું જેમ છે, તેમ પોતાની પાસે આલોચના નથી કરી પરંતુ બીજા ત્રીજા પાસેથી કે તે વ્યક્તિ પાસેથી જ તેના દોષો જાણીને નિંદારૂપે કે અવિવેકરૂપે જ્યાં- ત્યાં, જ્યારે- ત્યારે કહેવા તે પણ અપલાપ મહાપાપરૂપ અને સર્વધર્મનો નાશ કરનાર- સર્વયોગોનો નાશ કરનાર છે. માટે કોઈનું પ હલકું ન બોલવું.

. કયાંક કહેવાની પરિસ્થિતિ કે ફરજ ઉભી થાય તો પણ તેવા યોગ્ય- ગંભીર વીળને અવસરે એકાંતમાં ભ્યાલ આપવા માટે કહેવું. તે પણ આલોચના કરનાર વ્યક્તિની વાત આચાર્ય તો ન જ કરવી.

દરશ્વૈકાલિક સૂત્રમાં કહું છે કે કાનથી થશું સંભળાય છે, અંખથી થશું જોવાય છે, પરંતુ પર્માં આત્માએ જોયેલું કે સાંભળેલું બધું બોલવું યોગ્ય નથી.

આ નિંદા અપલાપ છોડવા માટે નીચેની વાતો પણ છોડવી અનિવાર્ય છે. આ વાતોનું વર્જન પણ આમાં અંતર્ગત થતું સમજશું-

(૧) સામાન્યથી અતિવિશિષ્ટ પ્રયોજન વિના બીજાને અપીતિ થાય તેવું ન બોલવું.

(૨) બીજાના દોષો તેને કે બીજાને ન કહેવા. (એકાંતમાં ડિતશિક્ષા સિવાય)

(૩) જાહેરમાં ઠપકો ન આપવો, ટકોર ન કરવો.

(૪) કઠોર- કર્કશ ભાષા પ્રયોગ ન કરવો.

(૫) આબેદ- આરોપ કલ્યનાથી ન કરવા, વાસ્તવમાં પણ ન કરવા.

(૬) તે વ્યક્તિ હલકી દેખાય તેવો વ્યવહાર ન કરવો.

(૭) ગંભીર વાતો અગંભીરને ન કરવી.

(૮) બિનમ્પથોજને ગંભીરને પણ ગંભીર વાતો ન કરવી.

આ ગુણ લાવવા માટે પેટનું પાણી પણ ન છાલે તેવી ગંભીરતા લાવવી જોઈએ. કેવળજ્ઞાની પણ બીજાના દોષો દેખવા- જીવા છતાં બોલતા નથી તો બીજા સામાન્ય મનુષ્યે સુતરામ્ય ન બોલાય.

બીજાના દોષો જ્યાં- ત્યાં, જ્યારે- ત્યારે, જેવી- તેવી રીતે કહેતો ફરે તો તે જ દોષો પોતે અનેકવાર પામે છે. માટે નિરપલાપપણું તે યોગસંગ્રહ છે. આ ગુણ સ્વયં યોગરૂપ છે અને અનેક યોગો- ધર્મના પ્રકારોને પમાડે છે.

જેમ નિંદા અપલાપ કહેવાય તેમ

(૧) નિરર્થક- ફળૂલ- રાગ- દ્રેષ- મોહ- અજ્ઞાન- પ્રમાદ પોષક વાતો અપલાપ છે માટે વિવેક- સમતા- ધૈર્ય- ગંભીરતા વગેરે ગુણકારક વચ્ચનો બોલવા.

(૨) પોતાની જાતે પોતાના ગુણો જાવા તે પણ અપલાપ છે.


(૩) ગુણીના દોષ ગાવા અને વિશિષ્ટ દુર્ગણીના ગુણો ગાવા તે અપલાપ છે.

(૪) પોતાના દોષો- ગુપ્ત ગંભીર ભૂલો જામને બેગું કરી, પંચની હાજરીમાં કહેવા તે અપલાપ છે.

આ અગોતાર્થ પાસે આલોચના કારણરૂપ હોવાથી સ્વ-પરની દુર્ગતિનું કારણ બતાવેલ છે. માટે અપલાપ ત્યાગ અને સમ્યગ્ય આલાપ બન્ને યોગ સંગ્રહ સમજવા, અહીં આલાપના ઉપલબ્ધાથી અનુચિત- અસમ્યગ્ય વિચાર- વર્તન પણ યોગનાશક હોવાથી વજર્ય સમજવા- સમ્યગ્ય વિચાર ઉચ્ચાર અને વર્તનમાં વાંચનાહિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય વિ. ધર્ષણ આવી શકે. તેનાથી યોગનો ધર્મ સંગ્રહ થાય છે.

ધર્મકથા દ્વારા સમ્યગ્યાનાદિની સ્વ-પરને ઉત્પત્તિ થાય છે.

વાંચનાથી શાસ્ત્રની પ્રાપ્તિ- શુત્ક્રાનનું વિશ્વીકરણ થાય છે.  
પૃથ્વાથી સંદેહરહિતપણું,  
પરાવર્તનથી જ્ઞાનનું સ્વિશીકરણ,  
અનુપ્રેક્ષાથી મનનું સ્વિશીકરણ થાય છે.  
ઉપભૂંડણા- વાત્સલ્યથી બીજાનું ઉત્સાહકરણ- ધર્મમાં પ્રવૃત્તાકરણ-  
દોષનિવર્તન કરાય છે. તેથી અપલાપ- નિંદા- આત્મોત્કર્ષને છોડી ગુણાનુરૂપી-  
ગુણાનુવાદી બનવા પ્રયત્ન કરવો.



## ૦ ૦ પાંચ લિંગ સમકિતતણ કહ્યા રે ૦ ૦

આસ્લિક્ય એટલે કે મોક્ષ, મોક્ષના ઉપાય, આત્મા, આત્માની નિત્યતા, કર્ત્તાપણું અને બોક્તાપણું આ છ માન્યતા ધાર્ય એટલે પોતાના આત્માની ભાવ અનુંક્ના આવે, એંધી આશ્રવોધી આત્માને બચાવવાની અને સંવરમાં પ્રવર્તાવવાની ઈચ્છા ધાર્ય.

જ્યાં સુધી આત્માને પાપોથી બચાવવાની ભાવઅનુંક્ના ન આવે ત્યાં સુધી આ ઈચ્છા આવે નહિ, આવે તો ઉપલકીયા દેખાવની હોય.

એ ભાવ અનુંક્નાથી જ (પોતાના) આત્માને પીડાના કારણભૂત, પાપના કારણભૂત આશ્રવોનો કંટાળો આવે જેને સંસાર- નિર્વદ કહેવાય છે અને એ કંટાળાના કારણે આશ્રવ-નિવૃત્તિ અને સંવરમધ્વત્તિ આવે છે.

આ નિર્વદ ઈચ્છાની તીવ્રતા દ્વારા પ્રવૃત્તિ કરાવે છે. આ સ્વભાવાનુંક્ના નિર્વદને ઉત્પન્ન કરે છે, મજબૂત બનાવે છે. આ નિર્વદ પણ ટકે વધે ત્યારે અનાથી છૂટીનું બોછ અવસ્થા મેળવવાની હોય, અને એ મોક્ષ છે. તે આસ્લિક્યથી અનુભવાય છે તેથી આ નિર્વદ મોક્ષની ઈચ્છાને અત્યંત વેગવાળી બનાવે છે. જેમ મોક્ષની ઈચ્છા વેગવાળી બને તેમ તેના કારણકુપ સંવરની પ્રવૃત્તિની અને આશ્રવ નિવૃત્તિની ઈચ્છા પણ તીવ્ર બને.

જેમ આ બે પ્રવૃત્તિની અને નિવૃત્તિની ઈચ્છા તીવ્ર બને, પ્રવૃત્તિ નિવૃત્તિ તીવ્ર બને તેમ વિઘનજય- સ્થિરતા- સહનશીલતા- નિશ્ચલતા આવે જ, માટે સ્થિરતા, અતિચાર રહિતતા સંવેગથી જ પ્રાપ્ત ધાર્ય છે, સંવેગ કારણ છે, સ્થિરતા કાર્ય છે, સંવેગથી નિર્વદધી શરૂ ઉત્પન્ન ધાર્ય છે.

નિર્વદધી સંવેગ જન્મે છે તેમ ટકે છે. સંવેગની તીવ્રતા શરૂને- શાંતિને, કથાય વિષયના આવેગની મંદતાને કરે છે.

આ શરૂ એ સમતારૂપે તીવ્ર બને છે અને એ સમતા કહો કે શરૂની તીવ્રતા કહો એ આરાધનાના દરેક અંગમાં સિદ્ધિ આપે છે. સારાંશ- સર્વકાર્યની સિદ્ધિ માટે સ્થિરતા રૂપ શરૂ જોઈએ છે. સિદ્ધિ સ્થિરતાથી આવે એ માટે તીવ્ર

અભિલાષારૂપ સંવેગ જોઈએ.

સ્વિરતા પ્રવૃત્તિ બાદ જરૂરી છે. પ્રવૃત્તિ, વિરોધ પ્રવૃત્તિઓના કંટાળાથી અને પ્રસ્તુત પ્રવૃત્તિની હંચાથી આવે છે. પ્રસ્તુત પ્રવૃત્તિની હંચા દોવા છતાં વિરોધ પ્રવૃત્તિઓનો કંટાળો ન હોય. તો પ્રવૃત્તિ વાસ્તવિક સ્વરૂપ પકડતી નથી.

આ હંચા પોતાને લાભકારી છે અને વિરોધ પ્રવૃત્તિ નુકશાનકારી છે તેમ લાગવું જોઈએ. આ જે લાભકારી લાગવું તે પણ ભાવ- અનુકૂળ છે. આના વિના નુકશાન- દુઃખ છે તે લાગવું તે પણ ભાવ અનુકૂળ છે.

અનુકૂળપાના બે વિષય બનાવવાઃ જો જ્ઞાન નથી તો અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનથી જીવની અનુકૂળા (કન્યારૂપ), તેમ એના ઉદ્ઘારનો ઉપાય જ્ઞાન છે. એ એને બચાવવાનો સુખી કરવાનો ઉપાય છે તેમ જાહી જ્ઞાની બનાવવા પ્રયત્ન કરવો.

આ રીતે પાપથી આત્માની ભાવ અનુકૂળ આવે તો ધર્મમાં પ્રવૃત્તિ અને પાપ નિવૃત્તિની હંચા જન્મે.

આ જન્મે ગુણ જેવી વસ્તુ માનીએ પઢી આવે, મોકા માનીએ તો ભાવ અનુકૂળપા અને ધર્મ હંચા આવે.

માટે, પશ્ચાનુપૂર્વી લાભ અને એના કાર્ય બતાવેલ છે તે બરાબર છે.



## ○ ○ દર્શાનાચાર મીમાંસા ○ ○

તાત્ત્વિક દ્રષ્ટિએ સમ્યગ્દર્શન એટલે અનંતાનુંથી કખાય અને દર્શન મોહનીયના કથ્ય, ઉપશમ કે કથ્યોપશમથી ઉત્પન્ન ધ્યેલો આત્મપરિષ્ઠામ અને વ્યવહારથી જોતાં શુદ્ધ દેવ, નિર્ઝન્ય ગુરુ અને જિનમજૂરીત ધર્મની અવિચલ શક્તા એટલે સમ્યગ્દર્શન....

સમ્યગ્દર્શિ આત્મા વસ્તુને યથાવસ્થિત રૂપે જાણો અને તેમાં શક્તા પડે. આત્માના અસ્તિત્વને અને તેના યથાવસ્થિત સ્વરૂપને જાણો અને સ્વીકારે. મોકાના યથાવસ્થિત સ્વરૂપને અને તેના કારણોને જાણો અને સ્વીકારે. સંસારના યથાવસ્થિત સ્વરૂપને અને તેના કારણોને જાણો અને હૃદયથી સ્વીકારે. પરંતુ બુદ્ધિશક્તિની મર્યાદા વગેરેના કારણો વસ્તુના યથાવસ્થિત સ્વરૂપને ન જાણો શકે અથવા વિપરીત જાણો અથવા સંદેહ ઉત્પન્ન થાય તો સમ્યગ્દર્શિ આત્મા વિચારે કે- “સર્વજનનું વચન તો સો ટચના સોના જેવું છે, સંપૂર્ણ સત્ય છે. જિનોકંત તત્ત્વ મારી બુદ્ધિમાં બેસતું નથી તેમાં મારો મતિવ્યામોહ કે અજ્ઞાન જવાબદાર છે. મારી બુદ્ધિમાં ન બેસે તેથી તે વસ્તુ અગ્રામાંદિક ન બની જાય.” આવી દહ્ન માન્યતા અને વારંવાર વિચારણા તે પણ સમ્યગ્દર્શન છે.

સમ્યકૃત નામના આ મહાન આત્મગુણને ઉત્પન્ન કરવા, ટકાવવા, વધારવા અને નિર્મળ કરવા તેના આચારોનું પાલન કરવું પડે. આચારપાલનનું એ સામર્થ્ય છે કે તેનાથી ગુણાને અનુકૂળ ભાવ જાગે, ટકે અને વધે તથા ગુણથી વિપરીત ભાવો ઘસાય, ભૂલાય અને નાશ પામે.

જે જે ગુણો મેળવવા હોય તેને સાક્ષાત કે પરંપરાએ બાધક હોય તેવા અસહ આચારો છોડવા જોઈએ અને સાક્ષાત કે પરંપરાએ સાધક હોય તેવા ઉત્તમ આચારો આદરવા જોઈએ. સમ્યગ્દર્શન ગુણના કુલ આઠ આચારો છે. (૧) શંકા ત્યાગ (૨) કંચા ત્યાગ (૩) વિચિકિત્સા ત્યાગ (૪) મૂઢ્દ્રાણી ત્યાગ (૫) ગુણવંતની ઉપભૂતશા (૬) સ્વિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના.

### **પ્રથમ આચાર : શંકાલ્યાગ**

જિનવચનમાં સંદેહ ન કરવો તે સમૃદ્ધિનાનો આચાર છે તેથી જિનવચનમાં શંકા કરવી તે દૂષણ છે તેમ જિનવચનથી વિપરીત વાતમાં નિઃશંકપણું રાખવું તે પણ દૂષણ છે. તે શંકા કે નિઃશંકપણાના આપારે મિથ્યાત્વ અને સમૃકૃતની કષા નક્કી થાય છે.

- (૧) વિપરીતમાં સાચા તરીકેનું નિઃશંકપણું તે ગાડ મિથ્યાત્વ.
- (૨) વિપરીતમાં સાચું હોવાની શંકા તે મંદ મિથ્યાત્વ.
- (૩) જિનવચનમાં ખોટું હોવાની શંકા તે સમૃકૃતનો અતિચાર અને સમૃગ્દર્શનના આચારનો ભંગ.
- (૪) વિપરીત વચનમાં વિપરીત વચન તરીકેનું નિઃશંકપણું તે નિર્મલ સમૃકૃત અને સમૃગ્દર્શનના આચાર.
- (૫) વિપરીતમાં વિપરીત તરીકેની શંકા તે મંદ સમૃકૃત.
- (૬) સાચામાં સાચા તરીકેની શંકા તે સમૃકૃતનો અતિચાર.
- (૭) સાચામાં સાચા તરીકેનું નિઃશંકપણું તે સમૃકૃત.

જ્ઞાનાવરણ કર્મના ઉદ્દેશ્યે જિનવચનમાં કયાંય પણ વિપરીત જ્ઞાન કે સંદેહ થાય ત્યારે પોતાને સાચી જગ્ઞાતી વાત જો શાસ્ત્ર કે શાસ્ત્રજ્ઞોના કથનથી વિપરીત હોય તો માનવું કે-આ મારી ભાન્તિ છે, મારું અણાન છે.

તત્વને બુદ્ધિમાં નિયિત અને સ્પષ્ટ કરવા શંકા ઉઠાવીને તેના સમાધાન મેળવવાથી તત્વજ્ઞા વધુ નિર્મળ બને છે. આવા આશાપથી ઉઠેલી કે ઉઠાવેલી શંકા એ દર્શનાચારનો અતિચાર નથી, પરંતુ જ્ઞાનાવરણનો ઉદ્દ્ય છે અને ચિંતન-મનન-અન્યેપક્ષથી તેનો કષોપશમ થાય છે. ‘તમેવ સર્વ નિસ્સંકં જં જિણેહિં પવેહ્ય’ – ની ભાવનાથી ભાવિત અને વાસિત રહીએ તો આવી શંકા બાધક નથી.

### **શંકા-અતિચાર ઉત્પન્ન થવાનાં કારણો :**

- (૧) પોતાની બુદ્ધિની બહુ મહત્વા કરવી, તેના ઉપર મુસ્તાક રહેવું, મારી બુદ્ધિમાં બેસે તો જ હું માનું આવો પોતાની બુદ્ધિ પરનો આંધળો વિશ્વાસ શંકા

અતિયારને ઉત્પત્ત કરે છે.

(૨) 'તમેવ સર્વ નિસંક્ત જે જિણેહિં પબેઝ્યં' - ની ભાવનાથી ચિત્તને ભાવિત ન બનાવવાથી શંકા અતિયાર ઉત્પત્ત કરે છે.

(૩) શાસ્ત્રના પદાર્થો બે પ્રકારના હોય છે. કેટલાક અતીન્દ્રિય પદાર્થો ચિના-દલીલ સ્વીકારી લેવાના હોય છે, તેમાં જિનેચરહેવની આજ્ઞા એ જ પ્રમાણ છે. આ પદાર્થો આજ્ઞાગ્રાહ છે. તમામ શાસ્ત્રવચનનો માટે આજ્ઞા તો પ્રમાણ છે જ, પરંતુ, હેતુ, તર્ક અને યુક્તિથી પણ જાળી શકાય તેવા પદાર્થો હેતુગ્રાહ પદાર્થો છે. શાસ્ત્રનીય પદાર્થોની હેતુ, તર્ક અને યુક્તિઓથી સિદ્ધ કરનાર સ્વસ્થિદાનના પ્રમાણગ્રન્થો અને પ્રમેયગ્રન્થોમાં પ્રવીણ ન બનવાથી શંકાઓ ઊભી રહે છે. તેમ તેમાં પ્રવીણ બન્યા વિના અન્ય દર્શનના શાસ્ત્ર વાંચવાથી કે એમના સંન્યાસી વગેરેનો ઉપદેશ સંબળવાથી કે તેમનો પરિચય કરવાથી શંકા-અતિયાર પેદા થાય છે.

(૪) નિર્બંહ અતાત્ત્વની વાતોમાં પોતાના કુતકોને લડાવા કરવાથી અથવા તેવા કુતક લડાવનારનો સંપર્ક રાખવાથી શંકાનો અતિયાર લાગે.

(૫) જે શિષ્ટ-વ્યવહાર કે આચાર પોતાની અનુકૂળતામાં બાધક બનતો હોય તે વ્યવહાર કે આચારને જ કુતકોથી દોષિત કે ખોટો હેરવવાથી અથવા તેમાં શંકાઓ ઊભી કરવાથી પણ આ અતિયાર લાગે.

કોઈ પણ રોગથી મુક્ત થવા પહેલા તેના લક્ષણોથી રોગનું નિદાન કરવું પડે, રોગને ઉત્પત્ત થવાના કારણો જાણવા પડે અને તે રોગનું નિવારણ કરવાના ઉપાયો જાણવા અને અજ્ઞમાવવા પડે. તેમ, શંકા નામના પ્રથમ દોષનું સ્વરૂપ અને તે ઉત્પત્ત થવાના કારણો જાણવા પછી શંકા દોષ ઉત્પત્ત જ ન થાય અને થયો હોય તો તેનું નિવારણ થાય તે માટેના ઉપાયો જાળીને અજ્ઞમાવવા જોઈએ.

#### શંકા દોષ નિવારણના ઉપાયો :

(૧) કોઈકની વાતો સાંભળીને વામોહ ન થઈ જાય તે માટે બીજા કોઈ આચારસંપત્ત અને જ્ઞાનસંપત્ત યોગ્ય વ્યક્તિને માથે રાખવા, આપણા જ્ઞાન અને માન્યતા માટે તેમને અનુસરવા, સ્વતંત્ર નિર્ઝીય ન લેવો, તે શરૂઆત વ્યક્તિની સલાહ વિના કોઈની વાતમાં ભરમાઈ ન જવું.

(૨) 'તમેવ સર્વ નિસંક જં જિણેહિં પબેઝં' ને જીવનમંત્ર બનાવી દેવો, તેનાથી આત્માને અત્યંત ભાવિત કરી દેવો.

(૩) જે પોતાની કલાના આચારમાં ચુસ્ત ન હોય પણ શિથિલ હોય, જે અસંવિગ્રહ હોય અને જે શાસ્ત્ર વિનેદ્ધ બોલનારો એટલે કે ઉંસૂત્રભાષી હોય તેનો સંગ ન કરવો.

(૪) અન્ય ધર્મના સંન્યાસીઓ કે પંડિતોના સંપર્કમાં ન આવતું, પરિચય ન કરવો, તેમની સાથે ચર્ચાઓ ન કરવી.

(૫) જ્યાં સુધી પોતે માર્ગમાં સ્થિર નથી થયો અને સ્વ-દર્શનમાં પ્રવીશ નથી બન્યો ત્યાં સુધી અશ્વદ્ધાળું, નાસ્તિક કે અન્યદર્શનીને ઉપદેશ આપવાનો કે તેની સાથે ધર્મચર્ચામાં ઉત્તરવાનો અભિરખો ન કરવો.

(૬) શાસ્ત્રસંગતિ કરીને શ્રદ્ધાને દૃઢ કરે ત્યાં સુધી તર્ક ઉપકારી છે. પણ તર્ક જો કુત્ક બને તો શ્રદ્ધાને ડામગાવી પણ હે, તેથી તર્કને શાસ્ત્રભાવિત રીતે ઉત્તેજિત ન કરવા.

(૭) જ્યાં સુધી પોતે માર્ગમાં સ્થિર ન થાય અને સ્વદર્શનમાં પ્રવીશ ન બને ત્યાં સુધી ઈતરદર્શનના ગ્રન્થો કે ઈતર લેખકોના સાહિત્યનું વાંચન ન કરવું.

(૮) સ્વદર્શનની અવિચલ શ્રદ્ધા, સ્થિરતા અને પ્રવીશતા પ્રાપ્ત થયા વગર જેન દર્શન અને અન્ય દર્શનોનો તુલનાભક્ત અભ્યાસ ન કરવો. તેમ કરવા જતાં બીજાની મહત્ત્વાદી હિલમાં વસી જવાની, તેની વાતો પ્રમાણભૂત અને યુક્તિસંગત લાગવાની અને તે વાતોની પકડ આવી જવાની તથા સ્વદર્શનમાં શંકા થવાની સંભાવના છે.

(૯) શાસ્ત્રોનું અધ્યયન, સમ્યક્ત્વ આદિ ગુણોની ભાવનાઓ અને ગીતાર્થ ગુરુભગવંતનો સંપર્ક અને સેવા વારંવાર કરવા.

આ રીતે શંકા-અતિચારના પ્રેરક અને પોષક કારણોથી દૂર રહીને શંકા-ત્યાગના આચાર માટે પ્રેરક અને પોષક ઉપાયોનું સેવન કરીએ તો સમ્યગ્દર્શન નિર્બય અને નિર્મળ બને.

### **બીજો આચાર : કાંકાત્યાગ**

કાંકા એટલે ઈચ્છા, પરદર્શનના આકર્ષણોથી અંજાઈ જઈને તેની ઈચ્છા કરવી તે કાંકાદોષ, ચર્ચની શાંતિ જોઈને તેનાથી પ્રભાવિત થઈ જાય કે કોઈ ધર્મમાં શિસ્તનું પાલન જોઈને તેનાથી પ્રભાવિત થઈ જાય, કોઈ બાવા-સંન્યાસીને ખોમધાંતા તડકામાં ખુલ્લા શરીરે આત્માપના લેતા જોઈને અંજાઈ જાય કે કોઈને ધર્મ, નિયમ કે પ્રાણાયામના અભ્યાસથી આશ્રયકારક શાસનિરોધ કરતા જોઈને મુંબું થઈ જાય... આ બધો કાંકાદોષ છે. અન્ય દર્શન પણ પરિપૂર્વી છે, દોપ્યુકત છે, મોકસાધક છે તેવી માન્યતા એ કાંકાદોષ છે. અન્ય ધર્મથી આકર્ષાઈને તેના તરફ ફળી પડવું તે કાંકાદોષ છે, આ કાંકા એ સમ્યગદર્શનનો અતિયાર છે.

તીર્થકર પરમાત્મા જ્યારે વિદ્યમાન હોય ત્યારે સમવસરજાનું ઐચ્છય તથા અતિશયોનો વૈભવ એવા અદ્ભુત હોય છે કે પરમાત્માને છોડીને બીજાનું આકર્ષણ કોને થવાનું? તો શું કાંકાદોષ માત્ર પંચમ આરાના છલ્લો માટે જ છે? ના, અન્યધર્મની ઈચ્છા એટલો જ કાંકાદોષનો ર્થાન્થી. અન્ય ધર્મની ઈચ્છા એ પણ જો કાંકા કહેવાય તો સંસારની બોગસુખોની તીવ્ર ઈચ્છા એ કાંકા નહિ? અન્ય દર્શનની કાંકા એ પણ દોષ ગવ્યાય તો પાંચ ઈન્દ્રિયોના વિષયોની તીવ્ર કાંકા એ દોષ નહિ? સંસારના બોગસુખો તુચ્છ છે. ઈન્દ્રિયોના વિષયો શુદ્ધ છે, વિષય-કષાયની પ્રવૃત્તિઓ અપ્રશસ્ત છે. અપ્રશસ્ત પદ્ધતો કે પ્રવૃત્તિઓની ઈચ્છા તીવ્ર બને તો અનંતાનુંધીના ઉદ્યને ખેચી લાવે અને સમ્યકૃતવથી વાટ કરે. તેથી, અપ્રશસ્ત ઈચ્છાઓની તીવ્રતા એ પણ કાંકા દોષ છે, સમ્યકૃતનો અતિયાર છે.

દજુ વધારે સૂક્ષ્મમાં જઈએ તો અધિકાર કે યોગ્યતા વિનાની આરાધના કે સાધનાની તીવ્ર ઈચ્છા એ પણ કાંકા દોષ છે. જે કાળે જે સાધના માટેના યોગ્ય સંયોગો કે પરિસ્થિતિ ન હોય તે કાળે તે આરાધનાની તીવ્ર ઈચ્છા એ અકાલોત્સુક્યકૃપ છે. માસક્રમણની ભાવના હોય અને શક્તિ પણ હોય, પરંતુ સમુદ્દરમાં કોઈ ગ્લાન મુનિના વૈધાવૃત્યનો પ્રસંગ ઉપસ્થિત હોય ત્યારે

માસક્રમજાની ભાવનાને સફળ કરવાનો આગ્રહ રાખવો તે અકાલ-ઔત્સુક્ય છે. કોઈ પણ ઈચ્છાની તીવ્રતા રાગાંધી બનાવે છે અને રાગાંધી વ્યક્તિ અપણાપનીય બને છે. વશું સમજાવવા છતાં ન સમજે અને મોતાની જદુ છોડે નથી તેનું નામ અપણાપનીયતા. આ બધા કારણોથી ઈચ્છાની તીવ્રતા કંસાદોષ બને છે, સમૃદ્ધિનાનો અતિચાર બને છે.

પ્રશ્ન : કોઈ પણ ઈચ્છાની તીવ્રતાને સમ્પૂર્ણત્વનો અતિચાર કરો છો, તો તું વિશુદ્ધ સમકિતીને ઈચ્છાની તીવ્રતા ન હોય?

ઉત્તર : વિશુદ્ધ સમકિતી હુમેશા વિવેકી અને પ્રણાપનીય હોય છે. તેથી તેની કોઈ પણ સાચી ઈચ્છા તીવ્ર દેખાય તો પણ તે વિવેક્યુક્ત અને પ્રણાપનીયતાયુક્ત હોય છે. તેથી તે તીવ્રતા મોહના ઉદ્યયની તીવ્રતા નથી પણ કયોપણમભાવની તીવ્રતા છે. દૂધનો ઉલદો આવે ત્યારે તે ઉભરામાં દૂધ હોય હોય છે, વાયુ મુખ્ય હોય છે તેમ, કયોપણમની તીવ્રતાના કારણે સમૃદ્ધિ આત્માને સત્કાર્યો ઉપર સ્નેહની તીવ્રતા દેખાય તેમાં સ્નેહ અલ્ય હોય છે, કયોપણમભાવ મુખ્ય હોય છે. સ્નેહ દૂધ જોવો છે, કયોપણમભાવે વાયુ જોવો છે અને તીવ્રતા ઉભરા જેવી છે, 'પ્રશસ્ત ઈચ્છાની તીવ્રતા'માં એ નક્કી કરવું પડે કે પ્રશસ્તતાની તીવ્રતા છે કે ઈચ્છાની તીવ્રતા છે? જો પ્રશસ્તતાની તીવ્રતા હોય તો તે કયોપણમ ભાવની તીવ્રતા છે અને જો ઈચ્છાની તીવ્રતા છે તો તે મોહના ઉદ્યયની તીવ્રતા છે.

મનગમતા વિષયની તીવ્ર ઈચ્છા એ દોષ કહેવાય તો અણગમતા વિષયની તીવ્ર અરુચિ એ દોષ ન કહેવાય? જે વસ્તુ કે વ્યક્તિ ન ગમે, જેના ઉપર તીવ્ર અરુચિ હોય, જે છૂટે કે જાય તેવી જંખના રહેતી હોય.... તેવા ઈન્દ્રિયના વિષયો પ્રત્યેની તીવ્ર અરુચિ તે પણ સમ્પૂર્ણત્વનો અતિચાર છે.

વળી, જો તીવ્ર લોલાકાંકા એ દોષ છે તો તીવ્ર માનાકાંકા પણ દોષ કેમ નહિ? મારું બધા સન્માન કરે, મને બધાં દરેક વાતમાં પુછો, મારો માન-ભોલો બરાબર જળવાય... આવી માનાકાંકાની તીવ્રતા એ પણ કંકા દોષ રૂપે સમૃદ્ધિનાને અતિચારિત કરે છે.

### કંશા અત્િયાર ઉત્પણ થવાના કારણો :

- (૧) જીવનમાં ગુરૂઓની સાધના, વૈરાગ્ય અને વિવેકપ્રધાન વર્તનનું પ્રાધાન્ય જોઈએ, પરંતુ તેનું સ્વાન જો દુર્જીલો કે દુષ્કૃત્યોનો આનંદ, અનુકૂળતાનું તીવ્ર મમત્વ કે અપ્રશાસ્ત ઈચ્છાઓનું પ્રાધાન્ય લઈ લે તો કાલાનારે ઈચ્છાઓ તીવ્ર બને છે, આત્મિક નુકશાનો ઉપેક્ષિત બને છે, પ્રજ્ઞાપનીયતાને દૂર હટાવે છે, અવિચારક અને કદાગ્રહી બનાવે છે.
- (૨) સુધોગ્ય કલ્યાણમિત્રને અંગત સલાહકાર તરીકે ન રાખવાથી અને રાખ્યા હોય તો પણ તેની સલાહ અનુસાર ન વર્તવાથી કંશાદોષ ઉદ્ભવવાની સંભાવના છે.
- (૩) શાસ્ત્રોનું ગહન જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ન કરવાથી અજૂય રહેવાય અને તેથી કંશાદોષની સંભાવનાઓ ઊભી રહે.
- (૪) ગીતાર્થ ગુરુના માર્ગદર્શન અનુસારની સાધના એ પ્રધાન પ્રવૃત્તિ કરેવાય, જીવનમાં આ પ્રધાન પ્રવૃત્તિના બદલે ભળતી પ્રવૃત્તિઓ, નિર્દ્યક પ્રવૃત્તિઓ, શક્તિ બહારની પ્રવૃત્તિઓ કે ધર્મ વિરઘ પ્રવૃત્તિઓમાં રસ ધરાવવો એટલે કંશાદોષને પેસવા માટે દરવાજો ખોલી આપવો.
- (૫) આત્માનું એકમાત્ર ધ્યેય છે સિદ્ધાવસ્થા, તે સિદ્ધાવસ્થાથી આત્માને વાર્ણવાર ખૂબ ખૂબ ભાવિત કરવો જોઈએ, તેનાથી આત્માને ભાવિત ન કર્યો હોય તો દોષ આવતા વાર ન લાગે.
- (૬) મોક માત્ર સાધ્ય તરીકે રાખવાથી કાર્ય ન સરે, મોકને અનુકૂળ આચાર-વિચાર જંખના અને પથારણી પાલન પણ જોઈએ, તે ન હોય તો દોષ જેચાઈ આવે.
- (૭) રોજ આત્મ-ગવેષણા કરીને દોષોનું સંશોધન કરવું જોઈએ, સંશોધન કરીને દોષોની સુધારણાનો પ્રયત્ન સતત ચાલુ રાખવો જોઈએ, આ સંશોધન અને સુધારણાની પ્રવૃત્તિ ન ચાલે તો ઈચ્છાઓ નિરંકૃત બને.
- (૮) બીજી વ્યક્તિઓ જે તીવ્ર રાગ-દ્રેષ્ણને આધીન બનેલી છે અને તેના પરિણામે આ લોકમાં પણ અહિત અને અશાંતિનો અનુભવ કરી રહી છે તેના

તરફ દરખ્ટ કરીએ તો પણ તીવ્ર રાગ-દેખજનક ઈચ્છાઓથી બચ્ચી શકાય, તે તરફ દરખ્ટ જ ન કરીએ તો દોષનો લય ઉલ્લો ન થાય અને તેથી દોષને પેસવાનો માર્ગ નોકળો જને.

#### કંશાદોષ નિવારણના ઉપાયો :

- (૧) ગીતાર્થ ગુરુની નિત્ય પર્યુપાસના કરવી.
- (૨) તત્ત્વનું પરિશીલન અને સદ્ગ્યાવના કરતા રહેવું.
- (૩) સામાન્ય સંયોગોમાં ઈચ્છાને આવીન ન બનવું, ઈચ્છામાં અંધ ન બનવું.
- (૪) વૈષયિક ઈચ્છાઓને મહત્વ ન આપવું, વિશિષ્ટ ચીજવસ્તુઓ કે માન-સત્ત્વાની અપેક્ષાઓને પ્રયત્ન પૂર્વક ટાળવી.

#### ઈચ્છાનું સ્વરૂપ :

ઈચ્છાની તીવ્રતા એ દોષ છે અને સમ્પૂર્ણ ગુણનો અતિથાર છે, તે તો જાણું, પણ ઈચ્છાને ઓળખવી કેવી રીતે? નીચે પ્રમાણેના લક્ષણો પરથી ઈચ્છા ઓળખાઈ જાય.

- (૧) જે વસ્તુની ઈચ્છા થાય તે જોવાથી, સાંભળવાથી, પાદ કરવાથી મન મસન્ન થાય.
- (૨) તે પ્રવૃત્તિ રસ અને હોશથી થાય.
- (૩) તે વસ્તુની પ્રશંસાનું શ્રવણ રસપૂર્વક થાય.
- (૪) તે વસ્તુની નિંદાથી મન બેચેન બને.
- (૫) ઈચ્છિત વસ્તુની જાતે પ્રશંસા કરે.
- (૬) ઈચ્છિત વસ્તુ કે પ્રવૃત્તિમાં બીજાને જોડે.
- (૭) ઈચ્છિત વસ્તુ કે પ્રવૃત્તિમાં કોઈ નડતરરૂપ બને તો તેના પ્રત્યે અરૂપિ થાય.

આમ, વિવેકહીન ઈચ્છા એ જ ઈચ્છાની તીવ્રતા, આનો વિષય પ્રશસ્ત હોય તો પણ દોષરૂપ જ છે કારક્ષા કે વિવેકહીનતાના કારક્ષો ઈચ્છાની તીવ્રતા કખાય-પ્રધાન બને છે.

### **ગ્રીજો આચાર: વિચિકિત્સાત્યાગ**

વિચિકિત્સા એટલે ઉપાય, વિચિકિત્સા એટલે વિપરીત ઉપાય, રોગ થાય ત્યારે કુશળ વૈદ્ય પાસે જઈને તેમણે સૂચવેલા ઉપાય અને ઔષ્ણ કરવા તે વિચિકિત્સા છે. અને વૈદ્ય જેનો નિષેધ કરેલો હોય તેવા અપથોનું સેવન કરવું કે વિપરીત ઔષ્ણથો અજુમાવવા તે વિચિકિત્સા કહેવાય, કફના રોગમાં ગળપણ કે બી ખાવું તે વિચિકિત્સા છે.

સમ્યગ્રથોનના વિષયમાં વિચારીએ તો ધર્મના કલમાં સંદેહ રાખવો તે વિચિકિત્સા છે. હું ભગવાનની પૂજા તો કરું છું પણ તેનું કણ મને મળશે કે નહિ? હું મતિકમજા તો કરું છું, મારા પાપ પોવાથે કે નહિ? આવો ધર્મના કણનો સંદેહ થબો તે દૂષણ છે, દર્શનાચારનો અતિચાર છે, વિચિકિત્સા નામનો દોષ છે. ધર્મ અને ધર્મની ડિયાઓમાં વિશિષ્ટ કણની બુદ્ધિ તે નિર્વિચિકિત્સા.

વળી, સાધુની ભિન્ના આદિ પ્રવૃત્તિ જોઈને કે મહિન વસ્ત્ર-ગ્રાત્ર વગેરે જોઈને મનમાં જુગુપ્સા થાય તે પણ વિચિકિત્સા છે. સાધુના ભિન્ના વગેરે તમામ આચારોમાં લોકોત્તરપણાની, પરમ તારકતાની અને આદરની હાર્દિક ભાવના તે નિર્વિચિકિત્સા.

#### **દ્રોક્ષમાં વિચિકિત્સા એટલે**

- (૧) કોઈ પણ ધર્મ-અનુભાવમાં નિષ્ફળતાની બુદ્ધિ
- (૨) કોઈ પણ ધર્મ-અનુભાવમાં નિષ્ફળતાની શંકા
- (૩) ધાળી પોઈને પીવી, માત્ર પરઠવવું વગેરે કોઈ પણ ધર્મ-અનુભાવમાં જુગુપ્સા.
- (૪) કોઈ પણ ધર્મ ઉપર તેના ધર્મ-અનુભાવને કારણે કે તે વ્યક્તિના તેવા સ્વભાવને કારણે જુગુપ્સા કે તિરસ્કાર.
- (૫) દાન, શીલ તપ, ભાવ વગેરે કોઈપણ ધર્મ-અનુભાવમાં કે તેના એકાદ અવાંતર લેદમાં સાહશક અથવા કોઈ નિમિત વિશેષથી અરૂપિ થાય તો તે પણ વિચિકિત્સા છે.)

જીવો વિચિત્ર કાયોપશમ વાળા હોય છે, તેથી દરેકની રૂપી લિઙ-લિઙ હોય

શ્રી. કોઈને જ્ઞાનની વિશેષ રૂપિય હોય, કોઈને તપની, કોઈને દાર્શનિક ગ્રન્થોની રૂપિય વિશેષ હોય, કોઈને આગમ ગ્રન્થોની, કોઈને બાધ તપની વિશેષ રૂપિય હોય, કોઈને અભ્યંતર તપની. દરેક વ્યક્તિ દરેક યોગને- દરેક અનુભાનને ન આચાર્યી શકે તે સંભવિત છે. પરંતુ જે યોગ કે અનુભાનને ન આચાર્યી શકાય કે ન આચાર્યીએ તેના પ્રત્યે ચિત્તનું પલણ કેવું છે તે આત્મ ગવેષણા દ્વારા જાણી શેવું જોઈએ. તે યોગ પ્રત્યે અનુભિ કે તિરસ્કારનો બાબ હોય તો તે વિચિત્રત્વા છે. સમ્પર્કિત્વનો અતિચાર છે. તે યોગ પ્રત્યે પણ કર્તવ્ય, આદર અને અહોભાવની લાગડી જોઈએ.

આમ, (૧) ગુણની (૨) ગુણના કારણભૂત અનુભાનની (૩) ઉપકરણોની કે (૪) ગુણવાનની- ધર્મની આ ચારેયની જુગુપ્સા અતિચાર રૂપ છે.

ધક્કાને ધર્મની કે ધર્મની સૂઝ હોય છે. ધર્મ કરનારને વેદીયા કહેવા, ઉતારી પાડવા, મર્યાદા કરવી તે ધક્કાને મન ફેશન થઈ ગઈ છે. કોઈ ધર્મ માઝાસ પોતાની આજાસમજ, આજાઆવતા કે અવિવેકને કારણે અનુચ્છિત પ્રવૃત્તિ કરે તો પણ તે અનુકૂળા કે સમજાવટને યોગ્ય છે, તેના બદલે તિરસ્કાર કે જુગુપ્સા કેમ કરાય?

#### કણની રંકા થવાના કારણો:

(૧) અનુભાન એ કારણ છે અને તેનાથી જે લાભ થાય તે ફળ છે. મારે જે ફળ જોઈએ છે તે મારે આ અનુભાન મેં કષ્ટું તો ખરું પણ તેનું તે કારણ નથી, અકારણ છે આવો ભ્રમ ઉત્પન્ન થઈ જવાથી સંદેહ ઉત્પન્ન થાય.

(૨) અથવા, એવો ભ્રમ થાય કે મારે જે ફળ જોઈએ છે તેની સામે મેં આચરેલું અનુભાન ઘણું નથીલું છે. આવો, કારણની નિર્બણતાનો ભ્રમ પણ સંદેહ ઉત્પન્ન કરે.

(૩) અથવા એવો ભ્રમ ઉત્પન્ન થાય કે મેં આચરેલું અનુભાન તો મારે જે ફળ જોઈએ છે તેનાથી વિપરીત ફળ આપનાલું છે, તો પણ સંદેહ પેદા થાય.

(૪) પોતાનું સત્ય હીન હોય તો પણ ફળની આશંકા થાય.

(૫) કાળ પડતો હોવાના કારણે પણ ફળની રંકા થાય.

## કળ શાનાથી મળે?

અનુભાનની આરાધનાથી કળ મળે, પણ, તે માટે અનુભાનમાં અત્યંત આદર જોઈએ, અત્યંત શ્રદ્ધા જોઈએ, વિશેષ ભાવ જોઈએ, વિશેષ ઉપયોગ જોઈએ, આ રીતે જો અનુભાન આચરવામાં આવે તો અવશ્ય કળદાયક, અને મુક્તિદાયક બને છે, તેથી અનુભાન આદર, શ્રદ્ધા, ભાવ અને ઉપયોગ પૂર્વક કરવામાં આવે તો તેના કળની નિઃસંદેહભૂદ્રિ સહજ પેદા થાય.

### વિચિકિત્સા દોષનું વારસા કરવાના ઉપયોગ:

- (૧) તમેવ સચ્ચ નિસ્સંક, જ જિણેહિ પવેહાં ॥
- (૨) આચારના ઐહિક- પારલૈકિક લાભો વિચારવા,
- (૩) જિનોકત અનુભાનનો ભવજ્ઞમજ્ઞાનો નાચ કરનાર છે, તે ભાવના વારંવાર ભાવીને અહોભાવ ઊભો કરવો,
- (૪) વિવેકી આત્માનું સાનિધ્ય સેવવું.
- (૫) સ્વયં વિવેકદિષ્ટ કેળવવી.
- (૬) અનુભાનના અનાદરથી થતા નુકશાનો વિચારવા,
- (૭) અનુભાનના આદરથી થતા લાભો વિચારવા,
- (૮) અવિવેકનું સ્વરૂપ અને તેના નુકશાનો વિચારવા.

### ચોચો આચાર: અમૃદ્દાસિપણું

દિષ્ટિ એટલે ઓળખશક્તિ, કોઈ પણ વસ્તુને મર્મથી જાણીને તેના પથાર્થસ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. જેની દિષ્ટિ આવી વેધક, મર્મગ્રાહી અને પાસ્તિવિક હોય તે અમૃદ્દાસિ કહેવાય. આ અમૃદ્દાસિપણું તે સમ્યગ્દર્શનનો આચાર છે, સમ્યગ્દર્શિ આત્મા અમૃદ્દાસિ હોય એટલે કે મર્મગ્રાહી દિષ્ટિ ધરાવતો હોય. જે વસ્તુની સાચી ઓળખ ન કરી શકે, તત્ત્વનો- ગુણનો- પાસ્તિવિકતાનો સાચો નિર્ણય ન કરી શકે તે મૃદ્દાસિ. મૃદ્દાસિપણાથી સમ્યગ્દર્શન અતિયરિત બને છે.

### **મૂઢદિપણાના લક્ષણો:**

(૧) અન્ય દર્શનોની બાબત જાગુનાથી અંજાઈ જાય અને તે બાબત ફટાટોપ,  
દેખીતા ગુણો- વિશેષતાઓ વગેરેને કારણો તે અન્ય ધર્મમાં વિશેષતા લાગે અને  
જેન શાસનની ન્યૂનતા દેખાય- આ મૂઢદિપજાનું લક્ષણ છે.

(૨) મૂઢદિપણાથી મતિવ્યામોહ અને જડતા ઉત્પન્ન થાય છે. તેને કારણો  
જીનશાસનના અનુઝાનો, મર્યાદાઓ, વિશેષતાઓ વગેરેમાં ગુણકારિતા ન  
લાગે, પણ તે બધું નિષ્ણળ, નિરર્થક કે દોષકારી લાગે. દા.ત.

જી કિયા કે વિધિની ચુસ્તતા વેદીયાપણું લાગે.

જી અનુઝાનો પ્રત્યે ખૂબ અરૂચિ જગ્યાય.

જી કિયાઓ વગેરે નિરર્થક અને નકામા લાગે.

જી બાલદીક્ષાને નિષ્ણળ અને નિરર્થક માને.

જી વૃદ્ધદીક્ષાને દોષકારક માને.

જી ગંધુવાસમાં સ્વાધ્યાયહાનિ, લિક્ષાદોપોની સંભાવના, કલહના  
નિમિત્તો વગેરે દોષો રહેલા છે માટે ગુરુલુલવાસ નકામો છે - તેવા  
વિચારો ઉત્પન્ન થાય.

જી તપ એ તો હેઠ પરનો અત્યાચાર છે... તપમાં તો આર્તિધ્યાન થાય,  
પારશાસમાં આસક્તિ કરાવે માટે તપ નકામો છે... વગેરે એલફેલ બોલવાનું-  
વિચારવાનું મન થાય.

જી પ્રતોના પાલન માટે વાડો કે આચારોની શી જરૂર છે ? તે તો માનસિક  
નિર્ભણતા કહેવાય. તેમાં આત્મવીર્ય ક્યાં રહ્યું ? તે તો વૈરાગ્યની કચાશ કહેવાય.  
વગેરે ઉત્પટાંગ વચ્ચન- વિલાસ કરવાનું મન થાય. - આ બધું મૂઢદિપજાનું છે.

(૩) ગુરુઓ- વડીલોની પ્રવૃત્તિઓ પ્રત્યે અરૂચિ થાય... તેમની પ્રવૃત્તિઓ  
અનુચ્છિત લાગે. કયા સંયોગોમાં કે કયા વ્યક્તિવિશેષને આશ્રીને ગુરુજનો આ  
પ્રવૃત્તિ કરી રહ્યા છે તે જાણ્યા વિના તેનો અપલાપ કરવાનું મન થાય - તે  
મૂઢદિપતા.

(૪) અન્ય દર્શનની કોઈ વિશેષતા નજરે ચેડે ત્યારે તે દર્શનની મોટી

શક્તિઓ બૂલી જવી અને વિરોધતાને વધારે પડતી મહત્વા આપી હેવી તે મૂઢતા છે.

(૫) જે અગીતાર્થ છે અધવા ગીતાર્થ અનિશ્ચિત છે, જે આજીબાબુ છે, તેમજ જે પાસત્યા વગેરે છે, તેમના ધર્મ- અનુભાવો જોઈને અંજાઈ જવું, તેની ઉપબૃદ્ધિના- મશંસા કરવી, તેમના પ્રત્યે અહોબાવ દાખવવો, તે અનુભાવોમાં સહાયક બનવું, દયા અને અનુકૂળાની લાગકુણીને બદલે ભક્તિની લાગકી દાખવવી - આ બધું મૂઢદાચિપણું છે.

(૬) જેઓ શાસનના પ્રત્યાનીક હોય તેઓમાં ગુજરાત્બાસ, શક્તિઓ, લભિઓ વગેરે જોઈને આકર્ષણ થાય, તેમાં શાસનની ઉન્નતિ અને પ્રભાવના દેખાય - આ બધી દાચિની મૂઢતા છે. તેમના ગુણો, શક્તિઓ અને કાર્યો પ્રત્યે ઉપેક્ષાબાવ જોઈએ, શક્ય હોય તો સમજાવવા, અટકાવવા અને માર્ગસ્થ બનાવવા પ્રયત્ન કરવો, તે શક્ય ન હોય તો ઉદાસીન રહેવું. આવી વ્યક્તિઓની પ્રવૃત્તિઓથી બાબુ રીતે શાસનની ઉન્નતિ દેખાતી હોય તો પણ તેમાં બળવું નહિ. તેવી પ્રવૃત્તિઓને શાસનની ઉન્નતિ તરીકે માનવી નહિ. જેમ નિન્હીંવો નિયમા મિથ્યાદાચિ હોય છે પરંતુ એમના અનુયાયીમાં અનાલોગને કારણો સમકિત હોઈ પણ શકે - તે છીતાં તેનો માર્ગ એ માર્ગ બનતો નથી. તે રીતે બાબુથી ધર્મપ્રલાવના અને અનેકને ધર્મપ્રાપ્તિ થવા છીતાં એ કરનાર માર્ગ- બાબુ હોય તો એની પ્રવૃત્તિ એ શાસનની ઉન્નતિરૂપ નથી, મશંસનીય નથી, પોષવા લાયક નથી - એમ અમૂઢદાચિ માને.

(૭) મૂઢતા ચાર પ્રકારની હોઈ શકે.

કુદ્દાચિ :- દૂધને દર્હી જાણે.

કુદ્દાચિ :- જે કોત્ર જે દોષ કે ગુજરાત્બાણું હોય તેનાથી વિપરીત જાણે- સમજે.

કુદ્દાચિ :- શિયાળાને ઉનાળો જાણો- હિવસને રાત જાણો.

કુદ્દાચિ :- સંસારના હેતુને મોકણા કારણ સમજે, મોકણા હેતુને સંસારના કારણ સમજે, ગુણને દોષ સમજે, દોષને ગુણ સમજે. તેના દોષ બતાવીએ તો

પણ સમજવા- વિચારવા તૈયાર ન થાય.

(૮) અન્ય દર્શનની કોઈ વિશેષતાને કારણે જેણ દર્શનમાં ન્યૂનતા માને અથવા સમાનતા માને તે દર્શિની મૂઢ્ટા છે. તેમ, કોઈ આગંતુક જીવને કારણે કે કાલબળને કારણે જિનશાસનમાં કોઈ દોષ દેખાય તો તેના મહાન ગુણોને વિસરી જઈને તે દોષને પ્રાધાન્ય આપે. મહાન ગુણો અને ગુણવાનની અવશ્યકતા કરે.

(૯) મૃડદિષ્ટિમાં વિવેકહીનતા ઉત્પન્ન થાય છે. તેને કારણે જે સાંચ માને તેને હંમેશા એકાન્તે સાંદુ માને. જે નુકશાનકારક લાગે તેને હંમેશા એકાન્તે નુકશાનકારક માને. રાગના કારણે જે વસ્તુ સારી લાગે તેના દોષ કે નિર્ગુણતા તરફ નજર કર્યા વગર તેમાં ઉત્સાહથી પ્રવર્તે. અને જેના ઉપર મતિવ્યામોહ દર્શિયા અર્દૂથી થઈ તેમાં સદા દોષદર્શિ રહે, અનાદર-અવશ્ય-નિંદા કરે.

#### દર્શિની મૂઢ્ટાના કારણો:

- (૧) જિનવયનની આજીવાની ન હોવી.
  - (૨) જિનવયનમાં વિશેષ શ્રદ્ધાનો અભાવ.
  - (૩) જિનવયનના વિશેષજ્ઞ ગીતાર્થની નિશ્ચાનો અભાવ.
  - (૪) ગુજરાતી દોષ પરમવાની શક્તિનો અભાવ.
  - (૫) પોતાની બુદ્ધિની પ્રધાનતા માને.
  - (૬) વિવેકહીની ન્યૂનતા.
  - (૭) પ્રબલ રાગ, પ્રબલ દોષ અથવા પ્રબલ અશાન્યુક્ત મિથ્યા માન્યતાના કારણે પણ દર્શિયા મૂઢ્ટા આવે છે.
  - (૮) નીચેની ચાર વસ્તુના અભાવથી દર્શિયા મૂઢ્ટા આવે.
- [A] દરેક જગ્યાએ તત્ત્વ-ગવેષકા
- [B] લાભ-નુકશાન વિચારવાની દર્શિ
- [C] સાચા-ખોટાની જંય
- [D] વિવેક્યુક્તતા
- (૯) કલ્યાણમિત્રોનો યોગ ન હોય તો પોતાનું કદ્ય ખોલવાનો અવકાશ ન

રહે- તેને કારણે પણ મૂઢતા આવે.

(૧૦) પાપ ભિન્નો કે સંસારરસિક છીયોના સંબંધથી તેના જેવા આચાર-વિચાર ધાય અને તેથી દર્શિમાં મૂઢતા આવે.

(૧૧) ભવાલિનંદી સંસારરસિક આત્માઓ કાય્યમ મૂઢતાવાળા જ હોય છે. તેથી જ્ઞાની પુરુષનો યોગ મળે અને એ તત્ત્વ બતાવે છીતાં તત્ત્વબોધ થતો નથી.

(૧૨) અકલ્યાશમિત્ર પાસે કલ્યાશમિત્રનો અને કલ્યાશમિત્ર પાસે અકલ્યાશમિત્રનો વ્યવહાર કરે તેનાથી પણ મૂઢતાપણું આવે.

#### અમૂઠદિન બનયાના ઉપાયો:

(૧) કિનનવચનથી નિર્દેંતર આત્માને ભાવિત કરવો જોઈએ.

(૨) આય-વ્યયની (લાભ-નુકશાનની) દરેક કાર્યમાં તુલના કરવી.

(૩) દરેક ભાજતમાં શક્ય- અશક્ય, ઉચ્ચિત- અનુચ્ચિતનો વિભાગ પાડવો.

(૪) કલ્યાશમિત્રનો સંપર્ક કરવો, તેમનું ગૌરવ કરવું, તેમને સમર્પિત રહેવું, તેમની પાસે સન્માર્ગની યાચના કરવી, તેમનું કહેલું સ્વીકારવું અને શક્ય આચરણ કરવું. તેમનું કહેલું જે આચરી ન શકે તેનું કારણ તેમને જણાવે અને પોતાના અનન્ય ઉપકારી તરીકે વારેવાર તેમને માનતાં રહે.

(૫) અકલ્યાશમિત્રનો ત્યાગ કરવો- તેમનું વિશેષ ગૌરવ ન કરવું, તેમની પાસે હદયના ભાવો ન ખોલવા- સલાહ ન લેવી. વાણમાંગી સલાહ મળે તો પણ કલ્યાશમિત્રને પૂછ્યા વિના અમલમાં ન મૂકવી તેના કલ્યા મુજબ ન કરીએ તો પણ ન કરવાના કારણોનો ખુલાસો તેની પાસે ન કરવો. તે ઉપકારી છે એમ માનવું નહિ અને તેના પર ઓવારી ન જવું.

(૬) અન્યદર્શની, વિશિલાચારી અને અસંવિશ્વપાકિકોનો સંગ ન કરવો, તેમનું સાંનિધ્ય વર્જવું.

(૭) દઢ શ્રદ્ધા, ચુસ્ત આચાર અને પ્રબળ સંવેગને ધારણ કરનાર સાધાર્મિકનો પરિણય કરવો, તેમની સાથે ઘનિષ્ઠ સંબંધ રાખવો.

(૮) સારા કલ્યાશમિત્ર વગેરેની જ્ઞાનદિનિનો અનેક કાર્યોમાં અનુભવ લેતા રહેવું, તેના કારણે તે સંસ્કારોના અનુભવથી પારિષામિક બુદ્ધિ ઘણાય-

તેથી મૂઢદસ્તિપરંતુ ન આવે.

આમ, મૂઢદસ્તિપરાના દોષને બરાબર ઓળખીને તેના કારણોથી દૂર રહેવું અને તેને દૂર કરવાના ઉપાયોનું સેવન કરવું.

### પંચમો રાચાર : ઉપબૃહણા

બૃહણ એટલે પોષણ, ઉપબૃહણ એટલે સર્વ રીતે પોષણ, અત્યંત પોષણ, નશકથી પોષણ, સ્વ-પરના શાનદારાદિ પંચાચારનું પોષણ કરવું તે ઉપબૃહણા નામનો સમ્બંધર્થનાનો આચાર છે.

#### ઉપબૃહણાનું સ્વરૂપ:

(૧) અન્યના સદાચારની પ્રશંસા તથા તે સદાચારોના પાલનમાં સહાયતા કરવાથી અન્યના તે સદાચારોનું પોષણ થાય છે. તેનો ઉત્સાહ વધે છે તેથી તે સદાચારમાં સ્થિરતા અને વિકાસ પામે છે.

(૨) અન્યના સદાચારો અને સદગુણોના પ્રશંસક અને સહાયક જનવાધી પોતાના જ્ઞાનાવરણીય, ચારિત્ર મોહનીય આદિ કર્મનો કષયોપશમ થાય છે તેથી પોતાના સદાચારો અને સદગુણો પણ વિકસે છે. આમ ઉપબૃહણાથી જેમ અન્યના સદાચારોનું પોષણ થાય છે તેમ પોતાના સદાચારોનું પણ પોષણ થાય છે.

(૩) અન્યના સુકૃત્યો અને સદગુણોની પ્રશંસાથી તેનામાં શુભભાવની પુષ્ટિ થાય છે અને તે શુભભાવ સાનુબંધ બને છે. તે જ રીતે ઉપબૃહણાથી પોતાના સાનુબંધ શુભભાવોનું પણ પોષણ થાય છે.

(૪) સ્વ- પરના સાનુબંધ શુભ ભાવની જેમ સ્વ-પરના સાનુબંધ શુભ કર્મનું પણ ઉપબૃહણાથી પોષણ થાય છે. જેના સદાચારની ઉપબૃહણા કરીએ તેનો તે સદાચાર પ્રત્યે આદર અને રસ વધે છે. તેથી તે સદાચારથી બંધાતું શુભ કર્મ શુભાનુબંધવાળું બને છે તેમ જ સદાચારની પ્રશંસાથી ઊભો થતો સદાચારનો આદર અને પ્રેમ આપણાં શુભ કર્મોને પણ શુભાનુબંધી બનાવે છે.

(૫) ઉપબૃહણામાં બે વસ્તુ છે : ૧. પ્રશંસા અને ૨. સહાયકરણ

(A) જે વ્યક્તિમાં પંચાચારની વિશેષ પ્રવૃત્તિ હેખાય જેવી કે, કોઈ બાળક

સુંદર શાનાભ્યાસ કરતો હોય. કોઈ ડિશોર પરમાત્માની સુંદર અંગરચના કરતો દેખાય.. કોઈ યુવાન ખૂબ ચુસ્તાથી શાવકાર્યમનું પાલન કરતો દેખાય.. કોઈ આરાધક વિશિષ્ટ તપદર્મમાં રહ્ત દેખાય.. કોઈ સાખુલગવંત પંચાચારના પાલનમાં અત્યંત ઉદ્યત દેખાય.. તે જોઈને છદ્ય આનંદિત બને અને તેમની તે આચાર-પ્રવૃત્તિની પ્રશંસા કરવી. “તમે આ સુંદર કાર્ય કર્યું” તે શીતે તે આચારની ઉત્તમતા ગર્વિત પ્રશંસા કરવી. તે જ શીતે તેના તે આચારપાલનમાં પદ્ધાશક્ય સહાયક બનવું.

(B) તેમ અન્યમાં વિશિષ્ટ ગુણોની પ્રવૃત્તિ દેખાય તેમાં પણ પ્રશંસા અને સહાયતા કરવી. ગુણ એ આત્મ- પરિણામ રૂપ છે. તે તે ગુણની ઉત્પાદક, પ્રેરક, પોષક પ્રવૃત્તિઓ તે ગુણની પ્રવૃત્તિ કહેવાય. અભ્યુત્થાન, આસન- મદાન, વંદન વગેરે વિનય- ગુણની પ્રવૃત્તિઓથી વિનય- ગુણની પ્રાપ્તિ, વૃદ્ધિ અને સિદ્ધિ થાય છે. ગુણોની પ્રવૃત્તિ પણ ગુણોની પોષક હોવાથી તેની પણ ઉપણુંહણા કરવી તે કર્તવ્ય બને છે.

(C) તેમ અન્યમાં જે જે ગુણોની આંશિક કે વિશેષ સિદ્ધિ દેખાય તેની પણ ઉપણુંહણા કરવી.

(D) ધર્મની પ્રારંભિક અવસ્થામાં રહેલા જીવો બાલકશામાં કહેવાય છે. જ્યે તેઓ હજુ ઉપરની કષાનો ધર્મ નથી પામ્યા કે માર્ગ ઉપર પણ નથી આવ્યા પરંતુ તેમનામાં પણ જે માર્ગનુંકલ પ્રવૃત્તિ કે પ્રવૃત્તિનો અભ્યાસ દેખાય તે પણ ઉપણુંહણા- યોગ્ય છે. તેની ઉપણુંહણાથી તેમની પ્રગતિ વિશેષ થાય છે.

#### ઉપણુંહણાના પ્રકાર:

- (૧) અન્યના ધર્મકાર્યની તેની હાજરીમાં પ્રશંસા કરવી.
- (૨) અન્યના ધર્મકાર્યની તેની ગેરહાજરીમાં પણ પ્રશંસા કરવી, જે પરંપરાએ પણ તેના કાને પહોંચતા તેને તે આચારમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.
- (૩) તપ, શાનાભ્યાસ, જિનવાશીશ્રવણ, પ્રતિકમણ, સામાયિક વગેરે ધર્મપ્રવૃત્તિ કરનારને પ્રભાવના અપાય છે તે પણ ઉપણુંહણાનો એક પ્રકાર છે.
- (૪) વિશિષ્ટ જ્ઞાની, વિશિષ્ટ તપસ્વી, વિશિષ્ટ શીલવંત, વિશિષ્ટ દાનેશરી

વગેરેનું જાહેરમાં સાન્માન કરવું તે પક્ષ ઉપબૃંહદ્વારા છે. તેનાથી તે વ્યક્તિને તો પ્રોત્સાહન મળે છે, બીજાઓને પક્ષ તે ધર્મ આરાધવાની પ્રેરણા મળે છે. આમ અનેકથા ગુજરાતું પોષણ થાય છે.

(૫) અન્યની તે તે સાનાચારની પ્રવૃત્તિમાં સહાયક બનવું તે પક્ષ ઉપબૃંહદ્વારા છે. શાનાલ્યાસના જિજ્ઞાસુને પુસ્તક, ભાષાવનાર વગેરેની વ્યવસ્થા કરી આપવી તે તેના શાનાચારમાં સહાયતા કરેવાય, તે રીતે દરેક આચારમાં સમજ લેવું.

જેમ ધર્મ વ્યક્તિની તે ધર્મપ્રવૃત્તિમાં સહાયક બનવું તે ઉપબૃંહદ્વારા છે તેમ તેના અન્ય જીવન- વ્યવહારના ઉચિત કાર્યમાં સહાયક બનવું તે પક્ષ ઉપબૃંહદ્વારા છે. કારણ કે, તે જાણે છે કે મારી ધર્મપ્રવૃત્તિ કે સદ્ગુરુના નિમિત્તથી મને સહાયક બનવા તત્પર બન્યા છે તેથી તે ધર્મપ્રવૃત્તિની જ ઉપાદેયતા અને આદર તેના હદ્યમાં પ્રતિષ્ઠિત થવાના કોઈ તપસ્વી કે આરાધક આત્માને તેના જીવન- નિર્વાહનું સાધન ઊભું કરી આપવાની સહાયતા કરવી તે પક્ષ આખરે તો તેની આરાધનાની જ ઉપબૃંહદ્વારા છે.

(૬) કેટલોક વ્યક્તિની કોઈ ધર્મકાર્યની પ્રબળ ઈચ્છા હોય, અને તે ધર્મકાર્યમાં તેની નિપુણતા પક્ષ હોય, છતાં વિપરીત સંયોગો, અનુકૂળ સામગ્રીનો અભાવ, અન્ય ચિંતાઓ કે વ્યસ્તતાઓ વગેરે કારણે તેની તે ધર્મપ્રવૃત્તિ સિદ્ધાતી હોય છે. કયારેક આવડત કે સમજના અભાવે ધર્મપ્રવૃત્તિમાં કલિ કે ખામી રહી જતી હોય છે. આ બધા બાધક તત્વો અને ખામીઓને દૂર કરી તેની ધર્મપ્રવૃત્તિને સરળ અને સરસ બનાવવામાં સહાયક બનવું તે ઉપબૃંહદ્વારા કરેવાય.)

#### ઉપબૃંહદ્વાના લાભો:

- (૧) ઉપબૃંહદ્વા દ્વારા બીજાના ધર્મપોષક બનવાથી પોતાની ધર્મરાધના નિર્વિઘ્ને કરી શકે તેવી અનુકૂળતા માપું થાય છે.
- (૨) અન્યના ધર્મની અનુમોદનાથી પોતાનો ધર્મ સાનુબંધ બને છે.
- (૩) ધર્મના ઉપબૃંહકને નિકાયિત વિભ પક્ષ બહુ ડગાવી શકતું નથી.
- (૪) ઉપબૃંહદ્વાના આચારથી પોતાના ધર્મકાર્યમાં આવતા વિલીન થાય છે.

- (૫) સમ્યગદર્શનાંડ ઉત્તરોત્તર ચડીયાતા ગુણોનો લાભ થાય છે.
- (૬) જેના ધર્મકાર્યમાં પ્રશંસા કે સહાયતા કરે તેના આત્મવિકાસમાં નિમિત્ત અનુવાનો લાભ મળે છે.
- (૭) ધર્મની પ્રશંસા અને સહાયતાની આપકી પ્રવૃત્તિને જોનાર અને જાપનાર અન્ય વ્યક્તિઓ પણ ધર્મપ્રેરક્ષા પામી ધર્મમાર્ગ આગળ વધે છે.

#### **વિશેષ વિમર્શા :**

જેમ ગુરુની પ્રશંસા એ ઉપબૃંહક્ષા છે, તેમ ગુરુના માહાત્મ્યનું વર્ણન કરવું તે પણ ઉપબૃંહક્ષા છે. કારણ કે, ગુરુનું કે આચારનું માહાત્મ્ય સાંભળવાથી = જાળવાથી અન્યને તે ગુરુની રૂચિ ઉત્પન્ન થાય છે અને તે ગુરુમાં પ્રવૃત્ત થવાની ઉત્કુંદ ઊભી થાય છે. તેથી, જે વ્યક્તિ ગુરુ કે આચારની અર્થી હોય અથવા જેનામાં અર્થપણું ઉત્પન્ન થવાની યોગ્યતા દેખાતી હોય તેની સમક્ષ-

- (A) ગુરુના સ્વરૂપનું વર્ણન કરવું.
- (B) ગુરુના મહિમાનું વર્ણન કરવું.
- (C) ગુરુના આચારોનું વર્ણન કરવું.
- (D) ગુરુની વારોનું વર્ણન કરવું.
- (E) ગુરુના અતિચારોનું વર્ણન કરવું.
- (F) ગુરુપોષક ભાવનાઓનું વર્ણન કરવું.

આ બધી બાબતોનું વર્ણન સાંભળવાથી તે વ્યક્તિમાં ગુરુની જિજ્ઞાસા, રૂચિ, ઉત્સાહ પેદા થાય છે અને તે રીતે ગુરુનું પોષણ થાય છે.

#### **છઢો અંગાર: સ્થિરીકરણ**

સ્થિરીકરણ કરવું એટલે સ્થિર બનાવવા, અન્યને તેને પ્રાયોગ્ય આરાધનામાં જોડવા અને તેમાં સ્થિર કરવા તે સ્થિરીકરણ. તે સમ્યગદર્શનનો છઢો આચાર છે.

#### **સ્થિરીકરણનું સ્વરૂપ :**

- (૧) પંચાચારની પ્રવૃત્તિમાં, ગુણોની પ્રવૃત્તિમાં અને સત્કૃત્યામાં બીજાને

જોડિને સ્થિર કરવા અને જોડાયેલા હોય પણ સ્થિર ન હોય તો સ્થિર કરવા.

(૨) જે ઉપરોક્ત બાબતોમાં સ્થિર હોય તેને વિશેષ સ્થિર કરવા એટલે કે પ્રતિકૂળ નિમિત્તનો પક્ષ ચલિત ન થાય તેવા ચુસ્ત બનાવવા.

(૩) સ્થિરીકરણ કરતા પૂર્વ તે વ્યક્તિની યોગ્યતા, સંયોગો, જીવદળ વગેનેનો અભ્યાસ કરવો. જે આચાર કે ગુણની યોગ્યતા, સંયોગ અને શક્તિ હોય તેમાં તે અસ્થિર હોય તો સ્થિર કરવો.

(૪) જેની જે યોગમાં શક્તિ, સંયોગ કે પાત્રતા ન હોય છીતાં તે વ્યક્તિ તે આરાધનામાં પ્રવૃત્ત થયા મ્યાસ કરતી હોય તો તેને તેની કક્ષા મુજબની આરાધનામાં કણથી કે સમજાવટથી ચાલ્યો દેવો અને અશક્ય યોગમાંથી પાછો વાળવો તે પક્ષ સ્થિરીકરણ છે.

સ્થિરીકરણ કરનારને ધર્મ-પ્રવૃત્તિમાં અસ્થિરતા આવવાના કારણોનો અભ્યાસ હોવો જોઈએ. ધર્મ-પ્રવૃત્તિમાં અસ્થિરતા આવવાના કારણો:

(૧) જે કરવું છે તેમાં રસ ઉત્પન્ન ન થાય.

(૨) જે કરવું છે તે નિરર્ધક અને નકામું લાગે.

(૩) જે કરવું છે તેના કરતાં બીજામાં વિશેષ લાભ દેખાય.

(૪) જે કરવું છે તે કાર્યમાં કુશળતા કે નિપુણતા ન હોય તેથી પાછો પડતો હોય.

(૫) કરવાના તે કાર્યમાં સાહજિક કંટાળો હોય.

(૬) બીજા સાથીધારો દ્વારા ઉંધી સમજ મળવાના કારણો ઉત્સાહ-રસ વધવાના બદલે ઘટયો હોય.

(૭) કાયદ, આર્થિક વગેરે સાંયોગિક પ્રતિકૂળતા પક્ષ અસ્થિરતાની જનક બની શકે.

(૮) જે કાર્યમાં પ્રવૃત્ત થવું છે. તેના બાધક કારણોને ન જાણો અને બાધક કારણોમાં પ્રવર્તે.

(૯) જે કાર્યમાં પ્રવૃત્ત થવું છે તેના સાધક કારણોને ન જાણો અને તેનું સેવન ન કરે.

વ્યક્તિ ને તે યોગમાં સ્થિર છે કે અસ્થિર તે જીવા માટેના કેટલાક ચિહ્નો છે. નીચે મુજબના ચિહ્નો જગ્યાપ તો તે વ્યક્તિ યોગમાં અસ્થિર છે તેમ માની શકાય.

(૧) પોતે જે ધર્મકાર્ય કરી રહ્યો છે તે ધર્મના ભીજા આરાધકની કે તે ધર્મકાર્યની પ્રશંસામાં રસ ન હોય.

(૨) તે ધર્મકાર્યથી વિપરીત કાર્યમાં તેનો ઉત્સાહ દેખાતો હોય.

(૩) જે ધર્મકાર્ય ચાલુ હોય તેમાં વિશેપ, વિલંબ કે ન્યૂનતા વાય તો અકળામણ કે પેદ ન થાય.

(૪) તે ધર્મકાર્યમાં ભીજા કોઈ આગળ વષેલા હોય તેમાં કોઈ મહત્ત્વ કે વિશેષતા ન લાગે.

(૫) અતિ મહત્વનું કરશુન ન હોય તો પણ પ્રસ્તુત કાર્યમાં આળસ કરે, ખાડા પાડે કે અવરનવર છોડી દે.

(૬) જેમ એક ધંધામાં જમાવટ ન આવી હોય તો અનેક ધંધાઓ અવરનવર કર્યા કરે તેમ એક કાર્યને નિયમિત અને નિયિત રૂપે ન પકડતા કાર્યો બદલ્યા કરે, વારાફરની જૂદા જૂદા કાર્યોમાં ચિત્ત ભયા કરે.

(૭) જે કાર્ય કરતો હોય તેની જ નિંદા કરે, તેને જ વખોડે.

અન્ય વ્યક્તિની કોઈપણ યોગમાં અસ્થિરતા ટાળવી હોય અને યોગમાં સ્થિર કરાવવી હોય તો તેને માટે પોતાની પણ યોગ્યતા જોઈએ, તે વ્યક્તિ સાથે યોગ્ય સંબંધો હોવા જોઈએ. તે વ્યક્તિ સાથે યોગ્ય વર્તન હોવું જોઈએ. તે અંગેના કેટલાક ખ્યાલો હોવા જરૂરી છે:

(૧) સામેની વ્યક્તિ સાથે હદ્યનો મેળ રાખવો જોઈએ.

(૨) સામેની વ્યક્તિ આપણી વાત સાંભળે અને વિચારે તેવી યોગ્ય પદ્ધતિશી રજૂઆત કરવી જોઈએ.

(૩) સદ્ભૂત ગુણોની વારંવાર ઉપભૂંહણા વગેરે દારા સામી વ્યક્તિના મનને એ રીતે વશ કરવી અને વિશ્વાસ સંપાદિત કરવો કે કોઈ પણ જાતના સંકોચ વગર તે મનના ભાવો અને મુંગવણોને રજુ કરી શકે.

- (4) જ્યારે પ્રેરકા કરવી હોય ત્યારે અત્યંત મીઠાશ, મૃહુતા અને વાતસલ્યપૂર્વક કરવી.
- (5) સ્થિરીકરણ કરવા માટે નીચેના ઉપાયો અજમાવી શકાય.
- (A) તેની સમજ અધૂરી કે વિપરીત હોય તો પૂરી અને સાચી સમજારા આપવી.
- (B) તેને વિવિધ ઉપાયોથી પ્રોત્સાહિત કરવો.
- (C) તે વ્યક્તિને તે યોગ સાધવામાં જે ન્યૂનતા નડતી હોય તેમાં સહાયક બનવું.
- (D) તે યોગની આરાધનાના તત્કાલીન અને દૂરગામી વિવિધ પ્રકારના લાભો દર્શાવવા.
- (E) તે પ્રવૃત્તિ નહીં કરવાના કે મતિષબી પ્રવૃત્તિ કરવાના અપાયો-નુકશાનો દર્શાવવા, કથાગુણમાં કોઈને સ્થિર કરવા માટે કથાના વિશિષ્ટ લાભો દર્શાવવા સાથે કથા નહીં રાખવાથી કે કોષ કરવાથી થતા નુકશાનો જણાવવાથી તે વ્યક્તિને કથા ગુણમાં સ્થિર કરી શકાય.
- (6) જે કાર્ય અશક્ય હોય અથવા નુકશાનકારક હોય તેવા કાર્યમાં તે વ્યક્તિને સમજાવટથી આગળ વધતો રોકવો, તેવું કાર્ય છોડાવી દેવું અને તે કાર્ય ન કરવા પ્રેરકા આપવી.
- (7) નિયમિતતા, વિધિયુક્તતા, બહુમાન અને તે તે ગુણ ધારકા કરનાર વ્યક્તિની બક્ઝિ વળેરે કરવાથી સ્થિરતા આવે માટે આ બધી બાબતોની તે વ્યક્તિને પ્રેરકા આપવી.

**સ્થિરને વિશેષ સ્થિર કેવી રીતે કરી શકાય?**

- (1) તે તે ગુણમાં પોતાનાથી અધિક હોય તે વ્યક્તિની બક્ઝિ અને બહુમાન કરવાની પ્રેરકા કરવી.
- (2) સમાન ગુણવાળા અથવા તે જ ગુણના અન્ય સાધકની સાથે મૈત્રી રાખવાથી, તેમને સહાય કરવાથી અને તેમની ઉપયુક્તકા કરવાથી ગુણમાં સ્થિરતા વધે છે. તેથી તે બાબતોની પ્રેરકા કરવી.

(3) જે લીન ગુણવાળા હોય તેના મત્યે દયા-વાતસલ્ય-સહાયકતા-પ્રોત્સાહન વગેરે દ્વારા આગળ વધારવાથી પોતાની તે ગુણમાં સ્થિરતા વધે છે. આ બાબતનો પણ ખ્યાલ આપવો.

(4) તે તે ગુણ કે કાર્યના લાભો, મહત્તમા, સાનુભંગ બનાવવાના ઉપાયો વનેરેનો વારંવાર વિચાર કરવાથી અને વિવિનો આદર કરવાથી પણ ગુણમાં સ્થિરતા વધે છે. આ ઉપાયોમાં પણ સામેની વ્યક્તિને પ્રેરિત કરવી.

(5) તે ગુણની સાપનામાં અવિષ્ટ-પ્રમાદ વગેરેથી થતાં નુકશાનો, ગુણહાનિ વનેરેનો ખ્યાલ આપી તે દૂર કરવા મેરણા કરવી.

(6) પંચાચારના વિષયમાં અને વિશેષથી પ્રસ્તુત ગુણના આચારોના, તેની વાડોના-મર્યાદાઓના પાલન માટેની સાવધાની આપવી.

(7) કોઈ પણ શુલ્ગ ગુણ, આચાર કે ડિયામાં સ્થિરતા કરવી અને કરાવવી તે ગુજરાતી તે વાત તેના ડિલમાં પ્રતિષ્ઠિત કરવી.

(8) કોઈ પણ શુલ્ગ ગુણ આચાર કે ડિયામાં સ્થિર હોય તેને અસ્થિર કરવો કે ગુણમાંથી ચુંબક કરવો તે મોટો દોષ છે, તે વાત પણ અસ્થિમજજા બનાવવી.

(9) કોઈ પણ શુલ્ગ ગુણ આચાર કે ડિયામાં કે દોષમાં સ્થિરતા હોવી, સ્થિરતા કરવી, સ્થિરતા કરાવવી તે પણ મોટો દોષ છે-આ વાત ડિલમાં છસાવવી.

(10) અશુલ્ગ પાપાચારમાં જે સ્થિર હોય તેને છોડાવવો અને જે અસ્થિર હોય તેને પણ પાપાચારથી છોડાવવો-દૂર કરવો તે ગુજરાતી સ્વરૂપ છે.

(11) ૧૮ કે તેમાંના કોઈપણ એક પાપસ્થાનકમાં કે તેના કારકોમાં સીધી કે આડકતરી રીતે સ્થિરતા કરવી, તેમાં રહેવાની પ્રશ્નાંસા કે સહાય કરવી, તેના ગુજરાતી લાભો બતાવવા, તેમાં વાતસલ્ય કે કૂદી લાગવી બતાવવી-તે બધું પાપમાં સ્થિરતા કરાવવા રૂપ છે અને દર્શનાચારના અતિચાર રૂપ છે. કારકોને પાપમાં આ રીતે સ્થિરતા આવવાથી તેમાં કર્તવ્યબુદ્ધિ સ્થિર થાય છે.

(12) ૧૮ કે તેમાંના કોઈ પણ એક પાપસ્થાનમાં સ્વ-પરની અસ્થિરતા બાવવી, તે પાપના દોષકથન દ્વારા તિરસ્કાર ઊભો કરવો-કરાવવો, તે પાપના

અપાયો-નુકશાનો બતાવવા, તેના દ્વારા થતા ભવભેદા-હર્ગંતિ વગેરે હુંખોનું વર્કન કરવું વગેરે દ્વારા પાપમાં અસ્થિરતા કરવી-કરાવવી તે પણ સમૃદ્ધિનાનો આચાર છે.

(૧૩) પંચાચારમાં, જ્ઞાનાદિ ગુણોમાં, પોત-પોતાની ભૂમિકા અનુસાર આચારોમાં, નિત્ય આચારોમાં, નેપિન્ડિક આચારોમાં વગેરે બાબતમાં સ્થિરતા લાવવી, બીજાને ઉત્સાહિત કરવા, દ્રઢ બનાવવા તથા જોતે પણ સ્થિર અને દ્રઢ બનવું તે સમૃદ્ધિનાનો આચાર છે.

(૧૪) શુભ આચારોમાંથી શક્ય કોઈ પણ એક આચારમાં પણ બીજાને છૂટછાટ આપવાધી, અઙ્ગભતી ટકોર કરવાધી કે નિંદા વગેરે દ્વારા અસ્થિર કરવા, નિરસાઠ કરવા, શિથિલ કરવા, બેદરકાર બનાવવા, ઉપેક્ષાવાળા બનાવવા કે પોતે તેવા બનવું તે દર્શનાચારનો અતિચાર છે.

#### સાતમો આચાર : વાતસલ્ય

વાતસલ્ય એટલે નિઃસ્વાર્થ, નિર્મણ અને નીતરતો સ્નેહ, મા-બાપને પોતાના સંતાન પર આવો સ્નેહ હોય છે, મોટા બાઈ-બહેનને નાના બાઈ-બહેન ઉપર પ્રેમ આ પ્રકારનો હોય છે, જગતના સ્વાર્થપ્રેરિત બીજા સ્નેહોની અપેક્ષાએ આ પ્રકારનો સ્નેહ ખૂબ ચરીયાતો છે. ખર્મ આત્માઓ ઉપર આવો નિઃસ્વાર્થ, નિર્મણ અને નીતરતો સ્નેહભાવ દાખવવો તે સમૃદ્ધિનાનો આચાર છે. બીજા બધાં સ્નેહ કરતાં ધર્મસ્નેહ ચરીયાતો છે, તેથી જગતના બીજા બધા સ્થાનો કરતાં ખર્મ આત્માઓ ઉપર અત્યંત સ્નેહનો વ્યવહાર કરવો, તેમાં પોતાથી ગુણ વગેરેથી અવિક હોય તેવા ધર્માત્મા ઉપર બક્ઝિતપૂર્વકનો સ્નેહ દાખવવો, વરીલોએ નાનાઓ ઉપર આદરપૂર્વક સ્નેહ રાખવો.

વાતસલ્ય એટલે સ્નેહસૂચક આચાર કે વ્યવહાર. અહીં મનમાં પ્રશ્ન ઉઠે કે કોટુંબિક કે સામાજિક ક્ષેત્રમાં વાતસલ્યની જરૂર પડે પરંતુ ધર્મના ક્ષેત્રમાં વાતસલ્યના વ્યવહારની શું આવશ્યકતા? નીચેના કારણોથી વાતસલ્યનો આચાર જરૂરી છે.

(૧) વાતસલ્યથી કોઈ પણ વાક્ઝિતનું દિલ છતી શકાય છે. દિલ છતી

લીધા પછી તે વ્યક્તિ ધર્મ-આરાધનામાં આપકું સહાયને મેમથી સ્વીકારે છે. જેનું વાતસલ્યથી દિલ જીતેલું હોય તેને યોગ્ય અવસરે પ્રેરણા કરીને દોષથી બચાવી શકાય છે, સત્કાર્યમાં જોડી શકાય છે અને સદ્ગુરુની પ્રેરણા કરી શકાય છે.

(૨) જેના પ્રત્યે વાતસલ્યનો સંબંધ હોય તેને આપકા હિતની ચિંતા ઉભી થાય છે. તેથી તે આપકાને ધર્મ-આરાધનામાં સહાયક બને છે, દોષોથી બચાવે છે, ગુણોમાં જોડે છે અને સત્કાર્યમાં પ્રવર્તાવે છે.

(૩) જેને પરસ્પર વાતસલ્યભાવ હોય તે એક બીજાના દોષોને જગતમાં જાહેર થતા ટાકે, વળી, આ સ્નેહ અપ્રશસ્ત ન હોવાથી દોષના પોષક ન બને પરંતુ અંદરખાને સમજાવીને પરસ્પરના દોષનું નિવારણ કરે.

(૪) વાતસલ્યને કારણો પરસ્પરની પ્રતિષ્ઠા વધે તેવા પ્રયત્નો થાય છે. પરસ્પરની નિંદા-અપલાપ-અપતિષ્ઠાનું વારણ થાય છે.

વાતસલ્ય દ્વારા ઉપરોક્ત લાભો થાય છે. દ્વેષભાવ અને દ્વેષના આચારોનું કાર્ય તેનાથી તદ્દન વિપરીત છે. વાતસલ્યભાવ જેમ ઓછો હોય તેમ આચારોમાં મંદતા આવે અને આરાધક ભાવમાં અલ્પતા આવે.

સાધ્યિકો પ્રત્યેનો સ્નેહરાગ એ ધર્મરાગ છે. તેથી જગતના કૌઠુંબિક સ્વજ્ઞનો કરતાં તેમને વિશેષ સ્નેહનું પાત્ર માનવું, ધર્મ ઉપરના સ્નેહમાં ધર્મ એ સાંકળ છે તેથી તે સ્નેહ સમ્યગ્રદ્રોણનું કારણ છે અને પરસ્પર ધર્મવૃદ્ધિનું નિમિત્ત છે.

#### વાતસલ્યનું સ્વરૂપ :

ધર્મસંબંધથી જોડાયેલા ધર્મ આત્માઓ પ્રત્યે પોતાના કોઈ ભૌતિક સ્વાર્થ વગર અથવા ભૌતિક સ્વાર્થની પ્રધાનતા વગર તે સામેની વ્યક્તિના આધ્યાત્મિક કે ભૌતિક ઉત્કર્ષની બુદ્ધિ મનમાં ધારણ કરવી તેનું નામ વાતસલ્ય અથવા મમતાથી સ્નેહપૂર્વક અથવા સ્નેહને માટે જે બ્યવહાર કરાય તે વાતસલ્ય કહેવાય.

#### વાતસલ્યના આચારો :

- (૧) વાત કરતી વેળાએ વાકીમાં મહુરપ દાખવવી.
- (૨) કરડાડીથી બ્યવહાર ન રાખવો પરંતુ મીઠાશથી બ્યવહાર કરવો.

- (૩) સામી વ્યક્તિના હિતની ચિંતા કરવી.
- (૪) તેના હિતની વાત તેને યાદ કરાવવી તે સારણા.
- (૫) અહિતના માર્ગથી અટકાવવો તે વારણા.
- (૬) એકાંતમાં ઠપકો આપીને પણ અહિતના માર્ગથી અટકાવવો તે ચોયણાં અને જરૂર લાગે તો એકાંતમાં શિક્ષા કરીને પણ અહિતથી અટકાવવો તે પડિયોયણા.
- (૭) દોષોથી બચાવવા જાગૃતિ આપવી.
- (૮) બીજા આગળ તે વ્યક્તિનો દોષાનુયાદ ન કરવો.
- (૯) બીજા તેના દોષો જાતા હોય તો પણ મા જેમ સંતાનનો બચાવ કરે તે રીતે બચાવ કરવો.
- (૧૦) જરૂર લાગે તો ખાનગીમાં પાઠ ભરાવવા.
- (૧૧) તેનામાં ગુણોની સમૃદ્ધિ વધે તેવી પ્રેરણા કરતા રહેવું.
- (૧૨) તે શાનસંપન્ન અને આચારસંપન્ન બને તેની પ્રેરણા કરવી.
- (૧૩) જીવનના દરેક કેન્દ્ર તેની કાળજી રાખવી.
- (૧૪) અવસરે તેના સહાયક થવું, રક્ષક બનવું.
- (૧૫) જરૂર જણાય તો અવસરે યોગ્ય શબ્દોમાં ઠપકો પણ આપવો.
- (૧૬) આચારસનના અવસરે આચારસન આપવું.
- (૧૭) જ્યારે જરૂર જણાય ત્યારે સલાહ, સૂચના, સાવધાની યોગ્ય શબ્દોમાં આપવા.
- (૧૮) તે વ્યક્તિને વ્યવહારમાં તથા આત્મિક સાધનામાં અનેક રીતે સમર્થ બનાવવા પ્રયત્ન કરવો.
- (૧૯) માન-આબરુસાચ્ચીને લોકદ્રષ્ટિએ પણ ગૌરવનું પાત્ર બનાવવો.
- (૨૦) તેના છદ્યમાં માન-આબરુસાચ્ચીને કરતાં પણ ગુણ-કર્તવ્યતા વગેરેની મહત્ત્વા વધે તેમ કરવું, તેથી ગુણ અને કર્તવ્યને ખાતર માન-આબરુસાચ્ચીને ગૌણ કરે પરંતુ માન-આબરુસાચ્ચીને ખાતર ગુણ-કર્તવ્યતા છોડે નહીં.
- (૨૧) છદ્ય ખોલીને દિલની વાત કરી શકે અને મુંજવજીમાં માર્ગદર્શિન

માંગી શકે તેવો વિશ્વાસ સંપાદિત થાય તે મુજબનો પ્રેમાળ-સેહાળ વ્યવહાર રાખવો.

(૨૩) સામેની વ્યક્તિનું હૃદય થવાય તેવા મર્મવેષક વંગ કે કટાક ન બોલવા પરંતુ તેનું હૃદય આકર્ષાય, આપણી વાત સાંભળવી તેને ગમે, તે સાંભળો-વિચારે અને મોકળા મનનો રહે તેમ કરવું.

(૨૪) સામેની વ્યક્તિ વધ-ગુજરાત વગેરેમાં મોટી હોય તો ભક્તિ-આદર ભાવ પ્રદર્શિત કરીને સેવા કરવી, માન-ગૌરવ સાચવવું અને વધારવું.

(૨૫) તે વ્યક્તિની નિંદા ન સાંભળવી, કોઈ કરતું હોય તો પ્રતિકાર કરવો, ગુજરાતના કરવી અને આપત્તિમાં સહાય કરવી.

#### વાતસલ્યના લાભો :

- (૧) વાતસલ્યથી પર્મસ્નેહ બંધાય છે.
- (૨) વાતસલ્ય વરસાવનાર સામેની વ્યક્તિને ઉપકારી લાગે છે.
- (૩) વાતસલ્યના પ્રભાવથી આપણી વાત તે ધ્યાનથી સાંભળે છે.
- (૪) વાતસલ્યને કારણે કહેલી વાત પર વિચાર કરે છે.
- (૫) કહેલી વાતનું શક્ય હોય તે મુજબ આચરણ કરે છે.
- (૬) વાતસલ્યથી કહેવાયેલું હોય તો અનિયતાએ પણ અપનાવે છે.
- (૭) વાતસલ્યના પ્રભાવે સામેની વ્યક્તિ કલ્યાણભિત્તોની સત્સંગમાં બંધાયેલી રહે છે.
- (૮) તે નબળી કે હલકી સોબતમાં ફસાતો નથી.
- (૯) તેને પ્રામ થયેલ પ્રેમ અને શરમને કારણે તેના જીવનમાં ધરાણ દોષોનું આગમન અટકે છે.

(૧૦) સહાયની જરૂર તો દરેકને અવરનવર કાયમ પડે છે. વાતસલ્ય પ્રામ થવાથી હુંક અને નિશ્ચિંતતા રહે છે.

(૧૧) વાતસલ્યને કારણે આંતરપરિક્ષતિની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે.

(૧૨) વાતસલ્યને કારણે બીજાના બળથી, બીજાના નિમિત્તથી અને બીજાના સાન્નિધ્યથી શાન, દર્શન અને ચારિત્રના આચારોનું સહેલાઈથી સુંદર પાલન

થાય છે.

(૧૩) વાત્સલ્ય હોય તો દર્શન, શાન, ચારિત્ર અને તપમાં પોતાને પ્રેરણા મળો, પોતે આગળ વધી રહે, પ્રમાદ ટળે અને બીજાને પણ પ્રેરણાદાયી બની રહે.

(૧૪) વાત્સલ્યના કારણો જીવો નવો ખર્મ પામે છે, ઉત્તરોત્તર અનેક ગુણો પ્રાપ્ત થાય છે.

(૧૫) વાત્સલ્યવાળી બાક્તિ દોષના કારણો દેખી કડક રીતે મીઠા વચનોથી અને જરૂર પડે તો કડક વચનોથી પણ દોષનું વારણ કરાવે છે.

બાળકશાના કે અતિવિકસિત ન હોય તેવા જીવો માટે વાત્સલ્ય ધર્મગ્રામિનું, ધર્મવૃદ્ધિનું, ધર્મપુષ્ટિનું અને ધર્મરક્ષાનું કારણ છે. તેમ જ પાપો અને દોષોનું નાશક, શોષક અને પ્રતિબંધક બને છે. વાત્સલ્ય વગર ઉપબુંહસા, સ્થિરીકરણ અને પ્રભાવનાના આચાર શક્ય નથી અને હોય તો પણ તે તેટલા સફળ બનતા નથી.

#### વાત્સલ્ય આપનારને થત્તા લાભો :

(૧) ધર્મ અને ધર્મી ઉપરના વિરોધ પ્રેમથી અશુભ કર્મનો અને એના અનુબંધનો નાશ થાય છે. ધર્મમાં આવતા વિધોનો નાશ થાય છે. ધર્મગ્રામિને પોત્ય સાનુબંધ કર્મ અને કષ્યોપશમની પ્રાપ્તિ થાય છે. અનેકને ધર્મ પમાડવાની પોત્યતા તેમ જ બીજાને ધર્મ પમાડવાના ઉત્તમ પુષ્પાનુબંધી પુષ્પયની પ્રાપ્તિ થાય છે. ધર્મમાં નિર્વિઘ્નતા પ્રાપ્ત થાય છે.

(૨) આપણા વાત્સલ્યને કારણો બીજાને આપણા પર પ્રેમ થવાથી આપણી સારણા-વારણાથી ધર્મનું આરાધન અને પાપનું વર્જન કરવાનું મળ થાય છે. પંચાચારનું પાલન સારી રીતે થાય છે. ગુણી ઉપર અહોભાવ થાય છે.

(૩) અનેકને સાનુબંધ ધર્મનું નિમિત્ત બનવાનો લાભ મળે છે. અનેકને પાપનુબંધ તોડવાનું નિમિત્ત બનવાનો લાભ મળે છે. તથા સાનુબંધ ગુણાધારનનું નિમિત્ત બનવાનો લાભ મળે છે.

(૪). ધર્મજિનના પરસ્પર વાત્સલ્યથી લોકમાં ધર્મની પ્રશંસા થાય છે. ધર્મના

સંપર્કમાં આવવાથી લોક ધર્મ સાંભળે, સમજે અને પામે છે. ધર્મજીજનના વાતસલ્યથી લોકમાં ધર્મની અને ધર્મની આબરુ-મહત્વા ખૂબ વધે છે. જે ધરમાં રિષ્ટેટા હોય, જગડા ન થતા હોય તે ઘરની અને ઘરના સત્યોની આબરુ ચારે બાજુ ધર્મા વિકસે છે, લોકો તેમના ઉપર આદરવાળા બને છે, અને એમની વાત સાંભળવા તૈયાર હોય છે.

એ રીતે ધર્મા લોકો પરસ્પર પ્રેમ-વાતસલ્ય-સહાયતા દાખલે તો એનાથી સાનિષ અને સંપર્કમાં રહેલા બીજા લોકો ધર્મ પામે છે. અને ધર્મબીજનું તેમનામાં વાવેતર થાય છે.

#### વાતસલ્યના અભાવથી થતાં નુકશાન :

જેમ ક્ષબ સુખનો અર્થા છે તેમ પ્રેમ-વાતસલ્યનો વિશેષ અર્થા છે. જો તેને આપણા તરફથી પ્રેમ ન દેખાય તો

- (૧) આપણા પ્રત્યે ઇચ્છિવાળો ન થાય. (૨) આપણી વાત રૂચિથી સાંભળે ન કરે. (૩) આપણી વાત સમજવાનો પ્રયત્ન ન કરે. (૪) આપણા સૂચન છતાં પોતાના દોષોની ઉપેક્ષા કરે. (૫) આપણાં ગુણોની તેને કદર ન થાય. (૬) વાતસલ્યના અભાવે આપણી અવક્ષા-ઉપેક્ષા-નિંદા-મસ્કરી પણ કરનાર બને. (૭) આ રીતે આપણાને પામીને ગુણ બીજાધાન કરવાને બદલે બીજનાશ કરે. (૮) વાતસલ્ય ક્યાંયથી ન મળે તો એ હતાશ બની જાય. (૯) વાતસલ્યના અભાવથી ધર્મમાં ઉત્સાહિત ન બને. (૧૦) વાતસલ્ય ન મળવાને કારણે ધર્મ અને ધર્મા ઉપર મંદ આદરવાળો અને પ્રમાણી બને. (૧૧) ધર્મની આચરણામાં તે પાછો પડે, ધર્મ-આચરણ મૂકી હેવાનું મન થાય. (૧૨) બધા ધર્મઓ પ્રેમ અને વાતસલ્ય વિનાના હોય છે તેવો અભિપ્રાય બાંધી હે. (૧૩) આગળ જતા ધર્મ અને ધર્મનો નિંદક પણ બને.

અતિ વિશીષ્ટ કારણ વગર, શાસનના નાશક તત્ત્વરૂપ અતિ ભયંકર ગુનો કરેલો ન હોય તો ધર્મની કે ધર્મ વિહીનને વાતસલ્ય ન બતાવવાથી કે તિરસ્કાર કરવાથી ઉપરોક્ત દોષોનું સર્જન થાય છે. વાતસલ્ય બતાવીને પણ વાત તો સાચી જ કહેવી ખોટી વાતમાં હાજ્ઞ-હા ન કરવું.

### વात्सल्यना प्रकारे:

જી પ્રભાવના કરવી જી સંખ્યાજન કરવું જી ઘરે સંધને બહુમાનપૂર્વક પદરાવવો  
જી ઘરે સાથું ભગવંતના વ્યાખ્યાન ગોઠવવા જેથી સંધની પદરામક્ષી થાય જી  
સાધર્મિક ભક્તિ કરવી જી કપડા વગેરેની પહેરામક્ષી કરવી જી ગુન્જ પહેરામક્ષી  
આપવી જી યોગ્ય વ્યક્તિ સાથે ધર્મ ગર્ભિત મીળો સંબંધ રાખવો.

### આઠમો રાણ્યાર: પ્રભાવના

આવના અને પ્રભાવના: કોઈ બાબતથી આત્માને વાસિત કરવો- ભાવિત  
કરવો તેનું નામ ભાવના, ધૂપથી વાસિત થયેલા રૂમાલમાંથી જેમ ધૂપની મહેક  
આવે તેમ ધર્મથી ભાવિત થયેલા મનમાં ધર્મની સુવાસ મહેક્યા કરે, પ્રકૃષ્ટ રીતે  
આત્માને વાસિત કરવો તેનું નામ પ્રભાવના.

જિનવચનની વિચારણા, શ્રદ્ધા અને આચરણથી આત્મામાં જિનવચનને  
ભાવિત કરવું અને અત્યંત આત્મસાત્ત કરવું તેનું નામ ભાવના . પુષ્પના  
યોગથી પ્રાપ્ત થયેલી વિશિષ્ટ શક્તિના બેને બીજા આત્માઓમાં જિનધર્મ ઉપર  
અત્યંત આદર, શ્રદ્ધા અને આરાધ્યબુદ્ધિ ઉત્પન્ન કરાવવી તેનું નામ પ્રભાવના.  
જે પ્રવૃત્તિથી બીજા છાવો જિનધર્મ પ્રત્યે કે જિનધર્મના કોઈ અંગ પ્રત્યે આકર્ષણીય,  
ધર્મની રૂપી કરે, પ્રશંસા કરે, આચરવાની ઈચ્છા કરે, ધર્મને આચરે કે ધર્મમાં  
બીજાને સહાયક બને તેવી પ્રવૃત્તિ પ્રભાવના કહેવાય. દેશના, વરષોડો, તપ,  
આતાપના વગેરે પ્રવૃત્તિથી બીજાના કદયમાં જિનધર્મની ભાવના થાય છે.  
જિનધર્મથી બીજાના કદય ભાવિત થાય છે. ટૂંકમાં જિનધર્મથી પોતાના આત્માને  
ભાવિત કરવો તેનું નામ ભાવના અને બીજાને પણ જિનધર્મ પ્રત્યે આકર્ષિત  
કરવા તેનું નામ પ્રભાવના.

વિશિષ્ટ શક્તિ દ્વારા બીજા આકર્ષણીય છે. બીજા છાવોને જે વિશિષ્ટ શક્તિઓ  
દ્વારા ધર્મ પ્રત્યે આકર્ષણ થઈ શકે તે શક્તિઓના બેદધી ધર્મની પ્રભાવના  
કરનાર પ્રભાવકોના આઠ બેદ શાસ્ત્રોમાં પાડવામાં આવ્યા છે.

## આઠ પ્રમાણક

(૧) પ્રાવચનિક: આગમશાસ્ત્રનો આદિ ઉપલબ્ધ તમામ શુંતના અર્થ અને મર્મના જે શાતા હોય તે પ્રાવચનિક કહેવાય, સ્વર્દીનના શાસ્ત્રો એટલે સ્વસમય અને પરદર્શનના શાસ્ત્રો એટલે પરસમય, તે બન્નેના શાતા હોય, અન્ય દર્શનશાસ્ત્રોના પણ ઊડા અભ્યાસી હોય. સ્વ-પર દર્શનમાં પારંગત હોવાથી કોઈથી પરાભવ ન પામે, પ્રાવચનિક શાસ્ત્રચુના ખારક હોવાથી બધાને સાચો માર્ગ જતાવી શકે.

સર્વ વિષયોમાં પારંગત ન હોય પરંતુ કોઈ એક વિષયના શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હોય તો પણ પ્રાવચનિક પ્રભાવક ગણી શકાય. આગમો, પ્રકરણ, કર્મસાહિત્ય, ન્યાય, વ્યાકરણ, વાસ્તુ, જ્યોતિષ, બૂમિતિ, વિજ્ઞાન વગેરેમાં જીનશાસનથી અભાવિત ઊડા બોપવાળો હોય તે પ્રાવચનિક કહી શકાય.

(૨) ધર્મકથી: ધર્મકથાની લભિષ્યાની સંપત્તિ હોય તેનું નામ ધર્મકથી, જે વ્યાખ્યાન- ઉપદેશદાનમાં ગ્રવીણ હોય, માર્ગના સ્પષ્ટ બોધ સાથે અસરકારક વક્તૃત્વ હોય અને પર્યાદાને અનુરૂપ દેશના આપવામાં ગ્રવીણ હોય, ધર્મકથા- દેશના દ્વારા ભવ્ય જીવોને ધર્મમાં રૂચિ ઉત્પન્ન કરે, સર્વજ્ઞના વચનો તર્ક, યુક્તિઓ અને દિષ્ટાંતોથી શ્રોતાના છદ્યમાં ઉતારે, શ્રોતાના સંદેહોનું નિરાકરણ કરે અને ધર્મ આચરણમાં ઉત્સાહિત કરે. ધર્મની રૂચિ જીગ્યા પછી અને આચારનો ઉલ્લાસ ઉત્પત્ત થયા પછી પણ કોઈને ગ્રમ્ભાદ નડતો હોય તો તે દૂર કરાવે, શ્રોતાઓને ધર્મ-આચરણમાં ઉદ્ઘત બનાવે, જે પ્રકૃષ્ટ લભિસંપત્ત હોય તે આ બધા પરિણામ લાવી શકે.

જેમ ક્ષીરાશ્રવલભિય વગેરે લભિઓમાં મંદ-તીક્રના બેદ પડે, તેમ ધર્મકથન લભિમાં પણ તરતમતા સંભવે છે. જુદા જુદા ધર્મકથીની ધર્મની વાત સમજાવવાની, રૂચિ કરવવાની, શંકાઓનું નિરાકરણ કરવાની, આચરણ કરવવાની વગેરે બાબતની શક્તિમાં મંદતા-તીક્રતા હોઈ શકે છે.

(૩) વાઢી: વાદ- સભામાં કુમતવાદીનો તર્કો, યુક્તિઓ અને આગમથી

પરાબ્દ કરી શકવા સમર્થ હોય તે વાદી પ્રભાવક કહેવાય. વાદી અતંત પ્રતિભાસંપત્ત હોય અને ઓત્પાતિકી બુદ્ધિનો ધારક હોય. કોઈ પણ વિષયમાં વાદ કરી શકવા સમર્થ હોય.

સર્વ વિષયમાં નિપુણ ન હોય પરંતુ જે વિષય પોતે અતંત ભાવિત કર્યો હોય તે વિષયના વાદમાં બીજાનો પરાજ્ય કરી શકે અને સત્ય વાતનું સ્થાપન કરી શકે તે પણ વાદી કહેવાય.

(૪) નેમિતિક: જે નિમિત્તચાસ્ત્રોનો જાણકાર હોય, નિમિત જાળીને ભૂત, વર્તમાન કે ભવિષ્યનું કથન કરી શકવા સમર્થ હોય, નિમિતની જેમ લક્ષ્યચાસ્ત્ર કે જ્યોતિષચાસ્ત્રનો જાણકાર પણ આ પ્રકારનો પ્રભાવક ગણ્ણાય, ભવિષ્યકથન વગેરે સાધુનો આચાર નથી, પરંતુ યોગ્ય વ્યક્તિ તે વિષયનો પારંગત બને તો અવસરે શાસનહીલના નિવારણ અર્થે અથવા વિરિષ્ટ શાસનપ્રભાવના અર્થે તેનો ઉપયોગ કરી શકાય, શાસનહીલના માટે વિરોધી તરકદી નિમિત વગેરેનો આચાર લેવામાં આવતો હોય ત્યારે સામે તેવી જ શક્તિનો ઉપયોગ કરવો અનિવાર્ય થાય છે. જૈનાચાર્ય આ વિષયના પણ સારા જાણકાર છે તેવી છાપ ઊભી રહે.

વરાહભિડે નિમિતના બળથી શાસનની અપભ્રાજનાનો પ્રસંગ ઊભો કર્યો ત્યારે શ્રી ભગ્નાહૃસ્વામીએ તેના વારસ માટે નિમિતકથન કર્યું. આ રીતે ઘરું નિમિતકથન કરોકટીના સમયે શાસન પ્રભાવનાનું કારણ છે.

અષ્ટાંગનિમિતનું જ્ઞાન, અંગવિદ્યા, શુક્નવિદ્યા, વાસ્તુવિદ્યા વગેરે કોઈ એક અંગમાં પારંગત હોય તે પણ આ પ્રકારના પ્રભાવકના અવાંતર બેદ જાપાવા.

(૫) તપસ્વી: ખૂબ શાતાપૂર્વક જે અદ્ધમ કે તેની ઉપરની કઠોર તપશ્ચર્યા કરી શકે તેવા ઉત્ત્ર તપસ્વીએ તપપ્રભાવક બને છે. તપસ્વી સાધુને જોઈને લોકોને સાધુર્મ પ્રત્યે બહુમાન પેદા થાય છે અને તેથી સાધુર્મના બીજનું પણ આરોપજી થાય છે. તપની જેમ ઉત્ત્ર ત્યાગ, દીર્ઘકાળીન ત્યાગ, મલ પરીષદ,

કાયકલેશ, લોચ, ઉગ્ર વિહાર, આયંબિલની દીર્ઘ તપશ્ચર્યા, તડકામાં બહાર સ્થંતીલ જરૂર, ગોચરશર્યા તથા સાધુષ્છવનની અન્ય નિર્દોષ શર્યાઓ જોઈને બાલજીવોને સાધુષ્મર્મ પ્રત્યે આદર અને આકર્ષણ થાય. સાધુ સહિષ્ણૂ, ત્યાગી અને તપસ્વી હોય છે તેવો સાધુ ઉપર અહોભાવ થાય છે. ધર્મ બીજનું વાવેતર થાય છે.

(૬-૭) મંત્રસિદ્ધ અને ચૂર્ણસિદ્ધ: મંત્ર અને ચૂર્ણયોગના પ્રયોગો પણ આપત્તિમાં કે શાસનમાલિન્યનું વારકા કરવા જેવા વિશિષ્ટ પ્રસંગ જિવાય કરવાના નથી. અન્યદર્શનીઓ દ્વારા મંત્ર-ચૂર્ણના પ્રયોગ દ્વારા તેમની ઉન્નતિ અને જિનશાસનની અપભ્રાજના થતી હોય ત્યારે તે ટાળવા અને સંચરક્ષા કરવા મંત્ર-ચૂર્ણના પ્રયોગ કરવા પડે. તેથી વિશિષ્ટ યોગ્ય વ્યક્તિને મંત્ર-ચૂર્ણ યોગ સિદ્ધ કરવાની અનુમતિ આપવામાં આવે છે. તેવા વિશિષ્ટ મુનિઓએ ગુર્વાશાયી અનેક મંત્રો-તંત્રો-યંત્રો વગેરેમાં પારંગત બનવું જોઈએ.

પ્રાવચનિક, વાદી; નૈમિત્તિક, મંત્રસિદ્ધ, વિદ્યાસિદ્ધ, ચૂર્ણસિદ્ધ પ્રભાવકોને પુઢની તલવારની જેમ પોતાની શક્તિનો ઉપયોગ કરવાનો પ્રસંગ ક્યારેક જ આવે, કદાચ જિંદગીમાં તેવો પ્રસંગ કયારેય પક્ષ ન આવે તે છતાં તે પ્રભાવક છે.

(૮) કવિ: જે વ્યક્તિ પાસે કવિત્વશક્તિ હોય તે પોતાના કાવ્યો દ્વારા જવોને આકર્ષણ શકે છે. ગંધમાં પક્ષ પદલાલિત્ય દ્વારા અથવા પ્રાસયુક્તતા કે પદ્યબદ્ધ રૂપના દ્વારા ગહન વિષયોને પક્ષ રસાળ અને લોકલોગ્ય બનાવી શકાય તે પક્ષ એક વિશિષ્ટ કાયોપશમ કહેવાય. કાવ્યના માધ્યમથી પક્ષ લોકો ધર્મ પામે છે. કપિલ કેવલ અને વૃદ્ધવાદિસૂરીએ રાસડો ગાયો અને ધર્મપ્રભાવના થઈ હતી.

તે જ રીતે કાવ્યને સુંદર રીતે ગાવું, સુંદર પદલાલિત્યથી બોલવું, મધુર સ્વરથી અનેક રાગમાં બોલવું, હદ્દયસ્પર્શી રસાળ શૈલીમાં લખવું વગેરે તેના અવાંતર બેદો છે. તેના દ્વારા જવો ઉદાસીન હોય તે પ્રસન્ન થાય છે. આનંદના

વિષય તરીકે વાતથી આકર્ષિત થાય છે અને છેવટે ધર્મ સુધી પહોંચે છે.

આ રીતે પ્રભાવકના મુખ્ય આઠ બેદ ગણપાવ્યા તેમ રાજા, મંત્રી કે અતિ લોકમાન્ય કે રાજમાન્ય વ્યક્તિ પ્રાર્થિત થાય તો તેનાથી અનેક વ્યક્તિઓ પ્રભાવિત થાય અને ધર્મ પ્રત્યે આકર્ષિત થાય તેવી લોકમાન્ય કે રાજમાન્ય વ્યક્તિની આદેયતાના કારણે ધર્મપ્રભાવક બને છે.

તેમ આચાર્ય આદિ પદસ્થોનું શાસ્ત્રમાં વિરોધ જૌરવ કરવાનું વિષયાન છે. તેની પાછળ પણ કારણ આ છે કે તેમનું માન-જૌરવ સાચવવાથી તેમની આદેયતા વધે અને લોકોમાં તેમનો આદર વધે તેથી તેમનું વચન વિરોધ ઉપાદેય અને અને અનેક લોકો ધર્મમાં જોડાય.

તેમ વ્યક્તિગત ધર્મપ્રવૃત્તિઓ પણ જિનાજી અનુસાર, ભાવપૂર્વક, આદરપૂર્વક અને વિષિપૂર્વક કરવામાં આવે તો તે જોનારના હદ્યમાં ધર્મના ઉત્તમ બીજ વાવે છે.

તીર્થયાત્રા, સંધ, રથયાત્રા-વરથોડો, પૂજા, ભાવના, મહાપૂજા, સારૈયા, ઉદ્ઘાપન, પ્રતારોપણ, પ્રતિષ્ઠા મહોત્સવ, પદપ્રદાન-દીક્ષા મહોત્સવ, અંજનશલાકા અને તેવા બીજા પણ જે સામૂહિક અનુઝાનો છે તે બધામાં જિનાજી અનુસાર ઉદાર હાથે ઔચિત્યપૂર્વક અનુકૂળ, જીવદ્યા, યતના વગેરેને પણ સ્થાન આપવામાં આવે તો તેનાથી જીનેતરો પણ આકર્ષાય, અનુમોદના કરે અને તે દ્વારા ધર્મની જાહોજલાલી, માહાત્મ્ય, પ્રભાવ બીજાના હદ્યમાં જાગે છે અને અહોભાવ વધે છે. આવા પ્રસંગોમાં ઉપસ્થિત રહેનાર, જોનાર, ઉજવનાર, સમાચાર સાંભળનાર વગેરે બધાના હદ્યમાં આનંદ, આળાંદ અને ધર્મ પ્રત્યેનો આદરભાવ થાય છે. તેથી આવા કાર્યોને પણ પ્રભાવના કહેવાય.

#### ઉપસ્થિતા:

જે વ્યક્તિ પોતાની તન-મન-ધનની શક્તિનો જિનાજી મુજબ વિનય, નાતા, ત્યાગ, તપ વગેરે આરાધનામાં વય કરે છે, તેના દ્વારા તેનો આત્મા જિનવચન અને ધર્મ-આરાધનાથી ભાવિત થાય છે.

તેમ, તેની નિકટની વ્યક્તિઓ તથા તે તે ધર્માનુષ્ઠાનો જોનાર દરેકના હઠમાં જિનવચન અને વિનયાહિ ગુણો ઉપાદેય તરીકે વસે છે.

ઉપદેશ વગેરેથી બીજાને ધર્મ પમાડી શકાય છે, તપ્ય વગેરેથી ધર્મ પ્રત્યે આકર્ષિત કરી શકાય છે, વાદ અને નિમિત્ત વગેરેથી ઉન્માર્ગથી પાછા વાળી શકાય છે.

બીજાને જૈન ધર્મની કે હેવ-ગુરુની નિંદા કરતા અટકાવવાના અને હેવ-ગુરુ- ધર્મના અનુરાગી બનાવવાના બધા સમ્યગ્ ઉપાયો પ્રભાવના કહેવાય અને તે કરનાર પ્રભાવક કહેવાય.

પ્રભાવના એ સમ્યગ્ દર્શનનો આચાર છે, તેનાથી પોતાનું સમ્યગ્દર્શન સ્થિર થાય છે, નિર્મળ થાય છે અને અનેકોને સમ્યગ્દર્શનાહિ ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી શક્તિ અનુસાર આ આચારનું પાલન કરવું.



## ॥ सम्यगदर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति ॥

दर्शन- ज्ञान- चारित्र- तप आ चारे केवળज्ञानीने संपूर्ण अने युगपद् छे  
જे छन्दस्थने माटे पूर्व पूर्वनी सहित पाछण- पाचणना होय तो अपूर्ण होवा  
छतां यथास्थित होय छे. पूर्व विनाना होय तो कथंस्थितू कारकारूप कहेवाय छतां  
ते मुख्य न कहेवाय, अल्पासङ्कृप कहेवाय. तप ए चारित्रनो अंश छे, उत्तरगुञ्ज  
छे तेथी चारित्रमां तेनो अंतर्भाव धवा छतां तेनी प्रधानताथी जुद्दो अताव्यो  
छे. तपना पारक्षमा अतर पारक्षमां जो असंयम होय तो गज्जनान जेवो  
अताव्यो छे. चारित्र पूर्वकनो ज तप वास्तविक बने छे, जेमां संयम नहि, मन-  
दयन- कायानु नियंत्रण नहि, बीजा पापोधी निवृति नहि, ते तप लांबज्ञ जेवो  
कहेवाय.

यत्र ब्रह्म- जिनार्द्धा च कषायाणां तथा हतिः।

सानुबंधा जिनाज्ञा च तत्पः शुद्धमिष्यते ॥

आ होय तो तप वास्तविक बने छे. अहीं भ्रष्टचर्य तथा कथाय नाश बने  
चारित्रङ्क प्रभु छे.

चारित्र पश ज्ञानपूर्वक अने ज्ञानीनी निश्चापूर्वकनुं होय तो ते वास्तविक  
बने छे. जो ज्ञान नव्ही तो चारित्रनुं पालन व्यवस्थित थई शक्तुं नव्ही, “पढमं  
नाण तओ दया” भतावेल छे. सर्व विरति संयमने ज्ञान योग कहो छे. आचारांग  
वजेरे शाळो पशा संयम पालनना कारकारूप छे. कारका वगर कार्य होय नहि  
तेथी ज्ञानपूर्वकनुं चारित्र प्रधान- मुख्य छे. माटे तप पहेला चारित्र जोईअे  
तेम चारित्र माटे ज्ञान जोईअे. व्यवहार चारित्र माटे शाखज्ञान जोईअे  
निश्चय चारित्र माटे ज्ञानी परिष्कारि जोईअे. विषय कथायनी हेयङ्कै परिष्कारि  
ते सम्यगदर्शन अने तेनाथी निवृत्तिनी परिष्कारि ए चारित्र कहेवाय. चारित्र  
माटे हेय उपादेयपक्षानुं ज्ञान, हेयत्व- उपादेयत्व तरीकेनी परिष्कारि अने  
हेयने हुं छेहुं छु, हेय रहित थउं छु, उपादेयने स्वीकारै - आचयुं छु वजेरे  
परिष्कारिने सम्यक् चारित्र कहेवाय. माटे ज्ञान ए चारित्रमां अनिवार्य छे.

જ્ઞાનવાળાને ચારિત્ર વિકલ્પે હોય, ચારિત્રવાળાને જ્ઞાન અનિવાર્ય છે.

ચારિત્રમાં જ્ઞાન વિરોધ ઉપલબ્ધ થાય છે અને જ્ઞાનની પરિદ્ધતિ કેળવાય છે. એટલે ચારિત્ર જ્ઞાનમાં સહાયક- પોષક- વર્ધક છે પરંતુ જ્ઞાન પૂર્વક જ ચારિત્ર હોય તેથી જ્ઞાન પછી ચારિત્ર પંદ છે. આ અપૂર્વ અવસ્થામાં જ્ઞાન અપૂર્વ છે એકે અંશનું જ્ઞાન પૂર્વનથી કેમકે ‘જો એં જાગ્રા સો સવ્વ જાગ્રા’ તેથી અપૂર્વ જ્ઞાનીને સર્વજ્ઞ જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ પ્રધાન હોય છે. છઘસ્થનું જ્ઞાન અંધ કેવું છે તે કેવળ અનુભવ ઉપર ચાલતું નથી. જ્ઞાનીના વચન અનુસારે અનુભવ હોય તો તે ગ્રમાજ્ઞ અને વિપરીત હોય તો અગ્રમાજ્ઞ. જ્ઞાન હોય તો પણ સંપૂર્ણ જ્ઞાનીના વચન પર શ્રદ્ધા જોઈએ અને જ્ઞાન ન હોય તો પણ સર્વજ્ઞના વચન પર શ્રદ્ધા જોઈએ.

દુનિયા સર્વત્ર તે-તે વિષયના જ્ઞાનીના વચન અને કાર્ય ઉપરની શ્રદ્ધાથી ચાલે છે. સર્વજ્ઞના વચન ઉપરની દઢ શ્રદ્ધાથી જ્ઞાનવરણ-દર્શનવરણ-મોહનીય-અંતરાયના કષ્યોપશમ થાય છે. દઢ શ્રદ્ધા એ દર્શન મોહનીયનો કષ્યોપશમ છે તેનાથી જ્ઞાનવરણનો કષ્યોપશમ થાય છે. તે બજે દારા ચારિત્ર મોહનીયનો કષ્યોપશમ થાય છે. ત્રણ દારા અંતરાયનો કષ્યોપશમ થાય છે અને ચારે કષ્યોપશમ દારા દર્શન મોહનીયના કષ્યોપશમની તીવ્રતા પામી પોતે ક્ષાયિક ભાવને પામે છે અને ત્રણને ક્ષાયિકભાવ પમાડે છે. માટે જ્ઞાનના મૂળમાં જો દર્શન હોય તો તે વિકૃત બનતું નથી, બાધક બનતું નથી, કષાય વિષય પોષક બનતું નથી. દર્શન પૂર્વકનું ઓછું કે વત્તુ જ્ઞાન નિરંતર જ્ઞાનની વૃદ્ધિનું, નિરંતર કર્મ કષ્યોપશમ-કષયનું કારણ બને છે. ચારિત્ર મોહનીયના કષ્યોપશમ-કષયનું કારણ બને છે. અંતરાયના કષ્યોપશમ-કષયનું કારણ બને છે. શુક્લ પણના ચંદ્રની જેમ સમ્યગ્દર્શન આત્મ ગુણોની નિરંતર વૃદ્ધિ કરે છે. માટે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ કર્મ પરસ્પર કંબિક કાર્યકારણ ભાવ પુક્ત છે.

પૂર્વનું પદ ઉત્તર પદનું ગ્રાપક, પોષક, વર્ધક અવશ્ય છે. ઉત્તરના પદો પૂર્વપદની ગ્રાપિતમાં, દઢતામાં, વધવામાં કારણ બની રહે છે જો બાધક તત્ત્વરૂપ કષાય-વિષય વિગેરેનો અભિનિવેશ ન હોય તો. માટે ઉત્તર પદો અભ્યાસરૂપ

આચરવા પરંતુ સમ્યગ્દર્શન પદમાં વિશેષ આદર કેળવવો.

સમ્યગ્દર્શન એટલે સર્વજ્ઞ ભાગિત વચન ઉપર દઢ વિશ્વાસ, તે કેળવીને આપણું જ્ઞાન, અનુભવ સર્વજ્ઞના વચન અનુસારે છે કે નહિ તે તપાસવું, જો છે તો તેમાં વ્યવસ્થિત આગળ વધવું, જો નથી તો તેને માન્યતાધી, આચરણાધી સુધ્યારવું.

નવો નવો સર્વજ્ઞોક્ત તત્ત્વનો અભ્યાસ કરવો, એના દ્રષ્ટિકોણ, અપેક્ષાઓ, પ્રકારો સમજવા, વિચારવા, તદનુસાર વર્તવું, આ રીતે આત્મા શ્રદ્ધાપૂર્વક જ્ઞાન ચારિત્રમાં પ્રવર્તન કરતા પરાકાણાને પામે છે.



## ● ● માન્યતા અને વ્યવહાર ● ●

જીવનમાં જ્ઞાન વગરના એટલે કે વિશેષ બોધ વગરના જીવોમાં પૂર્વના સંસ્કારો અને કર્મના ઉદ્ઘોના આધારે સાચી કે ખોટી રૂચિ જીવમાં પ્રવર્તે છે. આ રૂચિને માન્યતા પણ કહેવાય છે, તે સાચી હોય, ખોટી પણ હોય, પ્રજ્ઞાશસ્તના અભ્યાસ દ્વારા, વાર્ણવાર વિચારપણ પરાવર્તન દ્વારા સાચી વાતમાં જાળકારી આવે છે અને રૂચિ જન્મે છે એ જ રીતે સાચે શક્ય ધર્મ આરાધનાની મૂળભૂત પ્રવૃત્તિઓ અને આનુષેણિક પ્રવૃત્તિઓ એ રૂચિને પોષે છે, વધારે છે, આ રીતે સાચી આત્મગુરૂની- મોક્ષ સ્વરૂપની અને તેને મેળવી આપનાર સમ્યગ્ જ્ઞાન- દર્શન- ચારિત્રના આચારોઝીપણ રૂચિ ઉત્પન્ન થઈ વધે છે.

જિનવચનના અભ્યાસ- ચિંતન- પરાવર્તન દ્વારા જેમ ઉપાદેયની- આચરવા ધોય વાતોની રૂચિ જન્મે છે તે જ રીતે હેય વાતો તરીકે અનાદિ કાળથી જીવ જેને માનતો હતો તે પોતાની બ્રાન્ચિ અણસમજ હતી તેમ ઓળખાય છે. તેથી આટલા કાળ સુધી સારી- સાચી વસ્તુ આચાર- વિચાર અંગે રાખેલી ખોટી માન્યતા વલભ તે જીવને સમજાય છે અને પોતાની અજ્ઞાન- મોહ- અવિવેક અવસ્થા ઉપર નકરત જન્મે છે અને હેયની માન્યતા જન્મે છે, વધતી જાય છે, નકર બને છે અને આત્મામાં જે અશુભ આશ્રય તત્ત્વોમાં જે આદરભાવ- ઉપાદેયભાવ- ગુણભાવની બ્રાન્ચિ હતી તે જિનવચનના અભ્યાસ દ્વારા, મનન- ચિંતન- પરાવર્તન દ્વારા એ આશ્રય તત્ત્વોના સ્વરૂપને- કારકોને અને કળને સમજાને જીવને જે આદર હતો તે ઘટતો જાય અને કાલાંતરે અનાદર પણ જન્મે, હેયપણાની બુદ્ધિ અને રૂચિ એટલે સંવેદન થાય, આ માન્યતા પણ જિનવચનના અભ્યાસ- ભાવનાથી આવે છે એટલે કે સંસારના આશ્રવરૂપ પરિવાર શરીર- ધન- માન પાન- અશો આરામ- રસ- ઋષિઓ- શાત્રા ગારવ- કથાયો- ઈન્દ્રિયો- ઈન્દ્રિયના વિષયો આ બધા ઉપર જીવની જે ઉપાદેયપદ્ધાની, ગુણકારીપણાની બુધ્યિ છે તે બુધ્યિ ફરી જાય છે અને ત્યાજ્યપણાની નુકશાનકારીપણાની બુધ્યિ- બ્રહ્મા- સંવેદના ઉત્પન્ન થાય છે, આ શરીર ઉત્પન્ન

કરવામાં જેમ જિનવચનની ભાવના ચિંતન કારણ છે તેમ સંસારની પ્રવૃત્તિઓમાં આસક્તિ- રસ-કરણ કરાવણું અનુમોદન દ્વારા પોષજી વગેરેને શક્ય એટલા છોડવામાં આવે, ઘટાડવામાં આવે તો એ દ્વારા પણ હેપટની રૂચિ-માન્યતા જન્મે છે, તીવ્ર બને છે માટે અનંત આત્માઓ બાધ ત્યાગ દ્વારા બાધ ત્યાગ સુધી પહોંચે છે.

સામાન્યથી માન્યતામાં ફેરફાર ચાલતો નથી. વિરોધમાં માન્યતામાં ફેરફાર જે પ્રકારનો હોય. વિપરીત માન્યતા અને અનિશ્ચિત માન્યતા. વિપરીત માન્યતા વિપરીત અવસ્થા સર્જક છે, અનિશ્ચિત માન્યતા કોઈ વજનદાર, વજુદ્વાળી ભરોસાપાત્ર નથી હોતી. અનિશ્ચિત વલખવાળાની કિર્મત નથી હોતી છતાં વિપરીત માન્યતાવાળા કરતા આ વ્યવહાર પર્મને કંઈક રીતે યોગ્ય હોય કારણ કે આશ્રવમાં- વિષયકથાપમાં આસક્ત બનતો નથી. સારી માન્યતા અને નિશ્ચિત માન્યતાવાળાના જીવનમાં આશ્રવતત્વની પ્રવૃત્તિ છૂટતી જાય- ઘટતી જાય.

કોઈક સંસ્કારના કારણો, કોઈ નિકાયિત પુસ્તકે પાપના કારણે એની વિપરીત પ્રવૃત્તિ જો ન ઘટતી હોય કે કદાચ બાબ્ધથી વધતી હોય તો પણ તે પ્રવૃત્તિમાં તે બળતો હોય, ટાક્ક ન અનુભવતો હોય, દુઃખતા મને નીભાવતો હોય પણ એનાથી પોતાની મહત્ત્વા-ગૌરવ ન ગણતો હોય, વખોડતો હોય, વખાણતો ન હોય.

આથી વિપરીત અવસ્થારૂપે જેને આશ્રવમાં, સંસારના રંગરાગમાં ગૌરવ અનુભવાતું હોય તેને તેમાં હેપ્તવની માન્યતા ન હોય. તેથી સંવરમાં- પર્મર્દુપ ત્યાગ- તપ- ધાન- શીખ વગેરે તે કરતો હોવા છતાં તેમાં ઠરતો નથી- અકળાતો હોય છે. નભાવતો, નિભાવતો, પુરુ કરતો હોય છે. મહત્ત્વ ધનની, ધાનની ગણે છે, જે પાત્રમાં આપે છે, છૂટે છે તેની મહત્ત્વા નથી લાગતી તેથી સંસાર સ્વભાવગત રહે છે, કર્મ આગંતુક પારક તરીકેની વૃત્તિવાળો રહે છે.

જે વ્યવહારથી ઉચ્ચી સારી ગણપતી સંસારની અવસ્થા પણ ન છોડી શકે, ન ઘટાડી શકે છતાં જો તેને નભાવવા જેવી- નીભાવવા જેવી લાગકીયાઓ હુદયમાં આવે કે લાવવા કોશીષ કરે તો તે સંસાર અને આશ્રવ પ્રત્યે હેયની માન્યતાવાળો

જને અને જો આ દસ્તિ ન હોય તો વ્યવહારથી ધર્મ હોવા છતાં એ નભાવવારૂપે કરવાનો રહે તેથી હૃદયની માન્યતા સંસારની બની રહે.

જેના હૃદયમાં સંવર તત્ત્વ- ધર્મતત્ત્વ- આત્મતત્ત્વ- મોક્ષતત્ત્વ- ધર્મકિયા- આત્માના ગુણો- આચારો આ ભધાની ઉપાદેશતા અનુભવાય તે ધર્મને- આચારને- વિધિને ઉલ્લાસથી, ઉપયોગથી, તરણોળ થઈને સંસારને જોડા કરીને કરે, આવા આત્માના ભાવ ધર્મ વ્યવહારને ભાવ વ્યવહાર કહેવાય અને આ અવસ્થાવાળાના સંસારના વ્યવહારને અપ્રધાન ભાવ-વ્યવહાર અધવા દ્વય વ્યવહાર સમજાય.

જો સન્માન્યતા જગ્નમાવવા- ભાવના ઉત્પન્ન કરવા- સંસાર પર નફરત બગાડવા સંસારના વ્યવહાર ઘટાડે, એ જ રીતે ધર્મ વ્યવહારમાં તન્મય- લાગફીયુક્ત બનવા કોશીય કરે- પ્રયત્ન કરે તો બન્નેને સંસાર વ્યવહાર ઘટાડવાના પ્રયત્નને અને ધર્મવ્યવહારમાં પ્રવર્તવાના પ્રયત્નને ભાવ ધર્મવ્યવહાર કહેવાય. આ રીતે વ્યવહારથી નિશ્ચય માન્યતા અનુભવમાં આવે છે.

વ્યવહાર ધર્મથી વ્યવહાર સંસાર ઘટે છે. વ્યવહાર ધર્મથી ભાવ- નિશ્ચય ધર્મ આવે છે. નિષ્યયધર્મથી અંતરાત્મામાં રહેલ ક્ષય- નોક્ષય- ઈન્દ્રિય વળેરેના પલશરૂપ નિષ્યપસંસાર નાશ પામે છે અને આત્મસ્વરૂપ પરાકાશરૂપ નિશ્ચય ધર્મ પ્રગટ થાય છે તે જ મોકાનું સ્વરૂપ છે માટે આચારમાં ચુસ્ત બનવું, સંસારની પ્રવૃત્તિ- વૃત્તિ ઘટાડવી અને બને માટે જિનવચન દ્વારા આચારના લાભ- એનું સ્વરૂપ- એના રખાના ઉપાય, એના નાશક પાપો વળેરે ઓળખવા અને સંસારની ભયાનકતા, તુકાણ, દુઃખ અને હુર્ગતિની પરંપરા વારંવાર જિન વચનથી ભાવિત કરવી જેથી કેવળશાન અને શીખ શાશ્વત સ્થાન પ્રાપ્ત થાય.



**‘परगुणगहणं छंदाणुवत्तणं हिअमकक्कसं वदणं ।  
णिच्यं सदोषगहणं अमंतमूलं वसीकरणं’’॥**

(१) परगुणग्रहणः- संसारमां विशिष्ट भूमिकाए पहोच्या वगरना ज्ञानेमां मोटा भागे घेणनी विशेषता अने गुणानी अवृत्ता-गौणता छोय छे तेवी आपडी अने बीजा छवोनी स्थिति छे. जेम अन्य छवो पोताना साचा के आरोपित गुणने वधाले. बोले, प्रश्नासे तो जेम पोताने आनंद थाय छे तेवी ज रीते आपडी बीजाना गुणो बोलीअ तो बीजाने आनंद सहजे थाय. बीजा आपडी प्रवृत्तिधी आनंदित थाय-प्रसन्न थाय ते व्यवहारमां जडवी छे. बीजाना गुणो, सत्कर्य वर्षाववा ते प्रथम प्रसन्नतानो उपाय छे, ते परोक्षमां अने साक्षात् भने रीते करवो, ऐधी विपरीत परोक्ष के साक्षात् बीजाना दोषो बोलवाई सांबणनार अना. पर अडूचि करे छे तेम ए सांबणनार जो सारो विचारक माणस ढरो तो आपडा उपर पक्का अडूचि करशे. जेना दोष बोलीअ तेने पक्का आपडा उपर अडूचि थाय, आपडा उपर अप्रसन्न थाय अने एनाथी मित्र के सानुकूण थवाना बदले विरोधी-प्रतिकूण थाय तेथी बीजाना साचा के काल्पनिक दोषो न बोलवा ते व्यवहार सुधारवानो-अनुकूण करवानो उपाय छे. बीजाना गुणो जोवा- बोलवाई छव पोते पोताना छाये पोतानामां गुणो ग्रहण करे छे ए ज रीते छव पोते बीजाना दोष विचारतो, जोतो, बोलतो पोते पोताना छाये ऐटले जात प्रयत्नधी पोतानामां दोषो ग्रहण करे छे, दोषोने ग्रेश पमाडे छे.

माटे बीजाना गुणो बोलवा, बीजाना दोषो न बोलवा, आ सामान्यधी व्यवहार सुंदर बनाववानो उपाय छे. आनाथी सामा अनुकूण बने छे.

(२) छंदोऽनुवर्तनः- बीजानी ईङ्गाने अनुकूण वर्तवाई छव प्रसन्न थाय छे, बीजाने प्रतिकूण के बीजानी ईङ्गाई प्रतिकूण वर्तवाई सामो छव अप्रसन्न थाय छे. प्रसन्न थयेल छव अनुकूण बने छे, अप्रसन्न थयेल छव प्रतिकूण बने छे. माटे बीजाने अनुकूण वर्तवानी काणल तेयारी राखवी, कम से कम बीजाने प्रतिकूण न ज भनीअ तेनी पक्का काणल राखवी. पोताने अनुकूण

વતે તેવી અપેક્ષા ક્યારે પણ કોઈ તરફથી ન રાખવી અને પોતાને પ્રતિકૂળ વર્તો તો તેને લક્ષમાં ન લેતાં તે વાત ગૌણ ગણવી-ઉપેક્ષા કરવી. આ ચારે રીતે વર્તનાર માણસ વ્યવહારમાં શાંતિથી છેવે છે. બીજા અને અનુકૂળ બને છે, અનુકૂળ રહે છે.

(૩) હિતકારી મધુર વચન બોલવા:- વચન વગર વ્યવહાર થતો નથી તેથી જે વચન બોલાય તે હિતકારી જોઈએ અને અકર્કશ વચન હોય તો જ સામો શાંતિથી સંભળી શકે-વિચારી શકે, અને આનંદ અને રૂચિ ઉત્પન્ન કરાવે. અકર્કશથી કઠોર, આંશેપયુક્ત, અસત્ય, વિઝુદ્ધ જેમ ન હોવું જોઈએ તેમ યોગ્ય રૂપમાં મીટશવાળું-આદર-પ્રેમ-વાતસલ્યભાવ સૂચવનાર પણ જોઈએ. હિતકારી એટલે આગંતુકલાભકારી અને સ્થાયિલાભકારી, આલોકલાભકારી અને પરલોકલાભકારી વગેરે અનેક રીતે વિચારાય. મસ્તુતમાં સામાન્ય અર્થ તરીકે સામાની વ્યક્તિએ જો એને હિતકારી લાગે તો મસ્ત થાય માટે પરલોકહિતકારી ન હોય. તેમ પ્રથમ આલોકહિતકારી લેવું, ઉભયલોકહિતકારી હોય તો ઉત્તમ છે, આવા મધુર, પ્રિય અને હિતકારી વચનથી બગડેલા સંબંધો સુધરે છે. સારા સંબંધો મજબૂત થાય છે, ટકે છે. નવા સંબંધો બંધાય છે આથી વિપરીતમાં વચન મીઠું હોવા છતાં અહિતકારી હોય અથવા કઠોર હિતકારી હોય તો મોટા ભાગના જીવો એને સમજ ન શકે-જરવી ન શકે, માટે સારા વ્યવહારની ઈશ્વરીઓ મધુર વાણીવ્યવહાર કરવો. બીજાની કઠોર વાળી હોય તો ગળી જવી. જવાબ મધુર વાણીથી વાળવો, અહિતકારી વાતોમાં ન પડવું, અહિતકારી વાતો સ્વ-પરને આલોક-પરલોકના અનેક નુકશાન સર્જે છે માટે હિતકારી અહિતકારીને સૂક્ષ્મતાથી સમજવું જોઈએ.

(૪) સદ્ધ પોતાના દોષ જોઈ નાર બનવું:- પોતાના ગુણ ન ગાવા, ન બોલવા, પોતાના ગુણ ગાવા તે સામા માણસનું અપમાન છે, ક્યારેય પણ પોતાના ગુણ નહિ બોલનાર ઉત્તમ બને છે અને સહેજ પણ ભૂલ કે કેરફારમાં પોતાના માથે દોષ લઈ લેનાર, પોતાના દોષ સ્વીકારનાર નારતાના કારણે બીજાને મસન્ન કરે છે. જીવો મોટા ભાગે પોતાનો દોષ હોવા છતાં સ્વીકારતા

નથી. પ્રથમ તો સ્પષ્ટ ઈન્કાર કરે કે પકડાઈ જાય ત્યારે સ્વીકારે તો પણ તેમાં અનેક ગ્રાકારે બચાવ ભેગા લેળવે છે. આ બધું બીજાને અવિશ્વાસ અને અપીતિનું કારણ બને છે તેના બદલે સામે ચીને પોતાના દોષો સ્વીકારનાર પોતાના પાપનો નાશ કરે છે, પોતાના દોષોનો નાશ કરે છે, સામાને પણ પ્રસંગતા આપે છે, માટે સ્વદોષસ્વીકાર એ સારા વ્યવહારનું સ્વરૂપ છે. સ્વદોષ બચાવ એ વ્યવહાર કલુષિતતાનું કારણ છે.

આ શ્વોકમાં જીતાવેલ છુવન વ્યવહાર લોકોનું વશીકરણ કરે છે. લોકમાં વશીકરણ તરીકે વશીકરણ મંત્ર અને મૂળીયા ઔષ્ઠ્ધ કહેવાય છે. માટે અને જે મંત્રરૂપ નથી, જે મૂળરૂપ નથી છીતાં પણ વશીકરણરૂપ છે તે બતાવ્યું છે. અમંત્રમૂળનો અર્થ મંત્ર વગરનું, મૂળીયા-ઔષ્ઠ્ધ વગરનું વશીકરણ. આનાથી આજુબાજુના નાના મોટા વડીલો આંદ્રિતો બધા વશ થાય છે, આપણા તરફ પ્રેમાળ બને છે, સહાનુભૂતિ-રહેમ નજર રાજનાર બને છે.

આ બધા કાર્યથી નીચ ગોત્ર-અપયશ-હૃદ્બાંગ્ય-અનાદેય વગેરે ભારે કર્મો પણ નાશ પામે છે અને આનાથી વિપરીત સારા કર્મો પ્રબલરૂપમાં છુવ બાંધે છે, આના દ્વારા પણ છુવ લોકપ્રિય બને છે, ધર્મ યોગ્ય બને છે, જેનામાં આ ગુણો ન હોય તેવા સાથે સંભાળીને વ્યવહાર કરવો, આપણે આ ગુણો કેળવીને ધર્મ યોગ્ય બનીએ, છુવનમાં સ્વ-પરને શાંતિ સર્જીએ, અને આત્મગુણ વિકસાવતા આગળ વધીએ.



**મિત્તિ પરોવયારો સુસીલયા અજ્જાવં પિયાલવણં ।**  
**દક્ખિણં વિણયતં સુયણાણ ગુણા નિસગેણં ॥**

(૧) મેત્રી (૨) પરોપકાર (૩) સુશીલપણું (૪) સરળતા (૫) છિય બોલતું  
(૬) દાસિષ્ટતા અને (૭) વિનયપણું-સજ્જનોમાં આ ઉ ગુણો સ્વભાવથી  
હોય છે.

જે ને મોટે જવા માટે કર્મ ખપાવવા પડે, કર્મ ખપાવવા વિશિષ્ટ ધર્મસાધના  
કરવી જોઈએ અને તે માટે રૂતન્ય મેળવવા અને આરાવવા પડે, પરંતુ એ ન  
મળ્યા હોય તેને પક્ષ એને યોગ્ય થવા માટે પ્રયત્ન સુજ્જન-સારા માણસ બનવું  
પડે. સારા માણસ બન્યા વગર સાચા ધર્મી, શ્રાવક કે સાહુ બની શકતું નથી, જે  
ધર્મી, શ્રાવક કે સાધુ બનેલા હોય તેમનામાં આ ગુણો અવશ્ય જોઈએ.

આ ગુણો જો હોય તો સાહુપણું, શ્રાવકપણું કે ધર્મપણું શોભે અને આ ગુણો  
જો ન હોય તો ધર્મપણું શોભતું નથી અને ધર્મનો નાશ કે ધર્મથી પડવાનું  
સહેલાઈથી થાય છે, માટે ધર્મી બનનારે આ ગુણો અવશ્ય કેળવવા જોઈએ.

એવીજ રીતે સંસારી જીવોમાં પક્ષ જે ઉપરના ગુણો કેળવે છે તેના ઉપર  
(૧) બધા પ્રેમ-અન્ય પરાવે છે, (૨) સ્નેહથી જુએ છે, (૩) બીજા જીવો એને  
જોઈને આનંદ પામે છે (૪) પોતાના સહાયક માને છે (૫) પોતાના ડિલની  
સુખ-દુઃખની વાત કરવા યોગ્ય માને છે અને વાતો કરે છે, (૬) એની સાથે  
સારો માનવાળો વ્યવહાર કરે છે, (૭) એના કાંઈ હોશથી કુટુંબી, સગાલાઈ કે  
મા-બાપની જેવા સમજીને કરે છે, અને પાછુ આ કાર્ય મને કરવા દીપું તે મારા  
ઉપર ઉપકાર કર્યો તેમ માને છે, (૮) એના પક્ષે ઊભા રહે છે (૯) જગતમાં  
અનું કોઈ વાંકુ બોલે તો વિરોધ કરે, (૧૦) એની નિંદા સાંભળો નહિ, કરે નહિ,  
શક્ય હોય તો કરવા દે નહિ, થતી હોય તો ત્યાંથી ખસી જાય.

આવા અનેક લાભો આ ગુણોથી આ લોકના જીવન વ્યવહારમાં મ્રામ થાય  
છે. આ લોકમાં અનેક રીતે એની સુવાસ કેલાય છે, અનુકૂળતા મળે છે અને  
સજ્જન તરીકે લોકમાં જવાય છે. સજ્જન એટલે સારો માણસ, સારા માણસ

તરીકે જેણો થયું હોય તેણો આ ગુજરો કેળવવા જ પડે. આ ગુજરાવાળા પોતે સ્વસ્થ, શાંત, નિખંચિત હોય છે. અને બીજાને પણ એ આવા ગુજરાવાળા બનાવે છે, એના આશ્રયમાં, આમન્યામાં, કહ્યામાં રહેનાર પણ સ્વસ્થ, શાંત, નિખંચિત બને છે.

માટે જીવનમાં શાંતિ, સ્વસ્થતા, નિખંચિતતા મેળવવા અને આપવા ધર્મને યોગ્ય બનવા, ઉત્તમ ધર્મ આરાપવા માટે, સજજનમાંથી ધર્માં અને સાધુ સુધીના ઉત્તમ ધર્મ આરાપવા માટે પાયારુપ આ ગુજરો જરૂરી છે.

જેમ પાયા વગર મકાન બંધાય નહિ, ટકે નહિ તેમ આ ગુજરો વગર ભાવ આંતર સુખ, વિશાસ અને ધર્મ મળે નહિ, ટકે નહિ.

#### - મેત્તી -

મેત્તી એટલે વૈરનો અભાવ અને સ્નોહ વ્યવહાર.

છઘસ્ય જીવોની અપેક્ષાએ વિચાર કરીએ તો દુઃખી જીવો ઉપર કરુણાભાવ, તિરસ્કારભાવ અને માધ્યસ્થભાવમાંથી શું હોય? જેને જે જીવ પ્રત્યે સારી લાગણી છે તેને દુઃખી જોઈને કરુણાનો ભાવ આવે, અહીં જીવ પ્રત્યે જે સારી લાગણી છે તે મેત્તીભાવ છે અને દુઃખના કારણો તેના પર કરુણાનો ભાવ છે. જેને જે જીવ પ્રત્યે સારી લાગણી નથી તેને તે જીવ પ્રત્યે વૈરભાવ કે ઉપેક્ષાભાવ હોય છે. તેના દુઃખ પ્રત્યે તેને ઉપેક્ષાભાવ કે કઠોરભાવ હોય છે. આ વૈરભાવ, ઉપેક્ષાભાવ અને કઠોરભાવ એ અશુભ ભાવ અને અસજજનતાનું સ્વરૂપ છે. માટે જીવ પ્રત્યે વૈરભાવ કે ઉપેક્ષાભાવ ન રાખતા સારી લાગણી રાખવી તે મેત્તી છે અને તેની ભાવ દુઃખ કે આંતરિક કર્મ-મોહની પરાધીનતાની સિદ્ધિતિમાં કરુણાભાવ રાખવો અને શક્ય મતિકાર કરવો અશક્યમાં કરુણાભાવપૂર્વક માધ્યસ્ય કેળવવું જોઈએ. સારી લાગણીરૂપ મેત્તી, કરુણા તે બનેથી પુક્ત સહાયકભાવ આ સજજનતા છે. સમાન શક્તિવાળા જીવો પ્રત્યે સારી લાગણી તે મેત્તી છે. આ લાગણી સહાનુભૂતિ, સહાયકતા, ઉપબૂજણા વગેરે ભાવો પુક્ત થાય છે. જો સમાન શક્તિવાળા ઉપર મેત્તી રૂપ સારી લાગણી ન હોય તો હિર્ઘા, દેખ, તેની પ્રગતિમાં અવરોધભૂદ્ધિ વગેરે અશુભ ભાવ આવે જે હુર્જનતા સુધી પહોંચાડી શકે છે. જે પોતાનાથી બુદ્ધિ, લક્ષ્મી, પણ, શક્તિ, શાન કે બીજી કોઈપણ

શક્તિથી અધિક છે તેવા જીવો પ્રત્યે સારી લાગણી તે પણ મૈત્રી છે, તે સારી લાગણી પ્રમોદભાવ ઉત્પન્ન કરે છે. એના પ્રત્યે જીવ વિશેષ પ્રસંગ બને છે. જો તેના પ્રત્યે મૈત્રીરૂપ સારી લાગણી ન હોય, અરુચિ, તિરસ્કાર કે ઉપેક્ષા હોય તો પ્રમોદભાવ ન આવે, નિંદા, દેખ વગેરે અને એનાથી થતા નિંદા, અવશા, તિરસ્કાર આવે, માટે પ્રમોદભાવ માટે પણ મૈત્રી જોઈએ.

કોઈ જીવ પ્રત્યે સારી લાગણી છે. પરંતુ તે જીવ અવિનયી છે તો તેના-પ્રત્યે હૃદયમાં કરુણા રાખી વ્યવહારમાં અસાધ્ય સમજી માધ્યસ્થય રાખવાથી નિરસ્કાર ન આવે. માટે અવિનયી ઉપર પણ બહારથી મધ્યસ્વભાવ રાખવા પૂર્વક અંતરમાં સારી લાગણી અને કરુણા રાખીએ તો સજજનતા રહે. માટે મૈત્રી એટલે વેરનો અભાવ થાય, ટકે, તેથી તે તે જીવ પ્રત્યે સારી લાગણી કુશી લાગણી થાય. આ સ્નેહ પરિણામને પણ મૈત્રી કહેવાય. એ જગતના તમામ જીવો પ્રત્યે હોવી જોઈએ. પછી જીવોની અલગ અલગ અવસ્થા વગેરે કારણો એ મૈત્રી કરુણા આદિથી યુક્ત થાય.

વ્યવહાર મૈત્રી ઉપકારી ઉપર-અપકારી ઉપર- સ્વજ્ઞન ઉપર અને શેષ સર્વ જીવો ઉપર એમ રૂ (ચાર) પ્રકારે હોઈ શકે છે.

જે જીવો વ્યવહાર સંબંધથી જોડાયા છે તેઓ આપણી સાથે વ્યવહારમાં ઊચા-નીચા, આડા-અવણા થાય કે આપણી કલ્પનાઓથી આપણને તેવું લાગે કે એની કલ્પનાથી તે આપણાથી પ્રતિકૂળ કે અનનુકૂળ વર્તે ત્યારે સજજન જીવો એના પૂર્વના ઉપકારને યાદ કરીને એની જોડે સારી લાગણી રાખે, પણ તડકડ ન કરે કે એનાથી પ્રતિકૂળ ન વર્તે તે ઉપકારી મૈત્રી કહેવાય. એ રીતે ભવિષ્યમાં એનાથી લાલ થવાનો જાણી ઉપકાર થશે તે દ્રષ્ટિએ પણ અનુકૂળ વર્તે તે પણ ઉપકારી મૈત્રી થાય. એથી વિપરીત કોઈ આપણા વિરોધી ન થાય માટે તેના પ્રત્યે સારી લાગણી રાખીએ કે વિરોધી હોય તો વિરોધી મટી જાય અને અનુકૂળ થાય તે માટે પણ સારી લાગણી રાખવી તે અપકારી મૈત્રી છે.

સજજન માણસો કોઈને પણ વિરોધી બનાવતા નથી. વિરોધીને પણ અનુકૂળ કરે છે. એમના પ્રત્યે પણ ઔપચારિક કે આંતરિક સ્નેહ રાખે છે, આ સ્નેહથી

એના વેરના પરિશામ નાશ પામે છે, અને પોતાને વેરના પરિશામ થતા નથી માટે અપકારી ઉપર પણ સારા પરિશામ રાખવા -- સારી લાગણી રાખવી.

સ્વજન ઉપર સારી લાગણી રાખવાથી ઉચિત વ્યવહાર અને પરસ્પર સહાયકતા ટકી રહે છે, એકબીજાની ટીકા, અવર્ષીવાદ, અહેખાઈ વગેરે થતાં નથી. તેથી સાંસારિક વ્યવહારો અને લોકમાં આબદુ વધે છે. સાથે પરસ્પર બધાના ચિન્તન સ્વસ્થ રહે છે.

જે સ્વજન સિવાયના છે તેમની જોડે મીઠી લાગણી, મીઠો વ્યવહાર, ઔચિત્ય અને આંગિક ગૌરવ તે તે વ્યક્તિના સ્થાનને અનુરૂપ કરવાથી નાના મોટા બધા પ્રસન્ન થાય, પ્રસન્ન રહે, જેથી સજજનતામાં, આપણા ગૌરવમાં વધારો થાય છે. માટે મૈત્રી જીવનમાં અપનાવનાર સજજન બને છે, કદ્દરે કર્કશપણે વર્તનારની સજજનતા ઘટે છે.

મૈત્રીભાવથી સજજન જીવોને અનેક પ્રકારના લાભ થાય છે. (૧) મૈત્રીભાવવાળો બીજા જીવોના દોષ પ્રત્યે ઉપેક્ષાભાવવાળો થાય છે એટલે એની દ્રષ્ટિમાં બીજાના મામુલી દોષો આવતા નથી, લક્ષ્ય જાય તો પણ એ વાતને પ્રધાનતા આપતો નથી, આ રીતે દોષદ્રષ્ટિનો ઘટાડો થતો આવે છે, કાલાંતરે નાશ પણ થાય છે. (૨) આ ભાવનાવાળાને સદા મનની શાંતિ મળે છે. (૩) મૈત્રીભાવથી, સારી લાગણીથી દોષ ઉત્પાદક કર્માંનો નાશ થાય છે, તેમ જ ગુણપ્રાપ્ત બનાય છે એટલે જ્ઞાન-દર્શનાવરકા, અંતરાય, મોહનીય કર્મનો કષ્યોપશમ થાય છે. (૪) સારી લાગણીથી જીવ બીજા પ્રત્યેની અસત્ત પાપ કલ્યનારોથી બચે છે, એ અસત્ત કલ્યનાઓ ઘટે છે, નાશ પામે છે- બીજા જીવો પ્રત્યે વાસ્તવિકપણે સારો વ્યવહાર પ્રવર્તે છે. તેથી આ ભાવનાવાળા જીવને જોતા બીજાને પણ આનંદ થાય છે. (૫) આ ભાવનાથી પાપકર્મ અને પાપકર્મના અનુભંધો ઘટે છે, નાશ પામે છે, પુણ્ય કર્મ અને પુણ્ય કર્મના અનુભંધો ઉત્પત્ત થાય છે. દોષો અને દોષના અનુભંધો ઘટે છે, નાશ પામે છે. ગુણોના અનુભંધો ઉત્પત્ત થાય છે. આથી સુખની અને ગુણની પ્રાપ્તિ થાય છે. હુંબ અને દોષનો નાશ- ઘટાડો થાય છે.

દરિદ્ર ઉપર સ્નેહ રાખે તો દરિદ્રતાના કર્મનો નાશ.

અભિષ ઉપર સ્નેહ રાખે તો જીનાવરશુ કર્મનો નાશ .

દુર્બંગ ઉપર સ્નેહ રાખે તો દીર્ઘાગ્યનો નાશ.

દુર્બંગ ઉપર સ્નેહ રાખે તો આરોગ્યની પ્રાપ્તિ થાય.

(૧) જે જે શક્તિથી પોતે સંપન્ન હોય તે તે શક્તિનો જો ગર્વ કરે તો તે શક્તિથી હીન થવાય. (૨) જે જે શક્તિથી બીજો હીન હોય તેના ઉપર તિરસ્કાર કરે તો પણ તે તે શક્તિથી હીન થવાય. (૩) જે જે શક્તિથી બીજો હીન હોય તેના ઉપર સારી લાગણી રાખે તો તે તે શક્તિના અંતરાયો તૂટે. (૪) જે જે શક્તિસંપન્ન જીવ તે તે શક્તિહીનયાળા ઉપર જરૂરા, પ્રેમ, સહાયક પરિણામ રાખે તો તે તે શક્તિ વધારે વિકસે.

ટૂકમાં મૈત્રી= જીવ પ્રત્યેનો અપ્રેશસ્ત મોહ વગરનો લાગણીનો પરિણામ હોય તો પુષ્પબંધ, પાપકાય, પાપાનુંધ નાશ, પુષ્પાનુંધ, કર્મનિર્જરા, દોષોનો નાશ અને ગુણોની પ્રાપ્તિ થતી જાય છે. જો જીવનો પ્રત્યેની સારી લાગણીનો આ પરિણામ વિકસતો જાય, મજબૂત બને તો સંપૂર્ણ દોષનાશ અને સર્વગુણપ્રાપ્તિ સુધી જીવને પહોંચાડે છે.

### :- પરોપકાર :-

પરોપકાર એ સજજનતાનું વિદ્ધન છે.

પરોપકાર એટલે અન્ય વ્યક્તિની જરૂરીયાત, ઈચ્છા કે પ્રાર્થનાને અન્યચિત્યાનુસાર પૂર્ણ કરવી.

ઉપકાર અને અપકાર બે પરસ્પર વિરોધી શબ્દ છે. બીજાને આગળ વધારવા, પુષ્પ કરવા તે ઉપકાર કરેવાય અને બીજાને હેરાન કરવા, નુકશાન કરવું, અપમાન કરવું તે અપકાર હેવાય.

ઉપકારના સામાન્યથી ત્રણ વિભાગ પાડી શકાય:-

(૧) સામી વ્યક્તિની પરિસ્થિતિ અનુસાર સામી વ્યક્તિ માંગે કે ન માંગે, પરંતુ તેને કોઈ ચીજ વસ્તુની જરૂર હોય તો તે આપવી.

(૨) કોઈને સહાય- પ્રેરક્ષા- રક્ષણ- સહાય- હિમત વગેરેની જરૂર હોય

તો તે આપી, અપાવીને યોગ્યરૂપે તૈયાર કરવા.

(૩) જિશાસુ છોની તે તે કેત્રમાં, આલોકના વ્યવહારોમાં, અર્ધમાં, વેપારમાં, આચારમાં, શાસ્ત્રજ્ઞાનમાં, પરલોકની પરિણતિ વગેરેમાં આવડત ઊભી કરવી, દાખિ ખોલી આપવી, તે પણ ઉપકાર કહેવાય.

સામાન્યથી પ્રથમ પ્રકારનો ઉપકાર તો ઉદાર પ્રકૃતિવાળા કરતા જ રહે છે. જેના કારણે લોકમાં એમની નામના થાય છે. આ નામનાથી કંજુસ માણસો અકૃપાય છે કારણ કે તેવી નામના મેળવવા માટે વધુને વધુ ધન આપવું પડે છે. જ્યારે સમર્થ સજજન માણસ ફક્ત નામનાથી આનંદ પામતો નથી પરંતુ નામનાના કારણે લોકોને સહાય કરવાનો મોકા વધારે મેળવે છે તેથી નામનાને એમાં કારણરૂપ જોઈને ઉપકારની વૃદ્ધિના કારણે આનંદિત થાય છે.

સજજન માણસો પોતાના મીઠા અને સહાનુભૂતિવાળા વ્યવહારથી લોકોને હારે છે. સજજનતાથી એમની નિકટમાં આવવા લોકો ઈંચે, પછી વ્યવહારથી મન હારે, તે પછી હદ્ય ખોલે, મુંજવણા, જરૂરિયાત, સહાય વગેરે જફ્ફાવે ત્યારે ગંભીરતાપૂર્વક સર્વ પ્રયત્નથી યથાશક્ય અધિક કે સંપૂર્ણ મુંજવણા વગેરેને દુર કરાય તે ઉપકારનું કણ છે.

સજજન પોતે જે કાંઈ પરોપકાર કરે તે કોઈને પણ કહે નહિ. કારણ કે એ એક નયથી બીજા પર ઉપકાર છે તો બીજા નયથી પર એટલે શ્રેષ્ઠ ઉપકાર. ઉપકાર કરનારને પોતાના ઉપર પણ ઉપકાર થાય છે. જેના ઉપર ઉપકાર કરાય છે તે ઉપકાર કરનારને સમર્પિત થાય છે, આશાંકિત થાય છે. તેથી એનું પુણ્ય, યોગ્યતા વધે છે. તેથી ઉપકાર કરનાર બાબુ ઉપકારથી પ્રારંભ કરીને આચાતિક ગુણોને યોગ્ય બનાવવાનો પણ ઉપકાર કરે છે. આથી દ્રવ્ય ઉપકારથી નારંભ થાય છે અને ભાવ ઉપકારરૂપે મોકા સુધી પહોંચાયાય છે. અહીં નિસ્વાર્થ ઉપકાર પ્રયત્નતથા લેવાનો છે.

જેટલા પ્રકારે ઉપકાર છે એટલા પ્રકારે અપકાર પણ છે. આચારભાઈ કરવા, શ્રદ્ધાભાઈ કરવા, ગુણભાઈ કરવા, આદરમાં-વિનયમાં-ભક્તિમાં અંતરાય કરવા, ભાવ તોડી પાડવા, ગુણની પ્રયંત્યાને બદલે નિંદા, દોષની પ્રશંસા વગેરેથી

અસજજનો અપકાર કરતા રહે છે. અપકાર એ દુર્જનતાનું ચિલન છે. બીજાની નિદા, તિરસ્કાર, ઈર્ધ્યા વગેરે સજજનો કરતા નથી, બીજાને દુઃખ થાય તેવું પણ કરતા નથી.

ઉપકાર આપવાથી જ થાય છે તેવું નથી. કેટલીક વાર લઈ લેવાથી પણ ઉપકાર થાય છે. જેમ કે નાનું ભાળક ચાકુથી રમે છે તો તેની પાસેથી તે સમજાવીને, ધમકાવીને, રડાવીને, ફોસલાવીને લઈ લેવું તે પરોપકાર છે. એ રીતે અનુચ્ચિત-નુકશાનકારક માંગે તો ન આપવું તે પરોપકાર છે.

જે રીતે જીવ મરણ વગેરે આગાંતુક દુઃખના સંયોગથી મુક્ત બને તે રીતે તે માર્ગ એને પ્રવર્તાવવો તે પણ પરોપકાર છે.

પરોપકારના અનેક પ્રકાર છે- અભયદાન એટલે મરણની પરિસ્થિતિમાં મરણથી બચાવવા, રોગની પરિસ્થિતિમાં રોગમુક્ત થવાના કારણો બતાવવા-આપવા, રોગમુક્તિ કરાવવી, દીર્ઘાય- દરિદ્ર- અપયશ- અનાદેય વગેરેમાં પીડાતાને તેમાંથી છુટવા માટેના ઉપયોગી સલાહ આપવી, સહાય કરવી, જીવન વ્યવહારની કુશળતા સામગ્રી-હિસ્ત વગેરે આપવી, બાળ વ્યવહારિક નિર્ધંદ અનર્થંડના પાપોથી અટકાવવા, એની ભયંકરતા અને નુકશાનો બતાવવા- સમજાવવા અને તેથી પાપ ન બાંધે તે બાબ પરોપકાર થયો. ગુજરાતીની ભક્તિ- આદર- પ્રસંગા- સુપાત્રદાન-ઉપબૂંહકા વગેરે શીખવાડવા-કરાવવા, એની મહત્વા વસાવવી- એ પરોપકાર ભાવપરોપકાર હેવાય.

દ્રવ્ય પરોપકાર અલ્યકાલીન-અનૈકાંતિક છે, જ્યારે ભાવપરોપકાર એ સ્વને અને પરને સંસારથી છોડાવનાર, મોકષ સુધી પહોંચાડનાર છે.

કાલસૌરિકના પુત્ર સુલસે અભયકુમાર પાસે બાપુને શાંતિના ઉપાયની માંગથી કરી. અભયકુમારે ઉપાય બતાવ્યો અને દુર્ઘનું કારણ બતાવ્યું, તેથી તે મહાપાપથી છુટ્યો. આ રીતે વિવેકદાસ્તિ-જ્ઞાનદાસ્તિ ખોલવી તે મહાન પરોપકાર છે.

સજજનો દ્રવ્યપરોપકાર અને ભાવપરોપકાર બનો કરે છે.

### -: સુશીલતા :-

“શીલ” શબ્દ સ્વભાવ અને આચારમાં વપરાય છે.

સારા આચારો અને સારો સ્વભાવ માણસની સજજનતા કે ફુર્જનતા તેના આચારથી જણાઈ આવે છે. સ્વભાવથી આચાર આવે છે. આચારથી સ્વભાવ જણાય છે. સારા ઉચ્ચિત આચારોથી સ્વભાવ સારો જણાય છે. તેથી માણસની સુશીલતા અને સજજનતા જણાય છે.

જેમ અક્કડ સ્વભાવવાળો, અહંતાના સ્વભાવ વાળો, વડિલોની સાથે પક્ષ અક્કડતાથી અને પોતાની મહના પ્રકાશિત કરતો વર્તે તેમ વિનયના અને નાતાના સ્વભાવવાળા જીવો બીજા સજજનો જોડે તેમનું ગૌરવ સાચવીને અને સલુકાઈથી વર્તે. નાના માણસો સાથે પક્ષ એમની પ્રસતતા વધે એ રીતે વ્યવહાર કરે. અક્કડતા તો સજજન માણસમાં ક્યાંય ન દેખાય, સજજનને તીવ્ર કોષ આવે નહીં, કોષના પ્રસંગને એ ગળી જાય, સહી લે, ક્રમાના સ્વભાવથી સજજનતા દેખાય, પરંતુ જેને નાની નાની વાતોમાં ઓછું આવે, અફાગમો થાય, જેમ તેમ બોલી વ્યવહાર બગાડે તો સમજવું કે સ્વભાવ સારો નથી.

સ્વભાવ સારો ના હોય તો આચાર સારો રહે જ નહીં. સરળ સ્વભાવવાળાને કાંઈ પક્ષ પૂછીએ તો સીધો સરળ અને સાચો જવાબ આપે, સરળતાથી વર્તે. તેના વ્યવહારમાં સાદાઈ અને વચનમાં સરળતા જણાય, તે ધીરજવાળો હોય, ઉતાવળીયું પગલું ન બરે, ફળના લાભ નુકસાનનો વિચાર કરે.

એવી જ રીતે જે ગંભીર હોય તે બીજાને ટોણો ના મારે, બીજાના દોષો જ્યાં ત્યાં, જ્યારે ત્યારે બોલે નહીં. ધીરતા પછી ગંભીરતા આવે છે, સજજન માણસોમાં આ સ્વભાવની અનિવાર્યતા છે. જેમ જેમ સ્વભાવ ગુણસંપત્ત બને તેમ સજજનતા સુદૃઢ વિકસિત બને. જેમ જેમ સ્વભાવ સુધરે, ગુણસંપત્ત બને તેમ તેમ આચાર સુધરે. આ સજજન બનવાનો રસ્તો છે.

જે જે આત્મસાધકોમાં આચાર દફતા હોય છે, આચારસુસ્થિતતા હોય છે તેમનો સારો સ્વભાવ થાય છે અને સજજનતા પરિપક્વ બને છે, નીચુણમાં પક્ષ જો આચાર વિચાર સુધરે તો કાળક્રમે મનુષ્ય સજજન બને છે. સારા

આચારવિચારવાળો બને છે અને ઉચ્ચકુળવાળો મનુષ્ય જો આચારહીન તથા વિચારહીન બને તો સજજનતા ખોઈ બેસે છે.

ઉચ્ચકુળ એ સજજનતાની પારિલાખિક સંશો છે.

સુશીલતા એ વાસ્તવિક સજજનતા છે માટે જ દેશવિરતિવાળા મનુષ્યને નીચે ગોત્ર કર્મ ઉદ્ઘયમાંથી ભસી જાય છે.

દેશવિરતિનો ભાવ જેનામાં પ્રગટે તેનામાં સારો સ્વભાવ અને સારા આચાર આવે, તેથી નીચગોત્ર કર્મના સ્થાને ઉચ્ચગોત્ર કર્મ ઉદ્ઘયમાં આવે, માટે મન મારીને પક્ષ સારા આચારો પક્ષી રાખવા અને સારો સ્વભાવ ધડવો.

સજજનતા પ્રગટાવવા અને દુર્જનતાનો નાશ કરવા પ્રયત્નશીલ બનો. સારા સ્વભાવમાં વિનય, નમૃતા, સરળતા, ધીરજ, ગંભીરતા, પ્રસમતા, સહિષ્ણુતા, ઉદારતા વગેરેનો સમાવેશ થાય છે.

આવા સ્વભાવને બડનારો જે આચારો હોય તે આચરવા, અને આ સ્વભાવને અવરોધે તેવા આચારો છોડવા, જેમ નથમારે જંગલમાં જમવાના સમયે અતિથિની તપાસ કરવાનો વિચાર કર્યો અને શોધવા નીકળ્યો એ સારા સ્વભાવની નિશાની હતી. જમ્યા પહેલા બીજાને જમાડવા, અતિથિપૂજાનો વિચાર કરવો અનું નામ સુશીલતા.

સરળ જીવો સારા સ્વભાવના યોગે સત્યપુરુષોના સંપર્કમાં આવે છે અને આકર્ષિત થયેલા, સંતુષ્ટ થયેલા તે જીવો સજજનતાના માર્ગદર્શન મુજબ આગળ વધે છે.

સારો સ્વભાવ એ પુષ્પનું અને ધર્મ બીજાધાનનું કારણ છે. ભાવ ધર્મ સજજનતાની ઉપરની ભૂમિકા પર હોય છે તેથી ધર્મી આત્મા સુશીલ અને સારા સ્વભાવવાળો જ જોઈએ, એ ન હોય તો તેને આધ્યાત્મિક માર્ગ આગળ વધતા અનેક વિશેષો આવે છે અને કાળકેપ થાય છે. માટે શરૂઆતમાં મન મારીને પક્ષ અને પદ્ધી ભાવપૂર્વક પક્ષ સારા આચારો સેવવા.

### :- શાર્જય ગુણ :-

સજજન માણસો સર્વત્ર વિશ્વસનીય હોય છે. એ વિશ્વસુપદ્ધું આર્જવપદ્ધાથી આવે છે. માયાવી અવિશ્વાસ તીવ્રો થાય છે અને વિશ્વાસ નાશ પામે છે. બીજાને છેતરવા તેનું નામ માયા. બીજાના લાભમાં અંતરાય કરવો, સારી વસ્તુ કહીને હલકી આપવી, ખોટું સમજાવવું, ખોટો પ્રચાર કરવો તેનું નામ માયા. જ્યારે સામાને ખબર પડે કે માણસ ખોટો છે. ત્યારે તેના ઉપરથી આસ્થા તૂટે. બાબુ આડંબરથી ભોળા, મૂર્ખ, લોભી કે ઉપલદ્ધ જોનારા ઉપર થોડા સમય પુરતી સારી છાપ પારી શકાય, પરંતુ વાસ્તવિકતાની ઉભ્યત કાયમી-સર્વત્ર હોય છે. સજજનતા એ સર્વત્ર અને કાયમી સર્વત્રમુખી ગુણ છે એનાથી એમના સંપર્કમાં આવનારાને પ્રેમ મળે, વાતસલ્ય મળે, આદર મળે, વિશ્વાસ મળે- ઔરિત્યપુકૃત માન મળે, સારી-સાચી સલાહ મળે, શક્ય સહાય મળે, ગુણની દિશા મળે, દોષો અને એના કારણોથી નિવૃત્તિની પ્રેરણા મળે-આ જેમ સજજનતાના કારણો બીજાને લાભ થાય છે, તેમ જીતે પણ બધી પ્રવૃત્તિ-વિચારણામાં પાપબંધનો ઘટાડો, પુષ્ટયનો બંધ, ગુણની વૃદ્ધિ અને કમશા: અધ્યાત્મની વૃદ્ધિ થાય છે. સજજનના સંપર્કથી બીજા સજજન બને છે.

આર્જવ, ગાંભીર્ય અને સૂક્ષ્મબુદ્ધિ-કુશાગ્રબુદ્ધિના યોગથી બીજાઓ વિશ્વાસ મુકે, પોતાના સુખ દુઃખની વાતો જ્ઞાનાં અને મુંજવજના ઉકેલ પુછે. ભાવધર્માં આર્જવસંપત્ત જ હોય છે. જે માયાસંપત્ત બને છે તે ભાવધર્મથી અભ્ય થાય છે. એનામાં ધર્મની વિશિષ્ટ યોગ્યતા નાશ પામે છે અથવા પ્રગટ થતી નથી. આવી માયા છોડી સરળ બનવું જોઈએ.

સરળતા અટલે બીજાની વાતને સીધારુપે લેવી, આપણે પણ બીજાની જોડ સીધો, આંટીધુંટી વિનાનો, સ્પર્શ વ્યવહાર કરવો. માયાવી માણસ બીજા જોડ સાહંજિક, મળતાવડો વ્યવહાર રાખી શકતો નથી. જનાવટી આગંતુક સારો મળતાવડો રખાતો વ્યવહાર ભાડુતી આભરણ જેવો શોભારૂપ નથી, માયારહિત માણસ બધે જ સહદ્યપદો સારો વ્યવહાર કરે છે. માયાવી બધે શંકિત હોય છે. સરળ બધે નિઃશંકિત હોય છે. સરળ બધા ઉપર વિશ્વાસ રાખે છે અને સરળ

માણસ ઉપર બધા વિશ્વાસ રાખે છે. માયાવી ઉપર કોઈ વિશ્વાસ રાખતું નથી.

સામાન્યપક્ષો બધે સરળ રીતે વર્તવું-સરળતાના કારણે પુણ્ય વધે છે, ગુણો વિકસિત થાય છે, સરળ માણસ જોડે બધા વ્યવહાર ઈંચ્છે, સંકોચ વગર કરે, સામેથી કરે. સરળ માણસ આવકાર્ય બને છે. જેમ માયા સંસારની- કર્મની- મોહની માતા છે તેમ સરળતા ધર્મની, ગુણની, પુણ્યની જનેતા છે. શુદ્ધિ અને ધર્મ સરળતામાં રહે છે. સજજન એટલે બીજાઓને જેની જોડે વ્યવહાર કરવાનું, સંબંધ રાખવાનું, લેવહદેવડ કરવાનું, સાથે રહેવાનું ગમે. આ ક્યારે બને? સજજન માણસ બીજાની જોડે મીઠાશાલી વર્તે, સહાયક બને, સારો-ઔરીચિત્તયુક્ત વ્યવહાર રાખે, સરળતાથી વિશ્વાસ મેળવે તો બીજા તેની સાથે સંબંધ રાખે-વધારે. અર્થાત્, મીઠાશ વ્યવહાર જોડવામાં કારણ છે, કડવાશ વ્યવહાર તોડવામાં કારણ છે. સહાયકતા સંબંધ જોડે છે, સહાયકતાના બદલે સ્વાર્થીપણું વ્યવહાર ઘટાડે છે. ઔરીચિત્ત વગરે સદાચાર વ્યવહાર વધારે છે. અનૌચિત્ત વગરે વ્યવહાર તોડે છે. તે જ રીતે સરળતા વ્યવહાર વધારે છે, માયાવીપણું, વ્યવહાર તોડાવે છે. એટલે કે સજજનતાના ગુણો બીજાને બાબુ લાભકર્તા થાય છે. એના દ્વારા એ પોતાના સ્વજન જેવા થઈ પોતાને પણ લાભ કરે છે. પછી સજજનના સંપર્કને કારણે સજજનની ઈચ્છા મુજબ અને કદ્વા મુજબ વર્તતા એ છુંબો પણ સજજન અને ગુણી બને છે. સરળ આત્મા બીજાની માયા જાણી શકે છે, છતાં એ "Let Go" કરે, અવસરે સમજાવે અને માયા છોડાવે. માયાવી બીજા માયાવીના સંપર્કમાં પોતાના દોષથી છુટતો નથી. પરંતુ ક્યારેક વધારે દોષવાળો થાય છે. અને એથી વિપરીત સરળના સંપર્કમાં માયાવી આવે તો જો જાધ્ય દોષવાળો હોય તો માયાવી પોતાનો દોષ સમજી માયા ઘટાડે, છોડે.

સજજન એટલે ગુણી. એના સંપર્કમાં આવનાર પોતાના દોષને દોષરૂપે જુઓ છે, જાણે છે, ઘટાડે છે, છોડે છે. સરળના સંપર્કમાં માયાવી સરળ બને. સરળતા વગરના બધા ગુણો ગુણાભાસ છે. અર્થાત્ સરળતા ગુણાની માતા છે. સરળ જ સજજન બની શકે, સજજન સરળ જ હોય.

### -: પ્રિય આલપન :-

સજજનપણાનું પાંચમું લક્ષ્ય પ્રિય આલપન છે.

સજજન માણસ સ્વભાવથી શાન્ત અને સ્વસ્થ હોય છે. શાંતિ અને સ્વસ્થતાના કારણો દર્ઢિમાં સ્નિગ્ધતા અને વાણીમાં મીઠાશ હોય છે.

સજજન માણસને ક્યારેક જરૂરી અશાંતતા બનાવી લાવવી પડે છે. એ રીતે ક્યારેક અસ્વસ્થતા આવે, પણ તે ટકે નહિં.

બીજા છોંગો સાથેના વ્યવહારમાં દર્ઢિ અને વાણી મુખ્ય ભાગ બજાવે છે. અહીં પ્રિયવાણીના ઉપલક્ષ્યથી સ્નિગ્ધ દર્ઢિ પણ લેવી, પ્રિય એ વાણીનું વિશેષજ્ઞ છે. આલપન એટલે બોલવું, બોલનારને જે ગમે તે પ્રિય આલપન એવો અન્વય ન કરવો, પણ સાંભળનારને-જેને ઉદ્દેશીને બોલાય છે તેને જે વાણી પ્રિય થાય તે પ્રિય આલપન કહેવાય, એવો અન્વય કરવો.

પ્રિયપણું બે પ્રકારે છે. (૧) વ્યવહારમાં સર્વને જે શરીરો જે પદ્ધતિ ગમે તે વ્યવહારિક પ્રિય કહેવાય અને (૨) વ્યક્તિગત જેને જે શીતભાત પ્રિય હોય તે વ્યક્તિપ્રિય કહેવાય. પ્રસ્તુતમાં મુખ્યત્વાં પ્રથમ વાત લેવી પણ બીજી વાત પણ જો લોકનિંદ્ય કે અનુચ્છિત ન હોય તો તે પણ લેવી.

વાતચીતમાં તોછડાઈ ભરેલા શરીરો ન હોય, નામના આમન્ત્રણપૂર્વક બોલાવાય, વાતચીતમાં સામાને ગમતી વાતો કરાય તે પ્રિય આલપન કહેવાય અને સામાને અશોગમતી વાતો કરે-કાઢે તે અપ્રિય આલપન થાય. ગમતી વાતો એટલે ગમતી વ્યક્તિ-ગમતી વસ્તુ- ગમતી વ્યવહારની વાતો. દાખલા તરીકે આરોગ્યની વાત, પરિવારની સુખાકારિતાની-ઉનાતિની વાત, શોખીન માણસોને તે તે શોખની ચીજો વગેરેની વાતો, આરાધકની સાથે આરાધનાની-આત્મકલ્યાણની વાતો.

આ પ્રિય વસ્તુ વગેરે પ્રિય ભાષામાં પુછવાથી, જાવાવાથી સામી વ્યક્તિ આપણને અનુદૂળ થાય છે. એના મનમાં આ રીતે બોલાવનાર પ્રત્યે આદર પ્રેમ ઉત્પન્ન થાય છે. સ્નિગ્ધ દર્ઢિ અને પ્રિય આલપનથી- (૧) આપણા મનમાં સામી વ્યક્તિ પ્રત્યે જુના કલેશ હોય તો ક્ષાસ થાય છે, નાશ પામે છે. એનો

નાશ થયા વગર કે નાશ કરવા માટેના નિર્ણય વગર દ્વારાં સ્વાત્માવિક સ્નિગ્ધતા કે વાણીમાં મીઠાશ આવતી નથી. ક્ષારેક સ્વાર્થ પુરતી બનાવવી આવી શકે, જેની કોઈ ઉભ્યત નથી. (૨) સામાના ફદ્યમાં પણ આપણા પ્રત્યેના જે કલેશ-દ્રોષ હોય તે પણ પ્રિય વચનના વ્યવહારથી નાશ પામે છે. (૩) નવા વૈરો ઊભા થતા નથી. કઠોર વાણી અને એરીલી દ્વારા કે અસભ્ય વર્તનથી જ નવા વૈરો ઊભા થાય છે. માટે સજજન માણસ સામી વ્યક્તિ કઠોર વાણી વળેનો પ્રયોગ કરે ત્યારે પણ પોતાની સજજનતા ટકાવવા વેરાનુંખથી પોતાને નુકશાન ન થાય અને પોતાના નિમિત્તે બીજાને નુકશાન ન થાય તે માટે પણ સામે કઠોરવાણીનો પ્રયોગ કરતા નથી. (૪) જેની સાથે વ્યવહાર હોય તેની સાથે બોલવાનું થાય. આ મવૃત્તિ વ્યવહાર અને વાણી વ્યવહાર સમયે જો પ્રિયવચન હોઈ તો તેના ફદ્યમાં સ્નિગ્ધતા પ્રેમ-વાતસલ્ય ઊભા થાય.

જેવી રીતે વરસાદના પાણીમાં ઠંડક છે, મીઠાશ છે તેથી તે જે જમીનમાં જાય છે તે જમીન પણ ઠંડી થાય છે, સ્નિગ્ધ બને છે. જૂની રૂક્ષતા અને ખારાશ પોવાઈ જાય છે, મૂત્ર વળેરેમાં ઉછાતા-ખારાશ-રૂક્ષતા છે અને તેની વિપરીત અસર જમીન પર થાય છે તેમ રૂક્ષ, કટુ, અસભ્ય, અભિય વચનવ્યવહારમાં ઉછાતા-ખારાશ-રૂક્ષતા છે તે પ્રિય વાણી દ્વારા પોવાઈને નાશ પામે છે. આપણા ફદ્યમાં ઠંડક-સ્નિગ્ધતા-મધુરતા જન્મે છે અને તે જ ગુણો આપણા પ્રત્યે સામાને જન્મે છે.

જેમ જમીનમાં પાણીથી પેદા થયેલ ઠંડક વળેરે ત્રણ ગુણથી વૃક્ષ-ધારસ-અનાજ-વનસ્પતિઓની ઉત્પત્તિ થાય છે, અનેક પ્રકારના જીવો રહેણાશ કરે છે, તેવી રીતે પ્રિય વચનવ્યવહારથી જેના ફદ્યમાં સ્નિગ્ધતા, મધુરતા અને ઠંડક સારા પ્રમાણમાં વિકસિત થાય છે તેના ફદ્યમાં દોષો નાશ પામે છે, ગુણો અને સદાચારો ઉત્પન્ન થાય છે. શક્તિ-સંયોગ અનુસાર અનેક જીવોને બાહ્ય-અત્યંતર આશ્રય આપનાર બને છે.

મીઠી વાણીથી પરસ્પરના ફદ્યમાં મીઠાશ રહેવાથી વ્યવહારિક સારા સંબંધો જોડાય છે. પછી સંસારી આત્મા સ્નોહ બળથી અર્થવ્યવહારના કે પરિવારના

સંબંધોથી પણ પરસ્પર જોડાય છે અને એક બીજાના પુરક બને છે.

એવી જ રીતે ધર્મી આત્મા ગુણવાન મહાપુરુષો સાથેના સ્નેહ સંબંધ દ્વારા સદાચાર પ્રવર્તન, અસદાચારત્યાગ, ગુણાભ્યાસ, દોષોનો ત્યાગ કે હ્રાસ, શાનાભ્યાસ, આંતરિક કલેશની છાનિ, વિશુદ્ધિની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે અને આવો સ્નેહસંબંધ પ્રિય વચનથી ઉત્પત્ત થાય છે.

ઉપરની ભૂમિકાવાળા પ્રિયવચનના વ્યવહારનું લક્ષ શરેખે તો નીચેની ભૂમિકાવાળા સ્નેહ દ્વારા ઉપરની ભૂમિકાવાળાના સંપર્કમાં રહીને ઊચા આવે છે એટલે કે ગુણને પોગ્ય બને છે, એમની દાઢિ ખૂલે છે, આચારસંપત્ત બને છે, સહજ રીતે પોતે પણ પ્રિય વચનવ્યવહારવાળા થાય છે. આ રીતે પ્રિય વચન દ્વારા બીજાનામાં સજજનતા જન્મે છે અને ગુણી જનનો વધારો થાય છે.

આથી વિપરીત ઉપરના જીવો કઠોરભાષી થાય તો નીચેના જીવો એમના વિરોધી બને છે, એમના ઉપર વિશ્વાસ રહિત બને છે, એમનાથી પરાન્યુભ બને છે, ગુણની યોગ્યતા પણ છોડી દે છે અને દોષની પકડવાળા થાય.

પ્રિય વચનથી વ્યવહાર કરતા કરતા સામાના આત્માને તેનામાં રહેલા દોષો બતાવવા, તેના નુકશાન બતાવવા, ગુણોના લાભ અને પ્રાપ્તિના ઉપાયો બતાવવા.

અહીં સમજવાનું કે સજજનોને કઠોર વચન બોલતા નથી આવડતું એવું નથી, તેઓ કઠોર ન જ બોલે તેવું પણ નથી. પરંતુ પ્રિય ભાષાથી જ્યારે કામ ન પતે તેવા કઠોર, નિર્લજ્જ કે દાંડ જીવો સાથે કારણવશાતું કાર્ય કરવાનું આવે તો સારકા- વારકા એ બે મીઠી ભાષામાં કર્યા બાદ કઠોરભાષામાં નોદના અને પ્રતિનોદના પણ શાલોકત વિષિ મુજબ કરે.

લોક વ્યવહારમાં પણ સામ અને દામ આ બે મીઠા વ્યવહારથી કામ ન પતે તો દંડરૂપ કઠોર વ્યવહાર કરવાનો બતાવ્યો છે. માટે સજજનો ગુણાધ્યાન કરે તેવી ભાષા જ બોલે. પ્રિયભાષા એ ગુણ કરવામાં પ્રધાન કારણ છે. માટે બધાએ બધાની સાથે સજજન બની શક્ય પરિસ્થિતિમાં પ્રિયભાષા અને પ્રિય વ્યવહાર કરવો.

ધર્મરાત્રાંકરણમાં ધર્મયોગ્યતાના ૨૧ ગુણોમાં પણ આ ગુણ બતાવ્યો છે.

## વિશેષ સ્વરૂપ ત્યાંથી જોવું.

ત્રિપૃષ્ઠ વાસુદેવ વર્ખતે તેના સારથીએ સિંહને જે મીઠાગણી આચાસન આપ્યું કે “તું પણ સિંહ છે તો તને મારનાર નર સિંહ છે. તું જેના તેના છાયે નથી મરાશો.” આ વચન પણ મીઠા લાગ્યા અને સ્નેહની લાગણી થઈ તે ગૌતમસ્વામીના ભવમાં ઘેડુતને સમ્યક્તવ પમાડવામાં કારણભૂત થઈ. માટે પ્રિય બોલવું તે સજજનો માટે પુષ્ય, ધર્મ, ગુણ વાવેતરનું કારણ બને છે. દુર્જનો સ્વાભાવિકપણે પ્રિય બોલનાર હોતા નથી, સ્વાર્થના કારણે જે પ્રિય તેઓ બોલે છે તે મોહ-પાપ-અધર્મ અને દોષપોષકનું કારણ છે. માટે ઉદેશશુદ્ધ અને ગુણવૃદ્ધિસ્વરૂપ સજજનતા કેળવવી અને એના માટે પ્રિય આલપન ગુણ કેળવવો.

### - : દાખિણ્ય :-

દાખિણ્ય એટલે અન્યની વિનંતિને- ઈચ્છાને સ્વીકારવી...

દાખિણ્યના કારણે બીજાના કાર્યને પ્રયાનતા આપે છે અને એને પ્રાય: પ્રથમ કરે છે, પરંતુ સામેની વ્યક્તિ માંગણી કે સૂચન કરે તો પોતાના કાર્યને ગૌણ કરીને, જતું કરીને પણ બીજાના કાર્યને પ્રથમ કરે. આનો અર્થ એ થયો કે બીજાના કાર્યને પ્રથમ મહત્તમ આપનાર બીજાની પ્રાર્થના-વિનંતિ-માંગણી કે જે લોકનિદ્ય નથી, પોતાનાથી થઈ શકે તેમ છે તેને સ્વીકારે, કરી આપે, નિષ્ફળ ન કરે. આવા માણસ ઉપર બધાને પ્રેમ જાગે, આદર થાય.

જગતમાં જીવ મોહને-સ્વાર્થને વશ હોય છે તેથી બીજા કરતાં પોતાની મહત્તમ જુઓ છે, બીજાના કાર્ય કરતાં પોતાના કાર્યની મહત્તમ જુઓ છે, બીજાની ઈચ્છા કરતાં પોતાની ઈચ્છાને મુખ્ય કરે છે. જ્યારે જીવ વિવેકી, ગુણી બનવાને યોગ્ય બને છે ત્યારે બીજાની મહત્તમામાં પોતાની મહત્તમ-મહાનતા જુઓ છે, બીજાની ગૌણતા-ઉપેક્ષામાં પોતાની જ ગૌણતા જુઓ છે, બીજાના કાર્યને પોતાનું કાર્ય જુઓ છે, બીજાના કાર્યની ઉપેક્ષામાં પોતાના જ પુન્ય-ગુણ-ભાવરૂપ કાર્યની ઉપેક્ષા દેખાય છે. પોતે ઈચ્છારહિત બની કે પોતાની ઈચ્છાને અપ્રયાન સમજીને બીજાની ઈચ્છાને મુખ્ય બનાવે છે. આના કારણે સજજન-ગુણી-ધર્માત્મા બીજાના કાર્યોમાં ક્યારેય વિના કરતો નથી. પોતાનાથી સહજપણે થાય કે બીજા દ્વારા

કરાવતું હોય તો તે સહેલાઈથી કરી જ આપે, પરંતુ ક્યારેક બીજાનું કાર્ય કરવામાં પોતાનું કાર્ય અટકતું હોય તો પોતાનું છોડીને બીજાનું કાર્ય કરવા પ્રેરાય છે. વિશ્વભૂતિએ કાકાના કાર્ય માટે પોતાની કીડાનું કાર્ય છોડી દીધું, અને યુદ્ધ કરવા ગયા. આમાં વિનય-મર્યાદા અને દાખિષ્ય કામ કરતા હતા. પુંડરીકની સંઘમની ભાવના છતાં કંડરીકના આગ્રહથી તેને દીક્ષા લેવા દીધી અને પોતે રાજ્યધૂરા સંભાળી. આ પક્ષ પુંડરીકનું દાખિષ્ય હતું, બે જગ્યાની હરિફાઈમાં સામાની મર્યાદા આવી જાય, પછી પોતે પક્કડ રાજ્યા વિના સમાપ્તાન કરી લે, ખમાતી હે, તેને લાભ અપાવે-એ પક્ષ દાખિષ્ય છે. તે પોતાની લિધતિ પહોંચ્યા છતાં પોતાની ભાવના ન હોય તેથી અમૃક મર્યાદાથી આગળ ન વખતો હોવા છતાં કોઈના આગ્રહથી એનું માન સાચવવા પક્ષ બોલી બોલે તે પક્ષ દાખિષ્ય છે.

દાખિષ્યતાના કારણે બીજાનું મન તોડી ન શકે તડકન કરી શકે, પડ દઈને નાન પાડી શકે, બીજાને નુકશાન તો ન પહોંચાડે, પક્ષ બીજાને નુકશાન થાય તેવા વિચારને પક્ષ ન કરે. દાખિષ્ય એ સ્વાર્થાધીતાનો નાશ થવાથી આવે છે. દાખિષ્યવાન સ્વાર્થનિ ક્યારેય પ્રધાન કરી શકતો નથી. સ્વાર્થના કારણે બીજાના લાભમાં કે કાર્યમાં અંતરાય કરતો નથી. ચરમાવર્તમાં આ ગુજરા વાસ્તવિકપણે આવે છે.

દાખિષ્યતાના કારણે શુલ્કમુનિએ છત્રીસ વર્ષ આચાર્ય, ઉપાધ્યાય અને માતાના આગ્રહથી દીક્ષા પાળી. દાખિષ્યતાના કારણે અરણીક મુનિએ માના કહેવાથી કરી દીક્ષા દીધી. આમ દાખિષ્ય અકાર્ય છોડાવી સત્કાર્યમાં પ્રવૃત્તિ કરાવે, દુર્વિચન છોડાવી સદ્વિચનમાં પ્રવૃત્ત કરાવે, દુષ્ટવિચાર છોડાવી સદ્વિચારને વેગ આપે.)

(અનાદિકાલીન જીવની પ્રવૃત્તિ એ વામાવર્ત જેવી છે, એટલે કે મોહને-અવિષેકને આધીન, આત્મગુણોથી ઉલ્લટી માન્યતાવાળી પ્રવૃત્તિ હોય છે, જ્યારે ચરમાવર્તમાં જીવને કર્મનો કંઈક ઉથાડ થવાથી મોક્ષને અનુકૂળ સીધી પ્રવૃત્તિ થાય છે. આ સીધી પ્રવૃત્તિ એટલે જ દાખિષ્ય...)

આ ગુણવાળા પોતાના કાર્ય વખતે પણ સ્વાર્થીપ બની શકતા નથી. દાખિષ્યવાળા માણસને, બીજાના કયા કાર્યને કરવું, કયું ન કરવું-એવો કોઈ આગ્રહ કે પણપાત હોતો નથી તેથી તેને બધા કાર્યે કરવાની તૈયારી હોય છે. માટે બ્ધી જતના કલ્યોપશમ થાય છે. પોતાના દરેક કાર્યને ગૌણ કરવાની તૈયારી છે તેથી દરેક કાર્યના વિશ્વ વિલીન થાય છે, દરેક અંતરાય નૂઠે છે. માટે દાખિષ્યથી પોતાનું કાર્ય-પરિણામ વધે છે, પોતે સર્વ રીતે આગળ વધે છે.

પ્રિય આલપન વાચિક વ્યવહાર પૂર્ણ છે, પરોપકાર સામાને જરૂરી મદદ કરવારૂપ સહાયક થબારૂપ છે, જ્યારે દાખિષ્યમાં પોતાની ઈચ્છા-કાર્ય-જતને ગૌણ કરવાપૂર્વક સામાની ઈચ્છા-કાર્યને મહત્વ આપવા રૂપ છે. તેથી પોતાનો મોહ ઘટે છે, સર્વાંગીના શુભમવૃત્તિ અને ગુણો આવે છે.

સજજનો બીજાના કાર્યને, ગૌરવને, પ્રસંગતાને વધારવા જ જીવે છે અને એને જ પોતાનું કાર્ય-ગૌરવ માને છે અને પોતાની પ્રસંગતા પણ એમાં જ ખીલે છે. માટે બીજાની પ્રાર્થના અને કાર્યમાં લક્ષ આપનાર સાચા સમાજસેવક બને છે. બીજા સમાજસેવકના નામે માત્ર માન મેળવે છે, દંબ કરે છે.

તેથી સજજનતા મેળવવા ઈચ્છનારે આ ગુણ અવસ્થા ખીલવવો જોઈએ.

#### **-:: વિનય ::-**

વિનય એટલે અભિમાનથી વિપરીત આત્માના પરિણામ, નાત્રતાની અવસ્થા જેનાથી સુધિત થાય તે પણ વિનય. કોઈ શાતા પુછે ત્યારે જવાબમાં હા, બહુ મજા વગેરે જવાબ આપે તેમાં પુષ્પની, આવડતની, પરિસ્થિતિની હુંક છે, એનાથી પોતાની બડાઈ છે, જ્યારે 'દેવગુરુપસાપ' કહીએ એટલે મહત્ત્વ દેવ-ગુરુની અને પોતાની નાત્રતા છે. જે કાર્યમાં બીજાને યશ આપે તે નાત્રતા વિનય છે.

બીજી વિજિતની કે સમુહની મહત્ત્વ બતાવવી, ગુણ કે ગુણીની મહત્ત્વ બતાવવી, પુષ્પની મહત્ત્વામાં એના આધાર-ઉત્પત્તિસ્થાન દેવ-ગુરુ-સદ્ગુરુચાર વગેરેની અને ધાર્મિક આચારની મહત્ત્વ બતાવવી તે એક પ્રકારનો વિનય છે. આજે પરિવારના નામથી જે કાર્ય કરાય છે તે પણ વડિલો અને બીજાના

સંગ્રહરૂપે વિનય છે. એવી રીતે ૫-૧૦ વ્યક્તિ બેગી થઈ શ્રી સંઘના નામે કરે તે સંઘનો વિનય છે. ગુજરાને અનુકૂળ વર્તવું, ગુજરાના આચારો જાણવા, શ્રદ્ધા કરવી, જીવનમાં ઉત્તારવા-આચરવા, ગુજરાના આચારની પ્રણાંસા કરવી- આ બધા ગુજરાના વિનય કહેવાય. જ્ઞાનાટિ સંપત્તિ ગુજરાની વ્યક્તિને અનુકૂળ વર્તવું, તેનું ગોરવ વધારવું, માન આપવું, સત્કાર કરવો, ઉપબૃહત્તા કરવી, વગેરે ગુજરાના વિનય કહેવાય. આ બધે વિનયના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે ગુજરાને તત્ત્વસંપત્તિ ગુજરાની અપેક્ષાએ બેદ પડે. તે જિવાય લોકોપચાર-લોકવ્યવહારથી જે કરવું જોઈએ તે વ્યક્તિ-અવસ્થા વગેરેને ઉચિતપણે કરવું. ઘરે અજાણ્યો માણસ આવે તો તેને સામાન્ય આવકાર અપાય, સામાન્ય સરબરા કરાય, એંગધીતા આવે તો તેને યોગ્ય રીતે આવકાર અપાય. દરેક વ્યક્તિ સાથે અતડાઈ-તોછડાઈ-વિમુખ-ઉદાસ-ઉપેક્ષિતવૃત્તિ કે પ્રવૃત્તિ વગર ઉચિત રીતે સાનુકૂલપણે પ્રસત્તાપૂર્વક કંઈક પ્રેમણ રીતે વર્તવું. એજ રીતે દરેક પૌદ્યગલિક વસ્તુના પણ સંભાળ-સંરક્ષણ વગેરે કરે તે પણ વિનય છે. તેને ઉપકરણ વિનય કહેવાય. પુસ્તક નીચે ન મૂકવું, કપડા ન ફેંકવા, ફોટા વગેરે યોગ્યસ્થાને મૂકવા, રસોડામાં માત્રાપિતા કે દેવગુરુના ફોટા ન મૂકાય. એ જ રીતે શયનખંડમાં પણ ન મૂકાય. આ પણ વિનય છે.

સજજન માણસ દરેક વ્યક્તિ જોડે એવો વર્તીવ કરે કે જેનાથી એ બધાને ગમે, બધાને એ ગુજરીયલ-વિચારક-સ્નેહાળ-સહાનુભૂતિબ્યાર્થો-સહાયક પોતાનો લાગે એથી બધા એની સાથે એના થઈને વર્તે.

કેટલાક માણસો ધરના માણસ જોડે બચાબર વર્તે પણ બહારના સાથે અક્કડાઈથી વર્તે, કેટલાક એથી વિપરીત વર્તે- બહારના જોડે સારો વ્યવહાર રાખે પણ ધરના જોડે તોછડો વ્યવહાર કરે- આ પણ સજજનતાની ખામી છે. બધે જોડે યથોચિત વ્યવહાર જોઈએ, બધે એક સરખું ન હોય. કંઈ ગળામાં પ્રસંગે પહેરવાની હોય અને હાથમાં ઘરીયાળ ફીટ પહેરવાની હોય બધે જગ્યાએ ઉચિત વ્યવહાર કરવાનો.

જે વ્યવહારથી બીજા પોતાને અનુકૂળ બને, જે વ્યવહાર બીજાના ફદ્યમાં પોતાને પહોંચાડે, જે વ્યવહારથી સ્વ અને પરના દોષો-મોહ-અવિવેક વગેરે નાશ પામે-ધટે, જે વ્યવહાર એટલે આચારથી ગુણો પ્રગટે, અશાન નાશ પામે, સ્વ-પરના આચારમાં વિચારશીલતા અને ઔદ્ઘિત્ય આવે તેને પણ વિનય તરીકે જાણવો.

ભાત્યથી બીજાને કરાતો જે ઔદ્ઘિત્ય વ્યવહાર તેને પણ વિનય તરીકે જાણવો. જે વિનયસંપત્ત બને તે કાલાનારે સજજન બનશે, જે સજજન હોય તે વિનય સંપત્ત જ હોય.

જીવનમાં જે વસ્તુ અને વ્યક્તિ જોડે યોગ્ય રીતે વર્તે તે યોગ્ય દર્ખિકોણથી તે તે વ્યક્તિ વસ્તુનો લાભ મેળવે અને સ્વ-પરને વ્યવહારથી સુખશાંતિકારક બને. માટે વિનય દ્વારા યોગ્ય વર્તન લાવી સજજનતા કેળવવા પ્રયત્ન કરવો.

આ રીતે સજજનતાના જે સાત ગુણો બતાવ્યા છે તેનું રહસ્ય એ છે કે મોઢે જવા માટે લોકોત્તર આચારસંપત્ત બનવું જોઈએ. એટલે કે જૈનધર્મ પામવો જોઈએ, જૈનધર્મ પામવા માટે શ્રી જિનેશ્વરદેવ અને નિર્ગન્ધ ગુરુનું સામિદ્ધ જોઈએ અને જૈનાચારસંપત્ત શ્રી સંધ પણ પામવો જોઈએ. આ ત્રણ દ્વારા લોકોત્તર આચાર પમાય-સમજાય-આરાધાય. આ ત્રણને પામવા માટે પુષ્પ-કષ્પોપથમની જરૂર છે. એ મેળવવા માટે સજજનતાના ગુણો-માર્ગાનુસારીના ગુણો પ્રત્યે રૂચિ અને પાલન જરૂરી છે. તેનાથી જિનધર્મના કોઈપણ અંગની રૂચિ-અનુમોદના પ્રગટે છે.

ઉપરોક્ત રૂચિ-વલણ આવે એટલે જીવ વિકાસ પામવા માર્ગ છે અને કમશા: અનેક આચારો-ગુણોમાં રૂચિ થાય, સમજાય, એના પ્રેરક વગેરે મળે અને પોતે પણ આચાર-ગુણો પાળવાની શરૂઆત કરે. આ જીવ રૂચિ દ્વારા આચારો અને આચાર દ્વારા ગુણો પામે છે. માટે સજજનતાના આચારો-ગુણો-માર્ગાનુસારીના આચારો, ગુણો, ૨૧ ગુણો વગેરે પાયાના આચારો છે, જે આ લોકમાં શાંતિ-સહાનુભૂતિ-સમાપ્તિ દ્વારા લોકોત્તર ગુણોને યોગ્ય બનાવે છે. માટે લૌંગ્રિક

સહાયારો, લોડિક દ્યાદાન, અનુકૂપા, પ્રિયવચન, વિનય વગેરેમાં ઉદ્યમ કરવો જોઈએ. લોકોત્તર માર્ગને પામેલામાં પક્ષ આ ગુણો હોવા જ જોઈએ. આ ગુણો ન હોય તો લોકોત્તર ગુણ પક્ષ કયારેક નાશ પામે છે અથવા શીખ વિકાસ પામતા નથી, પરાકાણાએ પક્ષ નિરાભાષ રીતે જવાતું નથી. ધર્મરત્ન પ્રકરણના ૨૧ ગુણો અને આ સજજનતાના ગુણો અર્થતઃ એકના એક જેવા છે માટે તેમાં કાળજીથી આગળ વધવું, જેથી કમશા: યોગ્યતા વધતાં આચારપાલન અને ગુણવિકાસ દ્વારા સિદ્ધ નિકટ આવે.



## ○ ○ પરમાત્માને ભજો પરમાત્મામાં ભળો ○ ○

અનંતજ્ઞાની પરમાત્માનું શાસન આપકા કદયમાં યાદગીરીનું આવે એટલા માત્રથી આત્મા દુર્ગતિમાં જતો અટકે છે, સદ્ગતિ પામે છે.

જીવ આરાધના કરે ત્યારે તો સદ્ગતિમાં જાય પરંતુ કારણે આરાધના ન કરી શકે તો પણ આ આરાધ્ય છે, પૂજ્ય છે એવી બહુમાનયુક્તભાવના પણ સદ્ગતિમાં લઈ જાય છે.

આરાધનાના ચાર ગ્રંથ બતાવ્યા છે.

(૧) સ્મરણ (૨) શરણ (૩) સમર્પણ (૪) અભેદ

પહેલા નંબરે સ્મરણ નામની આરાધના છે.

સ્મરણ કોનું થાય? જેના ગ્રંથે કાં રાગ હોય, કાં દેખ હોય તેનું વારંવાર સ્મરણ થાય. પરમાત્માના શાસનના આરાધનાના અંગો પર રાગ હોય તો તેનું સ્મરણ થાય અને તેનું સ્મરણ થતાંની સાથે જ પુષ્ટ બંધાય છે, કર્મનિર્જરા ચાલુ થાય છે.

રાગ એટલે પોતે તો આરાધના કરે જ પરંતુ જે આરાધના જતે ન કરી શકતા હોય તે આરાધના બીજાને કરતાં જોઈ કદયમાં આનંદ થાય. તેથી જ કશ્યું કે અક્ષમ કરે તેને તો નિર્જરા થાય પરંતુ અક્ષમવાળાના દર્શન કરતાં જેને હર્ષ થાય તેને પણ નિર્જરા... કારણ કે ત્યાં હર્ષ ત્યારે જ આવે જ્યારે તપમાં ઉપાદેયબુદ્ધિ હોય, 'મારાથી તપ થતો નથી, જે કરે છે તેને ધન્યવાદ છે. મારા પણ અંતરાયો ક્યારે તૂટે...' આ વિચારણા ઉપાદેયતાદિની સૂચક છે. ભગવાનની સ્મરણ આરાધના ઉપાદેય તરીકે આરાધ્ય દેવ તરીકે- ગુણી તરીકેની થાય. આ આરાધના ધર્મની ભૂમિકા છે. આ ઉપાદેયતાની બુદ્ધિ અંતરાયો તોડે છે.

જે આત્માને ઉત્તું કરવાને બદલે અવગતિમાં પટકે તે પાપસ્થાનકો છે. તેની સંખ્યા છે, ૧૮, અને તેની સામે ૧૫ ગ્રંથના ધર્મસ્થાનક બતાવ્યા છે. માણસની અંદર માયા-પ્રલોભન ઉત્પત્ત થતાંની સાથે જ પાપ બંધાય પરંતુ તે વખતે તેની વિરુદ્ધના ધર્મસ્થાનો યાદ આવે તો પુષ્ટ બંધાય. ખાવાની ઈશ્વરી

ધાર્ય તે પાપ બંધાવે પરંતુ ખાતી વખતે તપસ્વી યાદ આવે તો પુષ્ટ્ય બંધાય. કેમ કે તે તપસ્વી યાદ આવતા ખાવાની ઈચ્છા ગૌણ બને છે. તપ ઉપાદેય લાગે છે. સ્નાન કરતી વખતે સાહુ યાદ આવે તો પુષ્ટ્ય બંધાય. પરંતુ ખાતી વખતે ક્યારેય પણાકંઈદી યાદ નથી આવતા. સ્નાન કરતી વખતે સાહુ મ. યાદ નથી આવતા... સંસારની દરેક પ્રવૃત્તિમાં સામાન્ય જીવનું વલશ અને ધર્મ આત્માનું વલશ જૂદું હોય. સાહુ સુવું પડે માટે સુવે પરંતુ સુતી વખતે પક્ષ ઈચ્છા-બુદ્ધિ હોય કે સવારે વહેલા ઉઠિશું. જાપ, પ્રતિક્રિમણ, પરમાત્માના સ્તોત્રપાઠ કરશું. જ્યારે સંસારી આત્માને ધાર્ય કે ‘હાશ! કાંચે રવિવાર છે. વહેલા ઉઠવાનું નથી. શાંતિધી સૂઈ જઈશું. અર્થાતું સંસારીને પ્રમાદના સ્મરણમાં પ્રમોદ છે અને ધર્માત્માને પ્રમાદમાં પક્ષ ધર્મનું સ્મરણ છે.

દેવતા અને નારકી બસે સૂતા નથી છતાં એક સુખી છે અને બીજા ફુલ્ખી છે. ધર્મ ઉદ્ઘાસમાં ન માને ઉદ્ઘા વગર ચાલતું નથી માટે જ સૂવે છે તેથી જ શાસ્ત્રમાં લખ્યું ‘ધર્મ જાગતા ભલા ને પાચી ઉદ્ઘતા ભલા’ નિદ્રાનું કામ થતા વધારે સ્હૂર્તિધી આરાધના કરે માટે તેમને ઉદ્ઘામાં પક્ષ ધર્મનું સ્મરણ છે. માટે પ્રથમ નંબરે તે ધર્મ છે કે સંસારની દરેક પ્રવૃત્તિમાં પક્ષ એનાથી વિપરીત ધર્મનું સ્મરણ કરવામાં આવે. સંસારની પ્રવૃત્તિ કરવા છતાં તેમાં રાગ પેદા ન થાય, ધીરે ધીરે તે પ્રવૃત્તિઓ ઓછી ધાર્ય, ધર્મની પ્રવૃત્તિઓ આવે.

આ રીતે સ્મરણ આરાધના પાપના સ્મરણનો, પાપનો અને પાપની રૂચિનો નાશ કરે છે. ધર્મમાં ઉત્તોતર આગળ વધારે છે.

ધર્મમાં આગળ વધતાં પાપનો ભય અને ધર્મની અનુમોદના જાગવી જોઈએ. ‘કોઈ પક્ષ સંયોગમાં મારે ધર્મ કરવો જોઈએ’ આવું જેના છદ્યમાં ઉત્તરે તે સહેલાઈથી ધર્મ કરી શકે.

જેને પાપનો ભય જાગ્યો છે તે સંસારથી છુટવા માટે ધર્મ કરે પરંતુ જેને પાપની ઓળખાશ નથી- આત્માના અશુભ પરિણામો ઓળખાશ નથી તે આત્મા પક્ષ ધર્મ કરે, ધર્મ કરવો જોઈએ. ધર્મ કરવાનો અધિકાર પ્રથમ નંબરે

સમજુને અને બીજા નંબરે સમર્પિત આજાસમજુને છે.

ધર્મ પરમાત્માના વચનો પર શ્રદ્ધા કરાવે છે. તેના સાંસારિક વ્યવહારો ઓછા કરે. પ્રવૃત્તિમાં ધર્મ ભણે તે પછી પ્રવૃત્તિ ધર્મનું સ્મરણ કરાવે.

અંતવખતે જેને નવકાર યાદ આવે તેની સદ્ગતિ જ થાય. તેથી એક વસ્તુ નકી થઈ કે જેના સ્મરણની અંદર આરાધનાના માર્ગો, દાન-શીલ-તપ-પંચપરમેષ્ઠી આવે તે ધર્મને યોગ્ય બને છે, સદ્ગતિ મળે છે. બાળજીવો માટે પહેલું પગથિયું ધર્મનું સ્મરણ કરવું તે છે. જે ગમે તે, જેટલો ગમે તે ધર્મને બાળજીવો આરાધી શકે છે.

ચૂર્જાની ગોળી સ્વાદ માટે બે તો પણ દવાનું કામ બેગુ થાય તેમ ફાવે તેટલો બોડો પણ ધર્મ કરે તો તે આત્માને પુષ્પ આપે-ધર્મને યોગ્ય બનાવે.

આ રીતે લોક વ્યવહારથી-શોખથી-ગતાનુગતિકથી કે કંઈક સામાન્યરૂપથી કરાતો ધર્મ સ્મરણરૂપ ધર્મ થાય. જેમ મકાનનું સ્ટેચ્યુ-મોડલ એ મકાન નથી પણ મકાનનું સ્મરણ કરાવે છે. તેમ કંઈક આદરવાળો-વિષિવાળો-બીજા અંગો વગરનો અધૂરો પણ ધર્મ ધર્મનું-આત્મગુણોનું-પુષ્પનું સ્મરણ કરાવે. પાપનો પાપ તરીકે ઘાલ આપે.

બીજાને દેખાડવા માટે ધર્મ કરે તો વિશિષ્ટપુષ્પ ન મળવા છીતાં પાપ ન મળે, પુષ્પ મળે. બીજાને દેખાડવા માટે અત્તર છાંટીએ તો સુંગં જ આપણાને મળે, મોઢું ધોઈએ તો હંડક આપણાને જ મળે.

કોઈના પર ગુરુસો કરીએ તો સામે કંઈ થાય કે ન થાય પરંતુ આપણાને પાપ અને દુઃખ મળે. તેથી શાસ્ત્રમાં લખ્યું કે 'સિપાઈ-જેલર વિ. ના બંધા કરવા નહીં, વારંવાર ત્યાં રૂવાલ કરવો પડે. ભલે ત્યાં શરૂઆતમાં કૃત્રિમ ગુરુસા કરીએ પરંતુ વારંવાર થતા તે સ્વાભાવિક થઈ જાય. જેમ વારંવાર કરાતા કોથાઈ સ્વાભાવિક થઈ જાય છે તેમ બતાવવા માટે ક્રમા- નાના વિ. રાખીએ તો ક્રમાદિ પણ સ્વાભાવિક થઈ જાય. માટે તેવો ધર્મ સંસારમાં રખડાવે- દુર્ગતિમાં મોકલે- પાપ બંધાવે આ ખોટું છે. સદ્ગતિ અને શુલ્કર્મ બંધાવે.

ઉંચી આરાધના નથી તેથી ઉંચી સદ્ગતિ ન મળે પણ હુર્ગતિ પજી ન થ  
ચક્કવતિનો ઘોડો સાધનના અભાવે બ્રહ્માયર્પ પાળે અને આઠમા દેવલોકે જાય.  
મેતાર્ય મુનિના જીવને પૂર્વભવમાં પરાણે દીકા આપી હતી.

પર્મમાં આદર એ પર્મની યોગ્યતા છે. બાપની સામે ત્રશ છોકરા બેઠા હોય  
તેમાંથી (૧) આદર- બુદ્ધિથી જુવે અર્થાત્ સામાન્ય રૂપિ- પ્રસન્તતા હોય. (૨)  
વિશીષિત આદર બુદ્ધિથી જુવે (૩) અવજ્ઞાબુદ્ધિથી જુવે, જે કરવાની ઈચ્છા ન  
હોય પણ સામે ચાલતું ન હોય તેથી કરવું પડે અને જેમ તેમ કરે તે અવજ્ઞા. આ  
અવજ્ઞા નીચ્યગોત્રાદિ પાપ બંધાવે. તેમ પર્મ ગ્રન્થે પજી ત્રશ અભિગમ હોઈ  
શકે....

(કામ કરવાની સાથે કર્તવ્યબુદ્ધિ-આદર જોઈએ. પરમાત્માની પૂજા કરતી  
વખત પબાસણને હાથ-પગ અડે, ધોતિયુ-ખેશ અડે તે ન ચાલે. તેવી રીતે મોકે  
રૂમાલ બાંધ્યા પછી હાથ ધોયા વગર પૂજા ન કરાય.

ભગવાનની પલાઠીને મસ્તક ન લગાડાય, એ સમર્પિત ભાવ નથી. અવજ્ઞા  
છે. હાથ સિવાય કોઈ પજી અંગ અડવું ન જોઈએ.

આદરપૂર્વક કરાયેલ આરાધના પુરુષ બંધાવે અને તે તદેતું અનુઝાન કરેવાય.  
પુરુષ દેવ-ગુરુની સામગ્રી આપે અને ભવિતવ્યતા પાકી ગઈ હોય તો મોકે પજી  
પહોંચાડે.)

અંતમો ભગવાનને કઈ રીતે આરાધયા, કઈ રીતે વચનને અનુસરવું તે  
સ્મરશ્ય છે. અત્યારે જે પર્મ ચાલે છે તે સ્મરશ્ય રૂપ ધર્મ છે. આ ગમે છે માટે કરવું  
તે સ્મરશ્યધર્મ.

શરણ :- આ સંસારમાં કેવળ હુંખ છે. કેવળ રખવાનું-રખવાનું છે,  
ભગવાનના ધર્મ સિવાય નિસ્તાર નથી આવી ભાવના તે શરણ.

ઓપરેશન વખતે દાનિ ડૉક્ટર ઉપર કેટલો સદ્ગ્યાવ હોય છે? શરણભાવ  
હોય છે?

આપણે અશરણ છીએ તેવી બુદ્ધિ હોય ત્યારે શરણધર્મ આવે.

પ્રશ્ન :- આપણે અશરણ રોમાં છીએ? ધરમાં, ધનમાં, કુટુંબમાં, આરોગ્યમાં, માનવાનમાં, રોમાં અશરણ?

ઉત્તર :- લૌકિક સુખો-પદાર્થો તમામ બાબતો અશરણ છે. આરોગ્ય ભવોભવ રહેવાનું નથી. મરતા સુધી પણ નથી રહેતું. કુટુંબ મરતા સુધી વજાદાર રહેવાનું નથી, માન છેક સુધી સચવાવાનું નથી. ક્યારે જીશે તે બબર નથી. શરણરૂપ ધર્મ માટે હુંયાંની બાબતોમાં અશરણબુદ્ધિ જોઈએ.

જેને એવું લાગે કે મારું આરોગ્ય સારુ છે. અર્થાતું આરોગ્ય મહત્વનું ધર્મ જાય તે તપ વિ. ન કરે. ધન મહત્વનું થાય તે સાત બેત્રમાં ઉદારતાથી ધન વાપરી ન શકે. અર્થાતું તેને ધનાદિમાં શરણબુદ્ધિ છે. તેથી તે વિશિષ્ટકોટિનો ધર્મ કરી શકતો નથી.

સનતકુમારને ક્ષણવારમાં કંચન જેવી કાયામાં એક સાથે ૧૬ રોગ ઉત્પન્ન થયા. પંજાબમાંથી કરોડપતિઓ પણ પહેરેલે કપડે અહીં ભાગીને આવ્યા. પ્રદેશી રાજાને પોતાની વહાલી રાણીએ જ પારણામાં જેર આપ્યું. દરિયે પડતા સુભૂમયકર્તિને ૧૬૦૦૦ દેવતાઓ બચાવીન શક્યા. આ બધા ગ્રસંગો સંસારમાં કોઈ શરણ ભૂત નથી એજ એકવાત પોકારે છે.

અશરણબુદ્ધિ વાળો આપત્તિના સમયે-હાયવોય ન કરતાં-બીજા પાસે શરણ માટે ન ભટકતા ધર્મના શરણો જાય.

જે કોઈ ભાવધર્મ તે શરણરૂપ ધર્મ છે, જે વિશિષ્ટ ભાવ વગરનો ધર્મ છે તે સ્મરણ ધર્મ છે.

સમર્પણ :- બાપ-દિકરો બને જુદા કહેવાય એક જ ન કહેવાય છતાં દિકરાનો બાપુણ કહે તે મારે કરવું. કોઈ દલીલ ન કરવી. તેઓના વચનપાલનમાં જ મારુ હિત સમાપેલું છે. આવો ભાવ તે સમર્પણ છે. આજે માનવું કાલે ન માનવું, ફાવતુ માનવું-કરવું તે સમર્પણ નથી.

જે શાસ્ત્રના વચન પ્રમાણો વર્તતો હોય-અપમાદી હોય- આચાર્યવૃત્ત હોય તેને સમર્પણ ધર્મ હોય.

### અભેદ :- સમાપ્તિ

બગવાન અને હું જુદા નથી, હું જ પરમાત્મા છું આ ભાવ તે અભેદધર્મ, આને બીજા અર્થમાં અસંગાળુંછાન કહેવાય, આ ધર્મવાળાને ઉધમાં પણ બગવાનના વચનની વિરુદ્ધ કોઈ કાર્ય ન કરે, ધર્મની એકમેકતાથી સ્વભાવિક જ પાપપ્રવૃત્તિ ન હોય.

સ્મરણધર્મ નવાપર્મ પામેલાને-કંઈક ભાવવાળાને હોય, શરણધર્મ શ્રાવક+સાધુમાં હોય, સમર્પજધર્મ સાધુઓમાં હોય, અને અભેદધર્મ અપ્રમાણ સાધુ અને શ્રેષ્ઠિવાળા જીવોને હોય.



**પ.પુ ગરણાદિપતિ આચાર્યએવ  
 શ્રીમદ્ વિજય જ્યથોપસ્તૂરીશરાજુ મહારાજાનો  
 સાત્ત્વિક સાહિત્ય રસ બાળ**

ભાવનાનું ઉધાન (બીજુ આવૃત્તિ)	૧૩-૦૦
ચલો શાંતિ કે ઉપવનમેં (હિંદી)	૧૦-૦૦
ચિત્પ સૌંદર્ય (બીજુ આવૃત્તિ)	૮-૦૦
દર્શન સુધા	૨૮-૦૦
પંચસૂત્ર સ્વાદયાય	૧૧-૦૦
કર્મકલંકને દૂર નિવારો	૧૧-૦૦
ચિંતન ચંદરથો	૧૨-૦૦
વહે મીઠી વાણી (બીજુ આવૃત્તિ)	૧૨-૦૦
લીરો એક પાસા અનેક	૩૦-૦૦
ગુરુપંડન પલ્યક્ખાણ ભાગ્યના રહણથો	૧૦-૦૦
એક ઉક્ખયન મુંદિત ભાણી	૧૨-૦૦
શ્રાવકજન તો તેને કહીએ	૧૨-૦૦
પાને પાને વસંત	૨૦-૦૦
અમૃતવાણી લો પીછાણી	૧૮-૦૦
સાધનાથી સિદ્ધ જાણી	૨૫-૦૦
ગીતાર્થની વાણી અનુભવની ખાણી	૧૬-૦૦
આગમ દરિયો રલો ભરીયો	૪૦-૦૦
ચિંતનયાગ્રાથી યેતનયાત્રા	૩૦-૦૦

॥ અનુષ્ઠાન ॥

Digitized by srujanika@gmail.com